

વार्षिक लवाजम 3. १५०/-

वर्ष : ४८મું

એપ્રિલ - ૨૦૨૧

અંક - ૫૧૫

મંગલ મંદિર • એપ્રિલ-૨૦૨૧ • ૧
(કુલ પાણા : ૫૦)



મંગલ મંદિર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનું માસિક મુખ્યપત્ર



કોરોના મહામારીના વિકટ સમયમાં
ઓનલાઇન વાર્ષિક પરીક્ષા આપતા
સમાજના દરેક છાત્રોને સફળતા
માટે હાઇક્યુર શુભ કામનાઓ....

મુખ્ય કાર્યાલય :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માતુશ્રી સાકરબહેન રવજી મોરારજી લાલન (કોડાય-સુપીમવાલા)

શ્રી કચ્છી જૈન ભવન

૪૩-૪૪, બાહ્યા મિત્રમંડળ સોસાયટી, પાલડી, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬

ફોન : (૦૭૯) ૨૬૫૭ ૮૮૯૨, ૨૬૫૮ ૧૫૦૧, ૪૮૯૦ ૬૦૦૧ તો ૬૦૦૬

Email : kjssmangalmandir@gmail.com • Web site : www.kuthchijainahd.org

તંત્રી મંડળ :
પ્રતાપ નારાણજી દંડ - મુખ્ય તંત્રી
દિનેશ આર. મહેતા - સહંત્રી

યથાર્થ સામિત થયો.....

‘મંગલ મંદિર’ – તંત્રી લેખ (સપ્ટેમ્બર-૨૦૨૦)

“સાવધાન....! હજુ કોરોના વાયરસે દુનિયાનો પીછો છોડ્યો નથી ...”

આ મથાળા સાથે તે તંત્રીલેખ પ્રકાશિત થયો હતો.

ઉપરોક્ત તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું કે... “....કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ હજુ કાયમ છે. તે દૂર થઈ નથી... ભાગી ગયેલ નથી... કે નાખૂં થયેલ નથી.” આ તંત્રીલેખની વિગત આજે વાસ્તવિક સ્વરૂપે આપણી સામે છે... લોકો અનુભવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે... ઉપરોક્ત અગમયેતીની વિગતનું સમર્થન રાજકોટ સ્થિત એક વાયક પુષ્પા જ્યંતીલાલ શાહે તેમના પ્રતિભાવ સ્વરૂપે કર્યું હતું. જે ‘મંગલ મંદિર’ના માસ ડિસેમ્બર-૨૦૨૦માં ‘આંજો કાગર’ વિભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ. તેમણે પ્રતિભાવમાં લખ્યું હતું કે માસ સપ્ટેમ્બર-૨૦૨૦નો તંત્રીલેખ ખૂબ જ સમયસરનો... એક અગમયેતીરૂપે... લોકોને લાલબંતી સમાન ખૂબ જ સમયસરનો કહેવાય... આ પ્રકારનો હતો એક પ્રતિભાવ.... આ હતા તેમના શબ્દો....

રોગ અને સાવધાની....

- દરવાજાના બેલ, હેન્ડલ વગેરેને સીધો હાથ ના લગાડો.
- દુમાલ કે ટીસ્યુ પેપર હાથમાં રાખીને કામ કરો.
- અન્ય સ્થળોથી આવતાની સાથે ઘરના ફર્નિચર, દીવાલ તથા અન્ય સાધનોને હાથ ધોયા વગર અડવું નહીં.
- સાધન - સામગ્રીને સેનેટાઇઝર વડે સાફ કરવા તથા તેની સપાટીને સાફ કર્યું પછી જ વાપરવા.
- હંમેશાં માસ્કનો ઉપયોગ કરો. જ્યારે માસ્ક કાઢો ત્યારે તેને સીધું જ ઢાંકણાવાળા ડસ્ટબીનમાં નાખો.
- હાથ ધોવામાં સમય, સાખુ કે સેનિટાઇઝરની કરકસર અથવા આણસ કરવી નહીં. કાળજીપૂર્વક હાથ ધોવા.
- આવીને ઘરના સભ્યોને મળતા પહેલાં બહારના કપડાં ધોવામાં નાખવા.
- બહારથી આવીને તુરત સાના કરવું જરૂરી છે.

આ રીતે ભયમુક્ત અને સાવધાનીયુક્ત જીવન અગર જીવવામાં આવે તો અવશ્ય કોઈ રોગના ભરડામાંથી બચી શકાય.

કોરોના સંક્રમણથી બચવા..... સાવયેતી રાખીએ

- ☞ માસ્ક પહેરો
- ☞ હાથ વારંવાર સાખુ કે સેનેટાઇઝરથી સાફ કરો તથા
- ☞ બે મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખો.

**કોરોના - વેક્સિન
અભિયાનને
સફળ બનાવો....**

કોરોના વાયરસ

- સાવધાન રહો.
- સતર્ક રહો અને
- સુરક્ષિત રહો...

જાણકાર બનો... સતર્ક રહો...

સાયલર છેટરપિંડી ચાપટી વગાડતામાં થઈ શકે છે. તમારી અંગત માહિતી જેમ કે કાર્ડ વિવરણ, બેંક એકાઉન્ટ, આધાર, પેન વગેરે વિશે કોઇને કદી જણાવશો નહીં.

સમજદાર બનો.
તમારી કે.વાય. સી.ની
વિગતો કોઈને પણ
જણાવશો નહીં.

જો કોઈ તમારી પાસે
તમારા કાર્ડની વિગતો,
બેંક એકાઉન્ટ નંબર અથવા
અંગત માહિતી માંગો
તો તરત ફોન કાપી નાખો.

છેલ્લા ૪૫ વર્ષથી દર મહિનાની ૫ તારીખે
નિયમિતપણે પોસ્ટ કરવામાં આવતું
“શ્રી કાચી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું
મુખ્યપત્ર

મંગલ મંદિર

મુખ્ય કાર્યાલય

શ્રી કાચી જૈન ભવન,
૪૩-૪૪, શ્રી બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
પાલડી, એલિસાબિઝ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.
ફોન : (૦૯૬) ૨૬૫૭૮૮૮૨, ૨૬૫૮૧૫૦૧
ફેક્સ : (૦૯૬) ૨૬૫૮૮૦૬૦
ઈ-મેઇલ : kutchijainamd@gmail.com
વેબ-સાઇટ : www.kutchijainahd.org

તંત્રી

પ્રતાપ નારાણાજી દંડ

સહ તંત્રી

દિનેશ આર. મહેતા
મો. ૯૯૨૪૩ ૪૨૬૨૮

અંકમાં પ્રાસિધ્ય થયેલ લેખો તથા અન્ય વિભાગની
માહિતીઓ સાથે તંત્રીમંડળ સહભાત છે તેમ માની લેખું
જરૂરી નથી. રજૂ થયેલ વિચારો જે તે વ્યક્તિના હોય
છે, જેની નાંખ લેવા વિનંતી.

લેખકોને નમ્ર વિનંતી

‘મંગલ મંદિર’માં પ્રગટ કરવા
માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી
અમને મળતી રહે છે અને એટલે
સ્વીકૃત કૃતિઓને પ્રગટ કરવાનું પણ
સ્વાભાવિક રીતે વિલંબાય. મંગલ
મંદિરના ધોરણને ધ્યાનમાં લઈ,
પોતાની રચના મોકલતી વખતે વેપક
સ્વવિવેક દાખલે તેવી વિનંતી છે.

એક સાથે એકથી વધુ કૃતિઓ
ન મોકલવા વિનંતી.

ભાષાદોષ અને લાંબા લેખો
અસ્વીકાર્ય બનશે તેની નાંખ લેવા
વિનંતી. લેખમાં એકની એક વાતનું
પુનરાવર્તન (રિપોર્ટન) ટાપું
જરૂરી છે. કૃતિની હસ્તપત્ર સ્વચ્છ
અને સુવાચ્ય હોવી જોઈએ. આશા
છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો
સહકાર અમને મળી રહેશે.

- મુખ્યત્વી

આનુક્રમણિકા

તંત્રી લેખ :

- ભારતની આજાદી નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી અને
ડિજિટલ જગતમાં જોખ્સ માટે વિશાળ તકોનું નિર્માણ ૫

દીપશીખા

- Be the best • You can ડૉ. પૂજા કોટક ૭

વિચારમંચ

- સિદ્ધાંતવાદી બનીને જીવનું કે પ્રેક્ટિકલ બનીને??!! ડૉ. યાસીન દલાલ ૮
- તમારે તાં ફેવિકોલ છેં? દિનેશ પાંચાલ, જનાલિસ્ટ ૧૦

ગુલશાન (ચાતુ શ્રેણી) (મણકો-૪)

- “દિલની જાબાન” :
શબ્દના સાધક : કવિ ક્રિતિકાન્ત પુરોહિત ચંદ્રકાંત પટેલ ‘સરલ’, સાહિત્યકાર ૧૨

દાતિહાસ

- ૧૩ એપ્રિલ એટલે જલિયાંવાલા બાગનો નરસંહાર ડૉ. મિહિર અમ. વોરા ૧૫

સંસ્કૃતિ

- વિદેશી અને આપણી સંસ્કૃતિ – કોણ ચેડે? ભાવના હીરપરા ૧૮

નવલિકા

- આવ જ્ઞાનાં આવ! નટવર આહિલપરા ૧૯

પરિવર્તન

- ધી ના ધામમાં ધી અમ. ડી. સોલંકી ૨૦

વિકાસ

- કણાનું મહાર પારુલ દેસાઈ ૨૩
- ‘સભકા સાથ, સભકા વિકાસ’ દોશી મહેન્દ્ર સાકરયંદ ૨૪

કચ્છ

- કાચ્છના કલ્યાણાજીની નીતિએ નિર્માયું મુંબઈનું કલ્યાણ નરેશ અંતાણી, જનાલિસ્ટ ૨૫

નારી ગૌરવગાચા-૧ (નવી શ્રેણી)

- ત્યાગમૂર્તિ : ભારતીય નારી ‘અનિકા’ ચંદ્રકાંત પટેલ ‘સરલ’ ૨૬
- સેકડો દીકરીઓને મદદરૂપ બનતી : નિર્ણિતા રાજપૂત પ્રવીણભાઈ જી. મેંદપરા ૨૮
- કુદરતનું મહાન સર્જન... નારી જાતિનું સંન્માન કરીએ ગિરધરલાલ ચે. સોલંકી ૨૯

સુભિરે... બલનીરા, સૃતિપટ પર સંભારણાં (સંકળન : બલવીરસિંહ જડેજા)

- પ્રિન્ટિંગ મિસ્ટેક ભરત અંજારિયા ૩૦
- શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી, આમ છતાં... શરદભાઈ ભૂટક ૩૦

સ્વારસ્ય

- વર્લ્ડ સ્લીપ-૨ (World Sleep Day) – (૨) ડૉ. મણિલાલ ગડા, મનોચિકિત્સક ૩૧
- ડૉ. દિંતી શાહ (ગડા), બાળકો તથા પુણ્યવિષય માનેના મનોચિકિત્સક

દાર સંસાર

- હેત અને Hate ભાવનાનેન આર. શાહ ૩૨

<p>શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના ‘પદાર્થકારીક્રીઓ’</p> <p>મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપ નારાણજી દંડ ઘર : ૦૯૮૯-૨૬૪૦૫૦૪૭ મો. ૮૪૨૬૭ ૨૫૬૧૮</p> <p>ઉપપ્રમખ-૧ શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ ઘર : ૨૬૪૪ ૬૪૧૩, ઔ. ૨૬૪૦ ૧૧૫૦ મો. ૮૮૨૫૦ ૩૧૫૨૮</p> <p>ઉપપ્રમખ-૨ શ્રી શાંતિલાલ મુજજી સાવલા ઘર : (૦૨૭૭૧) ૨૩૪૪૫૫ મો. ૮૮૨૫૦ ૪૮૬૪૫</p> <p>માનદ મંગી શ્રી પ્રેરીપ સૂરજલાલ મહેતા ઘર : ૨૬૧૧૨૦૮૮ મો. ૮૮૨૫૦ ૬૧૧૬૦</p> <p>સહમંગી શ્રી રોહિત સંધી</p> <p>અજાનચી શ્રી ચંદ્રકાંત દામજી શાહ ઘર : ૨૬૬૦૫૨૪૫</p> <p>સહ અજાનચી શ્રી રજનીકાંત ધરમશી પારેખ મો. ૮૮૬૮૦ ૫૩૫૨૧</p> <p>શ્રી કચ્છી વિશ્વામ ગૃહનું સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી કચ્છી વિશ્વામ ગૃહ અરિંદતનગર દેરાસાની સામે, ગાંધી વિધાવથી ગલીમાં, રચના સ્કૂલની પાછળ, રાજસ્થાન હોસ્પિટલ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૦૯૮૯-૨૨૮૮૮૫૪૯૭</p> <p>સેવા ભવનનું સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત માતૃશ્રી કંકલેન કાન્ઝુભાઈ રવજુ (નાની ખાખરલા) સેવા ભવન, એસ. ટી સ્ટેન પાસે, સંકાર ગેસ્ટ હાઉસની સામે, રાજનાથપુરા, અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૯૮૯-૨૫૪૬૧૨૭૦</p> <p>‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ www.kutchijainahd.org ઉપર... ઉપરાંત.... www.hellokutchis.com ઉપર વાંચી શકાય છે.</p>	<p>કારકિદી</p> <ul style="list-style-type: none"> ● હોબી માટે વ્યક્તિગત કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? હીરેન દવે ૩૩ <p>કલ્યાણ</p> <ul style="list-style-type: none"> ● નિર્જરા માટે સરળ રસ્તો : સામાયિક-૭ પૃષ્ઠાલેન કનકસેન શાહ ૩૪ <p>YOUTH CLUB</p> <ul style="list-style-type: none"> ● Some Golden Thoughts Presentation : Dinesh R. Mehta ૩૬ <p>ગોમસ જોવેરી</p> <ul style="list-style-type: none"> ● આંકડાઓની આંટીઘૂંઠી ● જો અને તો સંકલન : કિરણલેન પી. ૬૫૫૨ ૩૭ ● તમારા ફેવરિટ ફિલ્મી પાત્રોને ઓળખો.. ભાવના એ. ઝવેરી ૩૮ <p>મનોરમ્ય</p> <ul style="list-style-type: none"> ● ભૂલાયો ટપાલી : રમેશ પટેલ ● માણસ : રમેશ પટેલ ૩૮ ● આ વાત છે : આલિદ ભડુ ● દેખાય છે : ચંદ્રકાંત પટેલ ‘ભરત’ ● ગંભીર : હરીશ પંડ્યા ૩૯ ● પ્રભુ! પ્રાર્થના હૃદયની આ મારી / મા જમાડે તે ગમે : ડૉ. નટુભાઈ પી. પંડ્યા ૪૦ ● પ્રતીક : જગૃતિ તત્ત્વ ‘જાનકી’ ● તથ્ય : જસ્મીન દેસાઈ ‘દર્પણ’ ૪૦ <p>મહાત્વની માહિતી</p> <ul style="list-style-type: none"> ● દેશ વિદેશનું અવનવું ● ગતિના નિયમ ● ઈલેક્ટ્રિકમાં ટ્રાન્સફોર્મર શું છે? ૪૧ ● મહત્વની માહિતી : વિશ્વનો અલભ્ય ગણતરી યંત્ર ૪૨ <p>વૈવિધ્ય</p> <ul style="list-style-type: none"> ● જગત જનની સી... નારી તું નારાયણી જગૃતિ ચંદ્રશીલ મહેતા ૪૨ ● બા ડૉ. મેહા સંધી ૪૩ ● પુસ્તક : ‘મુકનકોની મહેફિલ’નું વિમોચન ૪૩ ● ભૂજની લાલન કોલેજના સ્ટાર વિદ્યાર્થી અને જાણીતા સેવાભાવી ડૉ. કનુભાઈ ગણેશાનું નિધન રજૂઆત : પ્રા. સૂર્યકાંત ભડુ ૪૪ ● કચ્છ રામાયણા ખાતે ગૌરકશક ગીતાબેન રાંભિયાના સ્મૃતિ સ્મારકનું અનાવરણ ૪૪ ● આંતરરાષ્ટ્રીય મહિલા ટિવસે શ્રેષ્ઠ યોગ ટીચરનું સંભાન ૪૫ ● આંજો કાગર ૪૬ ● અન્ય સંસ્થાઓના સમાચાર ૪૮ ● કચ્છ દર્શન સંકલન : દિનેશ આર. મહેતા ૫૦ <p>નિયમિત વિભાગો</p> <ul style="list-style-type: none"> ● Nano Nine શાબ્દ ૨મત-૧૭૦ સંકલન : રજનીકાંત પારેખ ૫૧ ● Nano Nine Sudoku (કમાંક-૧૧૨૮) સંકલન : રજનીકાંત પારેખ ૫૩ ● બાલુંડે જ્યું ગાલિયું સંકલન : ગુલાબચંદ ધારશી રાંભિયા ૫૪ <p>શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ</p> <ul style="list-style-type: none"> ● સમાજ દર્પણ ૫૫ ● સંસ્થા સમાચાર ૫૬
---	--

Printed & Published by : Mr. Pratap Dand, For Shri Kutchhi Jain Seva Samaj - Ahmedabad.

Printed at : Gajanand Offset, Amraiwadi, Ahmedabad.

Published at : Shri Kutchhi Jain Seva Samaj – Ahmedabad, 43/44, Brahman Mitra Mandal Soc., Opp. Navchetan High School, Paldi, Ellisbridge, Ahmedabad-380 006. ● Editor : Mr. Pratap Dand ● Yearly Subscription : Rs.150/-



તંત્રી લેખ

ભારતની આગામી નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી અને ડિજિટલ જગતમાં જોબ્સ માટે વિશ્વાળ તકોનું નિર્માણ....

કોરોના મહામારીને કારણે જે પરંપરાગત કામ-ધંધા ઓનલાઈન ચાલી શક્યા નહીં એમને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે. બીજુ તરફ ડિજિટલ જગતમાં નામ ધરાવતી જાણીતી કંપનીઓ તથા ફેસબુક, ગૂગલ, એમેઝોન, ફ્લીપકાર્ટ વગેરેની આવકમાં સતત વધારો થતો રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ ઓનલાઈન ઓર્ડર લેનારા રેસ્ટોરન્ટ, પ્રોવિઝન સ્ટોર્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જેવા યુનિટોની લોકોએ પસંદગી કરી. આ રીતે તેમની આવકનો ફ્લો પણ ચાલુ રહ્યો. આજના માહોલમાં ધંધા - રોજગાર હવે ડિજિટલ પ્રક્રિયાના રસ્તે નહીં ચાલે તો પાછળ રહી જશે. તેમની પ્રગતિ અટકી જશે. એટલે જે લોકો ડિજિટલ જગતમાં નથી તેમણે ડિજિટલ કામકાજની જાણકારી મેળવવી પડશે.

ધંધા - રોજગાર સિવાય જોબ-નોકરી શોધવા માટે પણ અલગ - અલગ ડિજિટલ સાઈટ છે. જેમાં વૈશ્વિક સ્તરે એક જાણીતી સાઈટ Linked-in (લિંકડ ઇન) છે. તે સાઈટ દ્વારા, નક્કી કર્યા મુજબના સમયે વર્તમાન જોબ્સ ટ્રેન્ડ અને ભવિષ્યની તક માટેનો અહેવાલ વૈશ્વિક સ્તરે રજૂ થાય છે. તાજેતરમાં વર્ષ ૨૦૨૧ માટેના તેના અહેવાલની રજૂઆત થઈ છે.

વર્તમાન સમયમાં કચાં અને કેવા પ્રકારની નોકરી - જોબની તક છે અને આવતા બે વર્ષ સુધી તેની પરિસ્થિતિ કેવી હશે તથા કેવી ભરતી થતી રહેશે તેની વિગતવાર માહિતી તેમાં આપવામાં આવી છે.

એ અહેવાલ મુજબ કચાં જોબ - નોકરીની તક છે તેની સમીક્ષા કરીએ તો જણાય છે કે....

● હેલ્પ કેર આધ્યારિત સ્ટાફ

કોરોના મહામારીના સમયે ઘણા ટેશોને ખબર પડી કે આપણી પાસે આવી મહામારીને પહોંચી વળવા જરૂરી મેડિકલ સાધનો નથી અને તે ક્ષેત્રનો અનુભવી સ્ટાફ પણ નથી. હવે એવી સ્થિતિ ન સર્જય તે માટે હેલ્પકેર સેન્ટરમાં તેને સંબંધિત સ્ટાફની મોટી જરૂર પડશે. આ ક્ષેત્રમાં લગભગ ૧૫ પ્રકારની નોકરીમાં ભરતી અનિવાર્ય હોતાં, તેની ભરતી થઈ રહી છે. તબીબી સારવાર માટે નર્સની ભારે અધ્યત વર્તયા છે.

● ડિજિટલ માર્કેટિંગ

યુવાવર્ગ નોકરીની દરેક જગ્યાએ શોધખોળ કરવા કરતાં ડિજિટલ માર્કેટિંગની તાલીમ લઈને તેની કામગીરી કરી શકાય છે. આ માટે કોઈ કંપની હોય કે વ્યક્તિ, તેને ડિજિટલ જગતમાં ટકી રહેવા સતત લોકોની વચ્ચે રહેવું પડે. માર્કેટિંગના પરંપરાગત રસ્તાને બદલે ડિજિટલ માર્કેટિંગના તજ્જોની જરૂર રહેશે. આ ક્ષેત્રની જરૂરત આગામી દસ વર્ષ સુધી સતત રહેવાની છે.

● કન્ટેન્ટ કિએટર

ડિજિટલ માર્કેટિંગની સાથે સાથે કન્ટેન્ટ કિએટરની ખાસ જરૂર પડે છે. તેની કાર્યવાહીમાં મુખ્યત્વે વાંચન અને ઓનલાઈન દર્શાવાતી સામગ્રીઓ છે. કોઈ બ્રાન્ડને યોગ્ય દિશામાં પ્રમોટ કરવી હશે તો તેની વિગત લખનારાની જરૂર રહેશે. આમાં પરંપરાગત રીતે લખનારા નહીં પરંતુ ડિજિટલ માદ્યમોની જરૂરિયાત દ્યાનમાં રાખીને વિગત લખી શકે તેવા મોડર્ન રાઇટરોની ડિમાન્ડ છે અને ભવિષ્યમાં પણ રહેશે.

● એજ્યુકેશનલ પ્રોફેશનલ

ઓનલાઈન અભ્યાસ કરવો અને અભ્યાસ કરાવવો, કેવો અને કેટલો અભ્યાસ કરવો – એ બધી બાબતો સમજાવવા અર્થે

શિક્ષણ સંસ્થાઓને, કોર્પોરેટ યુનિટોને, એકેડેમી તાલીમ આપતી સંસ્થાઓ વગેરેને એજયુકેશન પ્રોફેશનલ્સની ખાસ જરૂર તિલી થઈ છે કારણકે હવે ઓનલાઇન શિક્ષણનો ચુગા શરૂ થયો છે, વર્ક ફોમ હોમનો સમય આવ્યો છે.

● બિઝનેસ ડેવલપમેન્ટ

કોરોના મહામારીના પગલે મોટાભાગના ધંધામાં હાલે મંદી છે. એમાંથી કેવી રીતે બહાર આવવું? નવા અને જરૂરથી બદલાયેલા સમયમાં પોતાનો બિઝનેસ કર્ય રીતે વિસ્તારવો અથવા તો તેજ ગતિથી ચાલુ રાખવો – આ બધી પ્રક્રિયા સમજવા માટે અને ભવિષ્યમાં આવનારી તકોનો લાભ કર્ય રીતે લેવો તેની કામગીરી અર્થે બિઝનેસ ડેવલપર અથવા તો સેલ્ફ પ્રોફેશનલની આવશ્યકતા હવે જણાય છે. ગ્રાહકો સાથે સંબંધ જાળવવા, સેલ્સ ટીમ તિલી કરવી, ધંધાની નવી તકો તપાસવી વગેરે કામકાજનો તેમાં સમાવેશ થાય છે.

● ફન્ટલાઇન ઈ-કોમર્સ પ્રોફેશનલ્સ

આજે કંપનીઓ પાસે પોતાની પ્રોડક્ટ છે પરંતુ એની ડિલિવરી કરવા માટે પૂરતો સ્ટાફ જોઈશે. એટલે આ ક્ષેત્રમાં સતત ભરતી થતી રહી છે. કારણકે ઓનલાઇન ઓર્ડરનું પ્રમાણ વધવાનું જ છે.

● મેન્ટલ હેલ્થ નિષ્ણાતો

કોરોના સંકમણના સમયે લોકો ધરમાં રહીને માનસિક રીતે થાક્યા હતા. આ પ્રકારનો થાક મગજ પર અસર ન કરે તે માટે માનસિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોની જરૂરત રહેવાની છે. કારણકે આજના વૈશ્વિક માહોલમાં લોકોની માનસિક સમસ્યાઓ ઓછી થવાની નથી.

● ડેટા વૈઝાનિક અથવા નિષ્ણાત

ઈ-મેઈલ, ઓનલાઇન, મોબાઇલ વગેરે માધ્યમોના કારણે વ્યક્તિ, ગ્રાહક, સંબંધિત એજન્સીઓ, ચીજવસ્તુઓ લેનાર - વેચનાર વગેરેનો ઓનલાઇન ડેટા વધતો જાય છે. મોટી કંપનીઓ, યુનિટો પાસે હજારો - લાખોની સંખ્યામાં યુર્જર્સ - કલાયન્ટ હોય છે. એ બધાનો ડેટા વ્યવસ્થિત રીતે રાખવો, મેનેજ કરવો એ બધું કામ ડેટા નિષ્ણાતનું છે એટલે તેની જરૂર સતત રહેવાની છે.

● ટેકનિકલ એક્સપર્ટ

દરેક કંપની, ચુનિટો, મશીન, કમ્પ્યુટર, મોબાઇલ, ગેજેટ્સ વગેરેની કામગીરી માટે ટેકનિકલ નિષ્ણાતોની આવશ્યકતા છે અને તેની ડિમાન્ડ વધવાની છે. આ ક્ષેત્રમાં કામ કરનારાઓને મોટી રકમ મળે છે.

● વર્ક પ્લેસ નિષ્ણાંત

મોટી કંપનીઓમાં કામ કરનારો સ્ટાફ વિવિધ ક્ષેત્રનો બેકગ્રાઉન્ડ ધરાવતો હોય છે. કંપની તેને વૈવિધ્યપૂર્ણ અનુભવોનો પૂરો લાભ લઈ શકે તે જરૂરી છે. આ પ્રકારની જાણકારી મેળવીને તેનો યોગ્ય ક્ષેત્રમાં ઉપયોગ કરવા માટે વર્કપ્લેસ નિષ્ણાંતોની જરૂર રહે છે.

આ સિવાય એન્જિનિયર જેવા બીજા પણ ઘણા ક્ષેત્રો છે. હવે ઓનલાઇનની પ્રક્રિયા વધી ગઈ છે એટલે જે લોકો ડિજિટલ જગતમાં છે એ લોકો પોતાનો વિસ્તાર કર્ય રીતે વધી શકે તેની સતત વિચારણ કરતા રહ્યા છે અને જે લોકો હજુ ડિજિટલ જગતમાં પ્રવેશ્યા નથી, તેઓ તેમાં ગ્રંપલાવવા આગળ આવી રહ્યા છે. તેને અનુલક્ષીને ઉપરના ક્ષેત્રોમાં નોકરી, કામ-ધંધાની વિશાળ તકો છે અને ભવિષ્યમાં તેનાં કરતા પણ વિશેષ પ્રમાણમાં તેવી તકી ઉભી થવાની છે. એટલે આજના ચુવાવર્ગ પોતાની સફળ કારકીર્દીનું નિર્માણ કરવા ડિજિટલ જગતનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનું જરૂરી છે.

ભારતે તેની આજાદીના ઉપ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની દેશવ્યાપી ભવ્ય ઉજવણીનો પ્રારંભ કર્યો છે. આ ઉજવણીના ભાગરૂપે ઉપ અઠવાડિયા સુધી અનેક જાહેર કાર્યક્રમોનું દેશવ્યાપી આયોજન થયું છે ત્યારે આ પ્રસંગનું ગૌરવગાન કરવા અને સ્વાતંત્ર્ય વીરોની શૌર્યગાથાને ઉજાગર કરવા નવી પેઢીએ નવી તકો માટે જાગૃત થવાની જરૂર છે. ભવ્ય ભારતના નિર્માણ માટે ચુવાવર્ગ આગળ વધીને દેશને આત્મનિર્ભર બનાવવા કટિબધ્ય થાય તે માટે સંકલ્પ કરે. ■

Be The Best

"If you can't be a highway then just be a trial. If you can't be the sun, be a star. It is not by size that you win all. Be the Best of what ever you are."

આપણે જે કાંઈ કરતા હોઈએ તેમાં સર્વોત્તમ બનવાની વાત કવિએ સરસ દાયાંતો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કવિ કહે છે આપણે મોટો વિશાળ રાજમાર્ગ બની ન શકીએ તો ચાલશે, પરંતુ એક નાનકડી પગદંડી તો જરૂર બની શકીએ. એ પગદંડી ટુંકા રસ્તે થઈને આગળ વધનાર વટેમાર્ગ માટે ખૂબ જ ઉપયોગી નીવડતી હોય છે. જીવનમાં આપણે વિશ્વને પ્રકાશિત કરનાર જળહળતા સૂર્ય જેવા ન બની શકીએ તો કાંઈ વાંધો નહીં, પરંતુ અંધારામાં દિશા સૂચન કરનાર એક નાનકડો તારો તો જરૂર બની શકીએ.

જીવનમાં આપણે કેટલી મોટી સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત કરીએ છીએ તે બધાનો આધાર તેની ગુણવત્તા ઉપર રહેલો છે. આપણે જે કંઈ નાની મોટી સફળતા પ્રાપ્ત કરીએ તે 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' હોવી જોઈએ. આને ગીતામાં સહેજ જુદી રીતે વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું છે 'યોગ કર્મસુ કૌશલમુ' આપણે જે કંઈ કરતા હોઈએ તેમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ જ યોગ. અંગ્રેજ કવિ કહે છે : 'Be the best of what ever you are.' આપણે જે કાંઈ છીએ તેનાથી વધુ સારા સર્વશ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરતા રહીએ અને એના માટે ગીતાનું ઉપરનું સૂત્ર અપનાવીએ. આ રીતે જીવનમાં જે કાંઈ સર્વોત્તમ છે તેને આપણે પામી શકીશું.

You Can

'If you think you can' ટી. જે. હોઈસિગટનનું એવું પુસ્તક છે જેમાં આપણી નિશ્ચય શક્તિ પર ભાર મૂક્યો છે. કોઈ પણ ધોય પામતા પહેલાં એનું સ્વાન અને એ સ્વાન સિદ્ધિમાં શક્તા જરૂરી છે. આપણે વિચારીએ છીએ તેવી રીતે જીવનનું ઘડતર થતું હોય છે, માટે વિચારો પર નિયંત્રણ જરૂરી છે.

આપણો જન્મ સફળ થવા માટે થયો છે, પણ આપણે પોતે હાર માની સમજૂતી કરી લઈએ છીએ. એ માનવું ખોટું છે કે સફળ લોકો આપણા કરતાં વધારે પ્રતિભાશાળી છે. એ સફળ થયા કારણકે એમનું ધ્યેય સ્પષ્ટ છે અને વિચારો નિયંત્રિત છે. સફળ થવા સંભોગો વિશે ફરિયાદ કરવી છોડો, સારી આદતો કેળવવાનો પ્રયત્ન કરો. જે આવડે છે તેના કરતાં વધારે શીખવાની વૃત્તિ રાખશો તો સ્વર્ધમાં જરૂર સફળ થશો.

નેગેટિવ વિચારો બહુ શક્તિશાળી હોય છે. માટે એમનો નાશ કરવો જરૂરી છે. જે વિચારોથી આપણી સમસ્યા ઊભી થઈ હોય તેવા જ વિચારોથી એનું નિરાકરણ સંભવ નથી. વિચારશૈલી બદલવી પડશે. બહારનાં કોઈ હુશ્મન એટલું નુકસાન નથી પહોંચાડી શકતો, જેટલું આપણા અંદરના હુશ્મન પહોંચાડે છે. નકારાત્મક વિચારો આપણી અંદર રહેતા હુશ્મનો છે.

ધ્યાનખરા લોકો જીવનના માર્ગમાં દિશાશૂન્ય થઈ ભટકતા રહે છે. શું જોઈએ છે તે અસ્પષ્ટ હોવાથી તક આવે તો પણ વેડફાઈ જતી હોય છે. શું જોઈએ છે તે નક્કી કરી તેમાં વિશ્વાસ રાખશો તો ધ્યેય પામવાના સત્તા ખૂલતા જશે. નકારાત્મક લોકોથી દૂર રહો, નહિંતર તમારા વિચારો પર એમની અસર પડશે. આજની તક કાલે ફરી ન પણ આવે, માટે ધ્યેય સ્પષ્ટ રાખીને તેને પામવામાં મદદરૂપ દરેક તક જરૂરી લો. જે વિચારશો, નિર્ણય કરશો તો કરી શકશો!

- ડૉ. મૂજા કોટક

ભાગો આવેલ કામ શ્રેષ્ઠતાપૂર્વક કરો

જીવનમાં આપણા ભાગે જે કામ આવ્યું છે તે અવિરતપણે શક્ય એટલી ઉત્તમ રીતે આપણે કરવાનું છે. દરેક માણસ પાસે વ્યવસાયિક નિપુણતા ન હોઈ શકે. પ્રખર બુદ્ધિમાન વિજ્ઞાની અથવા પૂર્ણ કલાકાર તો વળી એનાથીય ઓછા હોય. મોટાભાગના તો કારખાનામાં, ખેતરમાં કે શેરીમાં કામ કરતા કામદાર જ હોય. પણ કોઈ જ કામ નાનું કે નગણ્ય નથી. માનવજીત માટે ઉપયોગી હોય તે દરેક કામ ગૌરવપૂર્ણ છે. તેને પૂરેપૂરી ચીવટથી કરવું જોઈએ.

જો કોઈ સફાઈ કામદાર શેરીની સફાઈ કરે તો એ કામ એણે એ રીતે કરવું જોઈએ જે રીતે માઈકલ એન્જેલો ચિત્રકામ કરતો કે બીથોવન સંગીતની તરજુ બનાવતો કે શેક્સપિયર નાટક-કવિતા રચતો. તેણે સફાઈ કામ એ રીતે કરવું જોઈએ કે પૃથ્વી ઉપર માનવો અને સ્વર્ગમાંથી દેવો એનું અભિવાદન કરતા કહે, "અહીં એક મહાન સફાઈ કામદાર વસે છે, જે પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરી શકે છે."

- માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર



વિચાર મંચ

સિદ્ધાંતવાદી બનીને જીવનું કે પ્રેક્ટિકલ બનીને?!!



ડૉ. યાસીન દલાલ

જેમણે જીવનમાં થોડીધણી નિષ્ઠા અને પ્રામાણિકતા બચાવી રાકી છે, એવા થોડા લોકોએ આજકાલ એક શિખામણ સતત સાંભળવી પડે છે : ‘થોડા ઘણા પ્રેક્ટિકલ બનો સાહેબ, નહિંતર જીવી નહીં શકો. ફેંકાઈ જશો.’

‘પ્રેક્ટિકલ’ શબ્દનો ગુજરાતી અર્થ વ્યવહારું બનવાનો થાય છે. પણ, અહીં એનો અર્થ ‘પ્રામાણિકતા’ ‘બણાયાર’ એવો કરવાનો છે. ‘બેઈમાન બની જીવ’ એમ ખૂલ્ટું કહેવાને બદલે લોકો ‘પ્રેક્ટિકલ’ જેવો રૂપાણો શબ્દ વાપરે છે. જો વ્યવહારું બનવાનો જ અર્થ હોય તો જીવનમાં વ્યવહારું બનવામાં કોઈને વાંધો ન હોય. જે માણસ પોતાની નિરાળી દુનિયામાં જ વસ્ત હોય અને સામાજિક જવાબદારી નિભાવતો ન હોય, લગ્ન, મરણ જેવા પ્રસંગે પણ જતો ન હોય તે જે માણસ ઘરની સામાન્ય જવાબદારી પણ ઉઠાવતો ન હોય એને ‘વ્યવહારું’ બનવાનું કહેવાય તો સમજી શકાય પણ પ્રામાણિક માણસને એની નિષ્ઠા છોડીને બેઈમાનીને રસ્તે જવાની શિખામણ આપનારા લોકો વધી જીવ ત્યારે એ સમાજના સ્વાસ્થ્યની ચિંતા થવી જોઈએ. પરીક્ષામાં ચોરી નહીં થવા દેનાર અધ્યાપકને, ધંધામાં બીલ વગરનો માલ વેચવાનો ઈન્કાર કરનાર વેપારીને, દર્દની આર્થિક સ્થિતિ જોઈને મફત સારવાર કરનાર ડોક્ટરનો, દાણચોર કે માફિયા તત્વોની વકીલાત કરવાનો ઈન્કાર કરનાર વકીલને, ગીડ કે ‘સ્પોર્સ સજેશન્સ’ બદલે પાઠ્ય પુસ્તક વાંચવામાં મગન બની જનાર વિદ્યાર્થીનું, પેસા લઈને કોઈ નેતા કે પક્ષનો પ્રચાર કરવાની ના પાડી દેનાર પત્રકારને કે ખોરી રજાઓ લીધા વિના ૧૧થી ૬ વાર્ષયા સુધી ટેબલ પર બેસીને કામ કરનાર કર્મચારીને આવી સલાહ હવે વારંવાર સાંભળવી પડે છે.

આજના યુગમાં સંપૂર્ણપણે આદર્શવાદી બનવું, કે સિદ્ધાંતોનો પૂરો અમલ કરવો ખૂલ્ટ મુશ્કેલ છે. એવું કરવા માંગતા માણસે કાં તો વધો નોકરી છોડી દેવા પડે અને સંન્યાસ લેવો પડે. ડગલે ને પગલે તમારે એવા પ્રસંગોનો સામનો કરવો પડે જ્યારે તમારા આદર્શોનું ત્રાજવું ડેલવા માંડે. આદર્શનો ચુસ્ત અને જરૂરેસલાક અમલ કરો તો મિત્ર ગુમાવવો પડે, ઘણાની સહાનુભૂતિ ગુમાવવી પડે, ઘણાનો રોષ વહોરવો પડે, ઘણાને દુશ્મન બનવવા પડે અને આદર્શ તોડી નાખો તો તમારો

અંતરાત્મા બળવો કરે, અંતઃકરણ કચવાય, મનમાં ને મનમાં ધૂંઘવાટ થયા કરે, રાત્રે ઉંઘ ન આવે... બરોબર છે, આજે તમે ઈસુપ્રિસ્ત, મહાત્મા ગાંધી, લાલબધાદુર શાસ્તી, હજરત ઉમર બનીને જીવી ન શકો, પણ એનો મતલબ એ નથી કે બબલુ શ્રીવાસ્તવ બની જવું કે હર્ષ મહેતા બની જવું. અતિ ચુસ્ત આદર્શવાદી ન બની શકાય તો કંઈ નહીં, પણ સાવ ઢીલા પોચા, વાતવાતમાં સમાધાન સ્વીકારી લેનારા, કોઈ આવીને ખરીદી જીવ એની રાહ જોઈને બેઠેલા, તદ્દન કાળજી વિનાના કાયર બની જવાની શી જરૂર છે? સિદ્ધાંતનું પાલન પાણીમાં લાઠીની જેમ પણ કરી શકાય. કયારેક પાણીમાં કોઈ લાઠી મારે તો સહેજ તરંગ જન્મે, પણ ફરી પાણી એનું એજા...

માત્ર અતિ ધાર્મિકતા આપણનું દૂધણ નથી. અતિ ધાર્મિકતા પણ હવે આપણને ભારે પડી ગઈ છે. **વિશ્વ વિષ્યાત ભાષાશાસ્ત્રી ચોજાસ્કી** ભારત આવ્યા. ભારત જેવા ગરીબ દેશમાં સંપત્તિ અને પૈસાનું જે બેઝામ પ્રદર્શન અને જે ભોગવિલાસ એમણે જોયા, એથી અચંબામાં પડી ગયા. એમણે કહ્યું, આટલી હદે એશોઆરામ અને અમન ચમન તો અમેરિકા જેવા ધનિક દેશમાં પણ નથી જોવા મળતા. આપણે એ ક્યારે સમજશું કે જરૂરથી વધુ પેસો મેળવીને સંધરી રાખવો એ મોટામાં મોટો દેશદ્રોહ છે. આવો પેસો કોઈને કામ આવતો નથી. માત્ર બાથરૂમની છતમાં કે ઘરમાં બનાવેલા ચોરખાનાઓમાં એ પેસો બંધ પડ્યો રહે છે. **જ્યાં ૪૦ ટકા વસતિને બે ટંકનું ભોજન મળતું ન હોય ત્યાં આ રીતે વગર કમાયેલું ધન એકદું કરીને નિષ્ક્રિય રાખી મૂકવું એ આર્થિક દંદિયે પણ ભારે નુકસાનકારક છે.** આવું નાણું બહાર આવે તો રાષ્ટ્રના ઉત્પાદન વધારામાં અને ઉદ્યોગોના વિકાસમાં એનો ઉપયોગ થઈ શકે.

કહેવાનો અર્થ એ નથી કે પેસો કમાવાનું છોડીને વૈરાગી બની જવું. પેસો આજની સમાજ વ્યવસ્થાનું કેન્દ્ર છે. પેસો કમાઈને ઘર વસાવવાની મહત્વાકંક્ષા ન હોય તો બધી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ બંધ પડી જાય. માણસે પેસો કમાવાની અને એમાં વધારો કરવાની ઈચ્છા રાખવી જ જોઈએ. માણસ પાસે જીવન જરૂરી સગવડો હોવી જ જોઈએ. આધ્યાત્મિકતાનો દંબ કરીને આવી સુખ સગવડો ભોગવવામાં નર્યો દંબ છે. પણ ધનેચ્છા ધનલાલસામાં બદલે ત્યારે ખરી આપત્તિ શરૂ થાય છે.

આવો પૈસો બીજાઓને કામ આવતો હોય તો પણ વસુલ છે. પણ મોટેભાગે ધનિકો આવા પૈસાનો પોતાના અને સંતાનોના ભોગવિલાસમાં જ દુર્ઘય કરતા હોય છે. પાણીનો બગાડ, વીજણીનો બગાડ જેટલો વાંધાજનક છે, એટલો જ વાંધાજનક પૈસાનો બગાડ છે. જેના બગડી ગયેલા સંતાનો મહિને હજરો રૂપિયા ઉડાડતા હોય એવો ધનિક એક ભારે મુશ્કેલીમાં મૂકાયેલા મિત્રને માટે પાંચ પૈસા કાઢવા પણ તૈયાર હોતો નથી.

પ્રાયોગિક સંધના અંબુભાઈ શાહે એક પ્રસંગ ટાંક્યો હતો. એક ઉદ્યોગપતિ સાથે પ્રામાણિકતાથી વ્યવસાય કરવાની વાત ચાલતી હતી. ઉદ્યોગપતિનું કહેવું હતું કે દેશમાં કાયદાઓ અને નિયમોનું બંધન એટલું મજબૂત છે અને અમલદારોનો ગ્રાસ એટલો બધો છે કે પ્રામાણિકતાથી ધંધો કરવાનું શક્ય જ નથી. ખૂબ દલીલો પછી અંબુભાઈને લાગ્યું કે ઉદ્યોગપતિની વાતમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની લાચારી કરતાં પણ વધુ તો પાંગળો બચાવ કરીને પોતાની વૃત્તિને ન્યાયી ડેરવવાની વાત જ વધુ હતી. નીતિ નિયમો અને બંધનો દરેક દેશમાં હોય છે. આપણે ત્યાં નિયમો જરા વધુ પડતા કડક અને જડ છે. આપણે ત્યાં સરકારી અમલદારોનો ગ્રાસ પણ વધુ છે. પણ, એનો અર્થ એ તો નથી જ કે એ અંકુશોને આડ બનાવીને કરચોરી, ભેણસેળ કે નિયમના ઉલ્લંઘનને મોકળું મેદાન આપી દેવું અને પોતે આ બધું તો ફરજિયાત કરવું પડે છે એવો મિથ્યા સંતોષ લઈને હાથ ખંખેરી નાખવા.

આપણા દેશમાં હજુ એવા સંખ્યાબંધ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે જ જે કરચોરી નથી કરતા, લેણસેળ નથી કરતા, બીલ વગર માલ નથી વેચતા અને છતાં સુખી છે. ફરક એટલો પડે કે આવા સીધા રસ્તે ચાલનારને આગળ આવતાં થોડો સમય વધુ લાગે. ધંધો જમાવવામાં થોડી મહેનત વધુ પડે. લાંચ રુશવતથી દૂર રહેવાને લીધે કામ કરાવવામાં થોડી તકલીફ પડે અને થોડો સમય લાગે.

પણ, દેશ, સમાજ અને અર્થતંત્રનો ઢાંચો ટકાવવો હોય તો એને માટે આટલી કિંમત પણ આપણે ન ચૂકવીએ? સાચી વાત એ છે કે આપણને સૌને વગર મહેનતે, રાતોરાત માલદાર બનનવાની ઉતાવળ જાગી છે. લાખ મેળવનાર દસ લાખ મેળવવા હૃદ્દાચે છે. કરોડવાળા દસ કરોડ મેળવવા માંગે છે. આમ, ધનિકોનો પૈસો કોઈ મહેનત વગર વધતો જ રહે છે અને ગરીબોના ભાગ્યમાં ચીથરા વીજાવાનું જ બચે છે. વગર કમાયેલો પૈસો જ્યારે સમાજમાં વધી જાય ત્યાર પછી એ પૈસાનું બીભત્સ પ્રદર્શન થતું જ રહે છે.

ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિધ્યાંત અપનાવીને દરેક પૈસાદાર માણસ દસ ગરીબનો ઉધ્ઘાર કરે તો આ દેશની ગરીબી દસ વર્ષમાં હઠી જાય. અબજો રૂપિયા જમીનની સહાયોરીમાં રોકતો માણસ જે દસ ઝુંપડાવાસીને નાનકડું ધર બાંધી આપવાની પ્રતિજ્ઞા લે તો એની મૂડી ખલાસ થવાની નથી, પણ દેશની

ગરીબી જરૂર ઓછી થશે. આપણે ભાષણોમાં દચા અને કરુણાનો મહિમા કરતાં થાકતા નથી, પણ જીવનમાં એનો અમલ મિલકુલ કરતા નથી. એવો અમલ થતો હોત તો આ દેશમાં આટલી દરુષ ગરીબી અને બેદાલી હોય ખરા?

આપણી ખરી સમસ્યા જ ખોટો પૈસો કમાવાની વેલછા છે. આ એક વેલછાએ બધા મૂલ્યોનો ભંગાર કરી નાખ્યો છે. વેપારી હોય, કર્મચારી હોય કે ડોક્ટર કે વકીલ હોય – બધાને નીતિનિયમો તોડીને ધન એકદું કરી લેવું છે. પછી, ખોટા બચાવ માટે દલીલો શરૂ થાય. પણ એમાં અંદરની પ્રતીતિ હોતી નથી.

પંજાબ એન્જિનિઅરિંગ કોલેજમાં એક અધ્યાપકે નોકરીમાંથી રાજીનામું આખ્યું પણ એમનું પ્રોવિડન્ટ ફંડ મેળવતાં મુશ્કેલી પડવા માંડી. એમણે સંબંધિત કલાકને ૫૦૦ રૂપિયાની લાંચ આપી અને એમનું પી.એફ. એમને મળી ગયું. દિલ્હીમાં એક ભાઈ ખોટા રસ્તે વાહન હંકારીને જતા હતા. પોલીસે રોક્યા, એટલે એમણે ૫૦ રૂપિયા આપીને છિટકારો કર્યો.

સૌજન્ય પન્થિકેશન્સ
૫, સૌરાષ્ટ્ર કલાકન્ડ સોસાયટી, રાજકોટ - ૩૬૦ ૦૦૭.
કોન : (૦૨૮૯) ૨૪૭૪૩૨૭

ત્યાગમૂર્તિ : ભારતીય નારી “અણિકા”

(અનુસંધાન : પાના નં. - ૨૭ ઉપરથી ચાલુ)


માણસનાં કૃત્યો ધડનાર સાર્વભૌમ સત્યબિંદુ ધડાયું. જે જે સદ્ગુરૂ ખી આચરણમાં મૂકૃતી તે વડે મનુષ્યત્વ ધડાતું એટલે મનુષ્યોના સાંસ્કૃતિક અને ધાર્મિક ધડતરમાં તે પુરાણા કાળમાં ખીઓ જ કેન્દ્રસ્થાને રહી હતી.

અણિકા આ સમે સગર્ભી હતી. તેને લઈને દેવદટ કુશીનગર જવા નીકળ્યો. રસ્તામાં જ અણિકાએ પુત્રને જન્મ આપ્યો. માગમાં પ્રસૂતિના સમય જેટલું રોકાઈ, અણિકા પતિ સાથે સાસરે પહોંચી અને સાસુ-સસરાના સેવાકાર્યમાં તલ્લીન બની. બંનેની હસતે મુખે ચાકરી કરતી રહી.

અણિકાનો આ પુત્ર તે જૈન ધર્મનો પ્રચારક સંધિરણ. અણિકાના સંસ્કારો અને સદ્ગુરૂઓ તેનામાં ઉત્તરી આવેલા હોવાથી સંસારમાં એ અણિકાપુત્ર તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો.

આજે સાસુ-સસરાની વૃદ્ધાવસ્થા સમયે તેની સુશુષ્ઠા - સેવા કરવાને બદલે તેમને વૃદ્ધાશ્રમનો દરવાજે દેખાડતી અને અપમાન કરતી કેટલીક ખીઓને માટે અણિકા મોટું ઉદાહરણ છે.

C/o. “સંસ્કૃતિ દશન” કાર્યાલય,
તત્ત્વપરા શેરી નં.-૧, નીલકંદ નગરાની સામે,
બાગ દરવાજા, માણપદ્ર-૩૬૨ ૬૩૦. (મિ. જૂનાગઢ)
મો. ૮૭૩૪૬૦૨૪૮૮



વિચાર મંચ

તમારે ત્યાં ફેવિકોલ છે...?



દિલેશ પાંચાલ - જનાલિસ્ટ

એક પરિચિત કોલેજ કન્યાના લગ્નની વાત ચાલતી હતી. મેં એને પૂછ્યું, ‘તારો સ્વભાવ બહુ રમૂજ છે. તને રમૂજને બદલે કોઈ મૂજ મળી ગયો તો શું કરીશ?’ એઝે ક્ષણાંધ ગંભીર બનતાં કહ્યું – ‘હું તેને મારી અપેક્ષા મુજબનો આકાર આપવાની કોણિશ કરી. પણ સફળ ન થઈ શકી તો એડિસ્ટ થઈ જઈશ!’ છોકરીનો જવાબ મને ગમ્યો. એમાં સીસહજ વ્યવહારુકતા હતી. એને શોખણ ગણો કે અન્યાય પણ સંસારમાં બહુધા સીઓના ભાગે જ અનુકૂળ થવાનું આવતું હોય છે. પુરુષોના ભાગે નહીં.

સાસરે ગયેલો જમાઈ ભોજન બાદ હાથ ધોવા ઉઠે ત્યારે સાળો યા સસરો તેની તહેનાતમાં ટુવાલ લઈને ઊભો રહે છે. સાસરે ગયેલી પુત્રવધૂ જીવિને વોશબેસિનમાં હાથ ધોતી હોય ત્યારે તેની સાસુ ટુવાલ લઈને બાજુમાં ઊભી હોય એવા દશની કલ્પના થઈ શકે ખરી? આપણા પુરુષપ્રધાન સમાજમાં માન, સન્માન કે સુવિધાઓ સર્વ પુરુષલક્ષી હોય છે.

એક મહિલા કર્મચારીની બદલી થતાં અમારા એક મિત્રે તેમને પૂછ્યું, ‘દસ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડિસ્ટ થવાનું બહુ આકરું લાગશે નહીં?’ બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દસ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ તો વીસ બાવીસ વર્ષનો પિચરનો ગાટ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડિસ્ટ થવાનું શીખી લઈએ છીએ! સાસરામાં નવા માણસો, નવું ધર, નવું વાતાવરણ.... બધું જ નવું હોય છે. એ બધાંને અનુકૂળ થઈ જવા સિવાય છૂટકો હોતો નથી. હું પરણીને આવી ત્યારે મારા સાસરે ખોરકમાં મરયાનું પ્રમાણ એટલું વધારે હતું કે જમતી વેળા મારી આંખમાં આંસુ આવી જતાં. આજે અધો શેર કાચાં મરયાં ચાવી જઈ શકું એટલી ટેવાઈ ગઈ છું!’

વાત સાચી છે. સીઓએ સંસારની ગમે તેવી તીવ્ર તીખાશ પચાવી જવી પડતી હોય છે. સીઓનો તો અવતાર જ સ્ટ્રેચેબલ! સી એટલે જાણે રબરબેન્ડ! ગમે ત્યાં ચઢાવો, સ્થિતિ પ્રમાણે ફીટ થઈ જાય. મરચાંવાળી રસોઈ શું, આખેઆખા મરચાંછાપ પતિ જોડે પણ જીવન જવી લેવું પડે છે. અનુકૂલન વિના એ શક્ય નથી. અનુકૂલન સીઓનો સૌથી મોટો સદ્ગુણ હોય છે. અનુકૂલન વૃત્તિ ના હોય એવી સી સિંગ્રા વિનાના સોફા જેવી હોય છે! રસોડામાં ગોળ અને મસાલાના ડોબા બાજુ

બાજુમાં હોય છે, એવું સહઅસ્તિત્વ દાંપત્ય જીવનમાં પ્રેમ અને જઘડાનું હોય છે.

એક વાર એક મિત્ર દંપતીએ કહેલું – ‘અમારાં લગ્નને સાત વર્ષ થઈ ગયા પણ અમારી વચ્ચે એક પણ વાર જઘડો થયો નથી!’ બચ્યુભાઈએ જવાબ આપેલો – ‘કોઈ સારા ડોક્ટરને બતાવો!’ અને ઉમેરેલું – ‘દેવી દેવતાઓ વચ્ચે પણ જઘડા થઈ શકતા હોય તો માણસો ન જઘડે એ વાતમાં માલ નથી. અમારે જઘડા નથી થતા એમ કહેનાર ક્યાં તો જૂદું બોલે છે અથવા તેને ફિલ્મ ફિલેસમાં ખામી હોય એમ બને!’ સ્વ. જયંત પાઠકે માણસની ઓકાતનો પરિચય આ રીતે આખ્યો છે : ‘રમતાં રમતાં લડી પડે ભઈ, માણસ છે!’

જોકે પતિ-પત્નીના સંબંધોમાં તેઓ લડતાં લડતાં ક્યારે રમવાનું શરૂ કરી દેશે તે નિશ્ચિત હોતું નથી. બ્રશ કરતાં કરતાં બાજી પડેલાં ચા ચિયર્સ કરીને પીતા હોય એમ બને છે. ‘આ ઘરમાં ક્યાં તું નહીં, ક્યાં હું નહીં’ એમ કોથમાં કહી બાથરૂમમાં નહાવા ગયેલા પતિદેવ ઓફિસે જતાં સુધીમાં શક્ય છે રવિવાર માટે પિકનિકનો પ્રોગ્રામ ઘડી કાઢે એવું ય બને! મદારીના કરંડિયામાં ફૂંકાડા મારતા નાગ-નાગણાની જેમ ઘણાં પતિ-પત્ની નાહક ફૂંકાડા મારતાં રહે છે. તેમના ફૂંકાડા સાવ બિનાંઝેરી હોય છે. એ રહસ્ય તેમના સંતાનોય સમજ ચૂક્યા હોય છે!

એક મિત્રે કહેલું – ‘મારી પત્નીને પારકા જઘડામાં ભારે રસ. એક વાર પાડોશીને ત્યાં એ ઉછીની ખાંડ લેવા ગઈ તે જ ક્ષણે પાડોશીએ છૂટી ફૂલદાનીનો ઘા તેની પત્ની પર કર્યો. ફૂલદાની દીવાલ પર અફણાઈને બે ટુકડા થઈ ગઈ. એ નિહાળી પત્ની એવી રીતે મારી પાસે દોડી આવી જાણે દસ લાખની લોટરી ના લાગી હોય! હું જરા તંત્રામાં હતો. મને હચ્ચમચાવી નાખતા કહ્યું – ‘આ તમને તો ઊંઘવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. કાંઈ ખબર છે બાજુમાં શું ચાલી રહ્યું છે? બેય વચ્ચે જબરી જામી ગઈ છે. સાંજે બેસવાને બહાને જઈશું. ફૂલદાનીના બે ફાડ્યા થઈ ગયા છે. હું નજરે જોઈને આવી છું!’

સાંજે અમે ગયા તો શું જોઈએ છીએ? પતિ-પત્ની એક સોફા પર અડોઅડ બેસી તેમની સાતમી મેરેજ એનિવર્સરીમાં કોને કોને બોલાવવા તેનું લિસ્ટ બનાવી રહ્યા હતા. બંનેએ હસીને અમને આવકાર્ય. દૂર દૂર સુધી તેમના ચહેરા પર પેલા જઘડાનું

નામનિશાન નહોતું. મારી પત્નીનું મોહું પડી ગયું. મેં ટેબલ પર પહેલી ફૂલદાની તરફ પત્નીનું ધાન ઈશારાથી દોર્ચું. ફૂલદાનીમાં સુંદર ફૂલો શોભતાં હતાં. બાજુમાં ફેવિકોલની નાની બોટલ પડી હતી. શોધવા નીકળીએ તો સંસારમાંથી આવી તૂટેલી ફૂલદાનીઓ લાખોની સંખ્યામાં મળી આવે... પણ તે સમજદારીના ફેવિકોલથી સુંદર રીતે સંઘાયેલી હોય છે. તેનાથી કમરાની શોભા જરાય ઘટતી નથી.

સંભવત: પશ્માલાલ પટેલે તેમની કોઈ વાર્તામાં લખ્યું હતું : ‘હું ગલ્યે પાન ખાવા જઈ રહ્યો હતો. ત્યાં મેં જોયું કે એક ધરમાં પત્ની પોતાના પતિ પર છુટી રકાબીઓ ફેંકી રહી હતી. પણ પાછા વળતી વેળા મેં તીરછી નજરે જોયું તો બંને હસતાં હસતાં ફર્સ્ટ પર પેલા રકાબીના ટુકડા ભેગા કરી રહ્યા હતાં!’

શરૂશરુમાં બચુભાઈ અને સાવિત્રી બહેનનાય બહુ ઝડપ થતા. બચુભાઈ કહે છે – ‘સંસારમાં કોઈ પત્ની એવી નહીં હોય જેણે પતિને પિયર ચાલી જવાની ધમકી ના આપી હોય! સાવિત્રી ‘પિયરલેસ’ હતી. અર્થાત્ પિયર વિનાની હતી. એક દૂરના પિત્રાઈ ભાઈ સિવાય કોઈ હતું નહીં, છતાં ફૂકરની પહેલી સીટી પડે ત્યાં એ ફૂફાડાભેર ધમકી આપતી – ‘હું પિયર ચાલી જઈશ!’ અને ત્રીજી ચોથી સીટીએ તો વાત આખું અંબાજ જવાના પ્રોગ્રામ પર આવી જતી!

પતિ-પત્નીના ઝડપ એટલે પાણીના પરપોટા! અનું આયુષ્ય બે-પાંચ મિનિટથી વધારે હોતું નથી. જ્યાં અનુકૂલન નથી, સમજદારી નથી, ત્યાં એવા પરપોટા પાંચ સાત વર્ષ સુધીય ફૂટતા નથી. માણસ નાનો હોય કે મોટો, દરેકના જીવનમાં ઝડપ થાય છે. ચાલ્સ અને ડાયેનાના ઝડપ પેપરના પાને છપાયા છે. મહોલ્લામાં ચંદુ અને ડાયલીના ઝડપ ચાલીમાં થોડુંક મનોરંજન આપીને અટકી જાય છે. જેમના ફેવિકોલમાં દમ હોતો નથી તેમના ઝડપ ટકાઉ બની રહે છે!

સંતો કહે છે : ‘જીવનમાં પ્રેમ મહાન છે!’ પણ દાંપત્ય જીવનમાં પ્રેમ કરતાં અનુકૂલનનું મહત્વ વધી જાય છે. અનુકૂલન હોય તો પ્રેમ વિનાય માણસો સુખથી જીવી શકે છે. એક ફિલ્મી ગીતમાં આ અનુકૂલનનો જીવનમંત્ર સુંદર રીતે વ્યક્ત થયો છે. ‘દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલો... મંજિલે ફિર ખાર કી આયેગી ચલતે ચલતે!’ બંને પક્ષ સમાધાનની દિશામાં બે બે ડગલાં આગળ વધે તો સંસારની ફૂલદાની અવશ્ય મહેકી ઉઠે!

પતિને ભર શિયાળામાં ય ફૂલ પંખો જોઈતો હોય અને પત્નીને પંખો મુદ્દલે ના ફાવતો હોય ત્યારે અનુકૂલનની ખાસ જરૂર પડે છે. અમારા એક મિત્ર દંપતીને ત્યાં આવી સ્થિતિ છે. પણ બંનેએ દો દો કદમ આગળ વધી ખારકી મંજિલ તરફની ગતિ જાળવી રાખી છે. પત્નીને પંખો નથી ફાવતો એથી એ કાને સ્કાર્ફ બાંધી લઈ જાડો ચોરસો ઓઢી લે છે અને પતિ

મહાશય પંખો પાંચને બદલે ત્રણ પર ચલાવી થોડા ઓછા પવનથી ચલાવી લે છે. કોઈકે સાચું કહ્યું છે – ‘લાઇફ ઇંજ નથિંગ બટ એન આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ!’

પતિ-પત્નીએ પોતાની જરૂરિયાતો કે ગમા આણગમાઓને થોડા ફ્લેક્સિબલ બનાવી પરસ્પરને અનુકૂળ થવું રહ્યું. એમ ન થઈ શકે તો દાંપત્ય જીવનમાં નિરંતર સંઘર્ષની શક્યતા રહે છે. સંઘર્ષ પ્રેમ રૂપી હુંગા માટે ટાંકણીની ગરજ સારે છે. મનદુઃખ પ્રેમની કબર છે અને સંઘર્ષ, એટલે પ્રેમની પનોતી! ચાદ રહે, સંસારમાં દરેક ફૂલદાની બ્રેકેબલ (તૂટવાપાત્ર) હોય છે. એથી પ્રત્યેક દંપતીએ ધરમાં પ્રેમનો ફેવિકોલ રાખવો જરૂરી છે. દરેકની ફૂલદાની કયારેક તો જરૂર તૂટે છે પરંતુ અને ઠીક રીતે સાંધીને ફરી એમાં આનંદ-ઉલ્લાસનાં પુષ્પો સજાવીએ એમાં દાંપત્ય જીવનની શોભા રહેલી છે.

સી-૧૨, મજૂર મહાજન સોસાયટી, ગણાંડેવી રોડ,
જ્માલપોર, નવસારી-૩૮૬ ૪૨૭ (ગુજરાત).
મો. ૯૪૨૮૧ ૬૦૫૦૮

હેત અને Hate

(અનુસંધાન : પાના નં. – ૩૨ ઉપરથી ચાલુ)

પડાવનાર તો ધણા મળશે, પણ જોડનારા નહીં મળે – ઓછા છે. લાગણીઓના ફેવિકોલ હારા અતૂટ બંધનથી જોડાવું જ પડશે.

જેની પાસે માત્ર વધની જ પુખતા હોય છે પણ વિચારની પુખતા હોતી નથી એ વ્યક્તિને મળતી તમામ પ્રકારની ભૌતિક અનુકૂળતાઓ અના સર્વતોમુખી પતનને નોતર્યા વિના રહેતી નથી.

સદગુણ પોતાના કરતાં બીજાને આગળ વધતા જોઈને રાજુ થાય છે. જ્યારે સુખ પોતાના કરતાં બીજાને આગળ વધતા જોઈ છાયાગ્રસ્ત બને છે. અંતમાં, જે કુટુંબમાં વાત્સલ્ય, વિનય અને વિવેકનું ચલાણ નથી એ કુટુંબને જ્ઞમરાંગણ બનતા વાર લાગતી નથી. સારા વિચારો મહેમાન જેવા છે. આમંત્રણ આપીને આપણે એમને મનમાં લાવવા પડે છે, જ્યારે ખરાબ વિચારો તો ગુંડા જેવા છે. વગર આમંત્રણે, એ મનમાં આવીને અડો જમાવી બેસે છે.

અશ્વુભીની આંખે.....

જે મા-બાપે તમને સંસારદુપી દરિયાના દ્વાર દેખાડ્યા, પ્રવેશ કરાયો, તે મા-બાપને ક્યારેય ધરડા ધરનું દ્વાર દેખાડી, પ્રવેશ કરાવશો નહીં. તો જ તમારું અંતરદ્વાર સર્વને માટે સદા ખૂલ્યું રહેશે.

સુવાક્ય :

ઉપકારીના સ્મરણે કૃતશીતાના આંસુ...

કૃષીના દરશને કરુણાના આંસુ...

પાપના સેવને કલ્પાંતના આંસુ...

આ ત્રણ પ્રકારના આંસુના સ્વામી બની જઈએ... બેડો પાર છે.

અમદાવાદ • મો. ૯૪૨૮૬ ૧૪૮૩૩



ગુલશાળ

“દિલની જગ્યાન”

શાદેના સાધક : કવિ કીર્તિકાન્ત પુરોહિત : મણકો-૫



ચંદ્રકાંત પટેલ ‘સરલ’



કવિ કીર્તિકાન્ત પુરોહિત
(વડોદરા)
મો. ૯૮૭૯૬૧ ૧૪૨૮૮

એક વેળા જૂનાગઢમાં યોજાયેલો એક મુશાયરો પૂરો થયા
પછી મંચ ઉપર કવિ અમૃત ધાયલ, રમેશ પારેખ, મનોજ
ખંડરિયા, શ્યામ સાધુ, હું અને ગ્રહુલ નાણાવટી વગેરે કાબ્યોની
ચર્ચા કરતાં બેઠાં હતા. મનોજ પ્રશ્ન કર્યો : ‘કવિતા એટલે શું?’
રમેશ પારેખ કહ્યું : ‘આત્માની કલા.’ શ્યામ સાધુએ કહ્યું :
‘કવિતા એ તો શબ્દની સાધના છે.’ નાણાવટી કહે, ‘મારું મન
માનતું નથી.’ અમૃત ધાયલે મને પૂછ્યું, ‘તમારો અભિપ્રાય કેવો
છે?’ મેં કહ્યું, ‘મને બેઉના જવાબો ખરા લાગે છે.’ નાણાવટી
કહે : ‘ધાયલ સાહેબે તમારો મત માર્ગયો છે. આપણે એક જ
વજનદાર જવાબ જોઈએ.’ મેં કહ્યું : ‘શાદ-સાધના આત્માને
ટંટોળી જગાડે છે. આત્મા જગી ગયા પછી તે વિચારો
તરફ પ્રેરાય છે; ને વિચારોને શાદોમાં આવેસ્થિત કરે છે.
ત્યાર પછી જે ધાટ ધડાય એ જ કવિતા, ગગલ. એમ
હું અંગત માનું છું.’ નાણાવટી બોલી ઉઠ્યા : ‘દાદું... દાદું...’

કવિતા વિશે વાત કરતા કીર્તિકાન્તભાઈ કહે છે - જિંદગીના જબરદસ્ત વળાંક પર કવિતાએ મારો હાથ પકડ્યો અને એક સુંદર અવલંબન મળ્યું. નિજાનંદનું એ સુપ્રમ્ભાત હતું. આમ તો મંબઈમાં શાળાજીવનથી જ સાહિત્ય પ્રત્યે લગાવ હતો. કવિતા,

ઉમાશંકર જોખીએ એક જગ્યાએ કહેલું કે – મસ્તી એ કવિતાની જનરી છે. મસ્તી એટલે જગતને, વ્યવહારને, સાપ કાંચળી ઉતારી ફંકી હે એમ ફંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતાનો ઉદ્ઘય અસંભવ છે.

આવા જ શબ્દના સાથક છે વડોદરાના જાહીતા કવિ શ્રી કીર્તિકાન્ત લીખામાંઈ પુરોહિત. તેમનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૮૪૨માં થયો. સને ૧૮૬૫માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી BE (મિકેનિકલ) ડિપ્લોમા ઇન બિજનેસ મેનેજમેન્ટની ઉપાયી મેળવી છે. ઓટોમેટિક વેલ્ડિંગ ઇક્સિપ્મેન્ટ અને મશીનરી ઉદ્યોગ ધરાવતા કીર્તિકાન્તમાંઈ ઉદ્યોગ જગતમાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે સ્થાન ધરાવે છે.

તેઓ લાયન્સ કલબમાં પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો નાગરિક ફોરમ મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કો.ઓ. બેંકના ચેરમેનપદે પણ તેમણે સેવાઓ આપી હતી. હાલ તેણો મેસોનિક લોજના જોન ચેરમેનપદે આજીવન સત્ત્ય છે. તેમજ કિટોન વેલ્ડ ઇક્વિપમેન્ટ પ્રા. લિમિટેડના ચેરમેનપદે આપુંદ છે. આ સિવાય ઘણી સામાજિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે.

વાર્તા, નાટક વગેરે ક્ષેત્રોમાં અભિરુચિ. શાળામાં યોજાતા નાટકોમાં મુખ્ય પાત્ર ભજવવા મળે તથા શાળામાં પ્રતિવર્ષ આયોજિત થતા મુશાયરા - કવિ સંમેલન, કાવ્ય સ્પર્ધાઓ વગેરેમાં મારી કવિતા ઈન્નામને પાત્ર ઠરતી.

પરંતુ S.S.C. પછી વિજ્ઞાન પ્રવાહમાં અને ત્યાંથી એન્જિનિયરિંગમાં નિયતિનો પ્રવાહ બેચેંચી ગયો. એ વળાંકે મને સાહિત્યથી કંઈક અંશો દૂર કરી અને કમશા: ગૃહસ્થી અને યંત્ર ઉદ્યોગની ઘટમાળમાં પરોવી દીધો.

ત્યારબાદ જીવનમાં બીજો વળાંક આવ્યો. મારો પરિયય
વડોદરાના સાહિત્યવિશ્વ સાથે થયો. જ્ઞાણીતા શાયર લલિત
વર્માને મળવાનું થયું. એમણે બુધસભાનો તથા ગર્જલ સાગ્રાટ
ડૉ. રશીદ મીર સાહેબ (તંગી - 'ધબક')નો પરિયય કરાવ્યો.
હું બુધસભા (દર બુધવારે યોજાતી કવિ સભા)માં જવા લાગ્યો.
બુધસભાએ મારામાં ઉત્સાહ જગાડ્યો. અનેક કવિઓનો સંપર્ક
થતાં સુષ્પદ જેવી થઈ ગયેલી મારી કાવ્યચેતના હણાહણી ઉઠી.

કવિ કહે છે કે – શરૂઆતના તબક્કામાં ધંદ, લય, ગઝલનું
વજન વગેરે વિશે કંઈ જાણતો ન હતો. પરંતુ કવિઓની વચ્ચે
બેસવાનાં થતાં આ બધાં હસ્તગત થયાં. બધાસભામાં ડો. રશીદ

મીર સાહેબ, ‘નાશાદ’ અને અન્ય કવિઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહ્યું.

કવિતા લખવી એ ઘણી જ અધરી બાબત છે. કવિતા કંઈ બધાથી નથી લખી શકતી. છંદ બંધારણ, લય, શબ્દ ચમત્કૃતિ, અર્થલાઘવ અને અર્થ ગૌરવ વગરની ગજલ - કવિતાઓ આપણને વાંચવા મળે છે અને સંગ્રહો પણ પસ્તીના ઠગલામાં પડેલા દેખાય છે. આ કવિ પણ કહે છે :

સાત અથ્વો પણ પહોંચી ના શકે,
કાવ્યતળ સુધી જવું ક્યાં સહેલ છે.

ગુજરાત કે કવિતા લખવી જેટલી કઠિન - અધરી છે, તેટલી
 જ તેને પારખવી, સમજવી અને મૂલખવી પણ દુષ્કર બાબત છે.
 રસ એ કાવ્યનો આત્મા છે. શબ્દ અને અર્થ બંને ચમત્કૃતિ ઉત્પન્ન
 કરે છે. અંગ્રેજમાં કાવ્યનું લક્ષણ આ પ્રમાણે બતાવાયું છે :
 “Poetry is the overflow of powerful feelings.” આ
 ઉપરથી જગ્યાશે કે કાવ્ય રચયનું સહેલું નથી અને તેની ખૂબી
 સમજવી એ પણ સહદ્યનું જ કામ છે. કવિ ક્રીતિકાન્તજીનો
 રહ્યાસ્વાદી શે’ર માણીએ :

શબ્દકોશી પત્ર જ્યાં નિષ્ફળ ગયા તો,
સૂર પાસે વૈખરી ધબકાર લાધ્યા.

‘શબ્દકોશી યત્ન’ અને ‘વૈખરી ધબકાર’ કવિએ અહીં વાણીની વાત કરી છે. શબ્દ પાસેથી કામ લેવાનો પ્રયત્ન જો નિષ્ફળ ગયો તો મદદે વાણી આવી. અને એ પણ ‘વૈખરી’ વાણી. વાણીના ચાર પ્રકાર છે : વૈખરીવાણી, મધ્યમાવાણી, પશ્યંતીવાણી. અને પરાવાણી. વૈખરીવાણી એટલે કંઈથી મુખગોલક પર્યતના સ્થાનમાં પ્રગટ થનારી, સર્વ પ્રાણી વડે ઉચ્ચારણ થવા યોગ્ય, કિયાશક્તિ પ્રધાન. કવિએ અહીં સૂર પાસે વૈખરી વાણીનો ધબકાર મુક્યો છે ને શેરિયત લાધી છે.

કવિએ પોતાની ગજલોમાં મોટાભાગે પોતીકો અવાજ
પરોવ્યો છે. ઈશ્ક-એ-મિજાજ અને ઈશ્ક-એ-હકીકીભાવથી કવિ
અળગા રહ્યા છે. પરંપરાગત ગજલની આવી માન્યતાઓ કવિને
સ્પર્શી શકી નથી. તેમણે પોતાનો જ અવાજ રજૂ કરી નવો
પડધો પાડચો છે અને સહજ ભાવાભિવ્યક્તિ સાધવામાં
સકળતા પણ એટલી જ પ્રદાન કરી છે.

આજે કુદુંબ વ્યવસ્થાના પાચા ડગમગી ગયા છે. પ્રેમ, વાત્સલ્ય, લાગણી અને પારિવારિક મહતાનું ભાષીભવન થતું જોઈ શકાય છે. ત્યાગને બદલે મેળવવાની ભાવનાએ માણું ઊંઘું કર્યું છે. કવિઓએ આ વાત કેવી સીકૃતથી અહીં કરી છે તે જોયે :

જવવાની હોડ આમી હતી પરિવારમાં:

બાપાના ઘરની હરદાળ હતી પરિવારમાં.

માની તાવડી રહી ગઈ એક ખૂબો એકલી,
અની ક્યાં બોલી લગાવી હતી પરિવારમાં!

આ કવિના કલ્પનો રચનાત્મક છે અને બહુઆયામી છે. ગજલનું ભાવજગત કવિએ બંધનમુક્ત બનાવ્યું છે. કવિ પાસે નિશાન તાકતી જુદી જ અભિવ્યક્તિ છે. તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓનું અવલોકન કરી ચિત્તવ્યાપારોને કાવ્યરૂપે શરૂઆદ કરી, શરૂઆદ આપી કવિ સાવ નોખી, નવી જ કાવ્ય સુણિનું નિર્માણ કરતા દેખાય છે.

પ્રેમ, પ્રકૃતિ અને ઈશ્વર – એ ગાજલના સનાતન વિષયો છે. કવિ ભલે ગમે તે વિષયનું ખેડાણ કરે, પણ આ ગ્રાણમાંથી કોઈ એકાદ વિષયની પંક્તિ તો અવશ્ય આવે જ. જોઈએ કવિનો વધુ એક શે'ર :

ના ખુદા કું આવતો અહીં નાખુદા મારો બની,
એ થયો છે તાત તો મહિધારમાં પકડ વાગે.

અહીં ના ખુદા અને 'નાખુદા'નો કરેલો શબ્દ પ્રયોગ ધ્યાન ખેંચી રહ્યો છે. કવિ પ્રભુને કહે છે કે, હે ઈશ્વર! તું માત્ર દર્શન દેવા ટેંલ બનીને અહીં ન આવતો. જો ખરેખર તું મારો પિતા જ થયો હો તો તું મજધારમાં મારી રખેવાળી કરજે. મારી ભક્તિ અને તારા પ્રત્યેની મારી શ્રદ્ધાને તપાવવાની, તાવવાની તને છૂટ છે. અહીં શ્વેષાલંકરને કારણે શબ્દપ્રયોગ ધ્યાનાર્થ બને છે.

કવિની ઉષા:કાલીન અનુભૂતિમાં વેગ છે. પ્રેમ, પ્રકૃતિ, સૌદર્ય, સમાજધર્મી, મિલન, વિરહ, વ્યથા, પ્રકૃતિ વગેરેના ગતિવ્યાપ વધુને વધુ સંકલતાને ઉપસાવતાં જોઈ શકાય છે.

એક પળનો પણ ફરક ફરક બની જશે,
જે સફળ થશે પછી સિફત બની જશે.

ગજલના બાદશાહ ગણાતા આપણા જાજરમાન અને પ્રખર
ગજલ પારખું ડો. રશીદ મીર સાહેબ લાખે છે કે – કવિએ
ગજલની આકારલક્ષીતાને મહિદું અંશે સિધ્ય કરી છે. પરંતુ કેવળ
આકાર સૌષ્ઠવ જ ગજલનું સર્વસ્વ નથી. આ બધું હોવા છતાં
અના તત્ત્વિક સંયોજનથી જો ગજલત્વ પ્રગટે, નહીં તો ગજલ
અંતે નિષ્પ્રાણ ચોકકું બની રહે છે. આ કવિ એ તથને બરાબર
જાણે છે.

ફાઈલાતુન અરકાન — ગાલગાગા બહરના લગાતમક
રૂપવાળી તેમની ગજલનો એક શે'ર :

જવવાનું ને તરત પાછા જવાનું,
એટલા ઓછા સમયમાં ચાહવાનું.

કાવ્યનો ધર્મ, ભાવની અભિવ્યક્તિ અને એની ભાવકને

અનુભૂતિ કરાવવાનો હોય છે. વંગ્યાર્થ બોધદાયક હોવો જરૂરી છે. સફળ ગજલનું સર્જન ત્યારે જ શક્ય બને છે જ્યારે વિચારની સાથે કવિ તાદાકાર સાથે ત્યારે જે તેના ચિત્તના પાત્રમાં સમાચિના ગ્રહાયો હોય અને તે શબ્દદેહમાં ઉમટવા જોઈએ તો જ પરિપક્વ સર્જન સંભવ બને અને તામીરમાં પ્રસાદ, એકત્ર અને છટા આવી શકે. આ કવિમાં એ સુપેરે જોઈ શકાય છે. વધુ એક શે'ર આ રહ્યો :

ચહેરો વાંચતા પરખાય એવું બને,
જાણી લઈને દિલ પસ્તાય એવું બને.
મનની સ્થિરતા ના હોય આધારમાં,
બહેરો અંધથી ભરકાય એવું બને.

શબ્દ ચ્યામટકૃતિથી જ આ કવિ પતાવતા નથી. સાથે અર્થગૌરવ, અર્થ ચ્યામટકૃતિ અને અર્થલાઘવ દ્વારા ગજલને ઊંચાઈ બસે છે. કવિમાં રહેલી પ્રતિભા, બહુશ્રુતત્વ અને કાવ્ય પરિશીલનતાએ જ તેમને ઘ્યાતિ અને નામ અપાવ્યા છે. કવિ લખે છે :

કોઈ માટે સહેલ છે રાખસ બનતું,
યા સંસાર ત્યજને તાપસ બનતું.
જન્મ સાથે તન ભલે ઈશ્વર દટો,
કે, વધું મુશ્કેલ છે માણસ બનતું.

આજના ભોગવિલાસના અને સ્વાર્થના જમાનામાં ડેવાન બનતું બહુ સરળ છે. વળી સંસાર ત્યજને તાપસી, સાધુ બનતું એ પણ એટલું જ સહેલું છે. પણ કોઈથી માણસ બની શકાતું નથી. માણસ આજે તીરે ઊભિનેય તણાઈ રહ્યો છે. તેણે તટસ્થતા જ ખોઈ નાખી છે. જે માણસ તટસ્થ રહી શકે, તો જ માણસાઈ તટસ્થ રહેવાની.

સ્થિતિનું ભાન થતાં વિવેક જન્મે છે, વિવેકના હુતાશમાંથી વેરાગ્ય જન્મે છે અને વેરાગ્યમાંથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન પ્રગટ્યા પછી જ સત્યનું દર્શન થાય છે અને એ જ માણસને માણસ બનાવે છે. કવિએ અહીં બહુ મોટી વાત કરી છે. કવિનો વધુ એક શે'ર :

પૂર્વગ્રહ ફક્ત સૂર્યનો જ નથી,
ચાંદ પણ ધરબહાર રાખું છું.

ગાલગા ગાલગા લગાગા ગા ગાણમાં લખાયેલી ગજલનો આ શે'ર ગજલની પરિપાટીનો શે'ર બન્યો છે. ગજલમાં જે કંઈ કહેવાય છે તે સાંકેતિક ભાવ અને પ્રતીક નિયોજનથી જ કહેવાતું હોય છે. આ શે'રમાં સૂર્ય અને ચાંદને પ્રતીકર્ષપે લીધા છે ને સુખ-દુઃખની વાત કહેવાએ છે. સૂર્ય એ ગરમી એટલે દુઃખનું પ્રતીક છે અને ચંદ્ર એ શીતળ એટલે સુખનું પ્રતીક છે. ગરમીને હટાવવા માટે ધરની આસપાસ શીતળતા રાખવી પડે.

આ કવિની વધારે એક ગજલનો શે'ર માણીએ. આધ્યાત્મિક

અવાજને પડવાવતી તત્ત્વગઝલ કવિ રજૂ કરે છે.

કોઈ જાગી ગયા ને અંદર વળ્યા,
અની ભીતર મજાનું ટોળું હશે!

જાગી જવું એટલે સભાન થવું, જ્ઞાન તરફ વળવું. માત્ર આંખો ખૂલ્યી હોય એ જાગૃતતા નથી. ભીતરથી સભાન થવાય એ જ સાચી જાગૃતિ છે. અને જાગી ગયા પછી જ સંસાર અસાર છે એવો ઘ્યાલ આવે છે કે ભીતર કેટલા બધા ટોળા વસી રહ્યા છે, ને મજા કરી રહ્યા છે. કામ, કોધ, મોહ, માચા, લોભ, મદ, સ્વાર્થ, મમતા વગેરે ટોળાં પછી જ દેખાય છે.

ધારીવાર સાવ સામાન્ય લાગતો શે'ર ભીતરથી વિસ્કોટ કરતો હોય છે. જે આપણી પાસે તેને માપવાનો માપદંડ ન હોય તો તે મપાતો નથી. ગાલિબ પાસે શે'ર માપવાનો જુદો જ ગજ હતો, જે મોમીનના એક શે'ર ઉપરથી જોઈ શકાય છે.

તુમ મેરે પાસ હોતે હો ગોયા,
જબ કોઈ દૂસરા નહીં હોતા.

સાવ સામાન્ય લાગતા આ શે'રના બદલામાં ગાલિબે પોતાનું જીવનભર કરેલું સર્જન મોમીનને આપી દઈને તેના બદલામાં આ શે'રની માંગણી કરી હતી.

કવિ કીર્તિકાન્ત પુરોહિતની કલમને બળ પૂરું પાડનાર મુખ્ય કોઈ શાયર હોય તો તે છે ડૉ. રશીદભાઈ મીર એમ હું અંગત માનું છું. કારણકે તેમના ચાર ગજલ સંગ્રહોમાંથી હું પસાર થયો છું તથા બે અન્ય પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી ડૉ. રશીદભાઈ મીર, ‘નાશાદ’ અને અભિનય સમાચાર ઉપેન્દ્ર ત્રિવેદી વગેરે પાત્રો આ કવિની ઘડાઈ પાછળ મુખ્ય પરિબળ તરીકે ઉપસતાં મને લાગ્યા છે.

કવિના અત્યાર સુધીમાં કવિતા-ગજલ-લેખો વગેરે વિષયો ઉપર ૧૧ (અગિયાર) પુસ્તકો પ્રકાશિત થયા છે. હરકિશન જોખી, મધુ કોઠારી, રાધેશ્યામ શર્મા, યોસેફ મેકવાન, હિતેન આનંદપરા, સતીશ ઉણાક, ચિનુ મોટી, અરુણા ચોક્સી, કરસનદાસ લુહાર અને ડૉ. રશીદ મીર સાહેબ વગેરેએ આ કવિની કવિતાઓ / ગજલો - મુક્તકો વગેરે ઉપર કલમ ચલાવી છે ને કવિનાં સર્જનને બિરદાયું છે.

અંતે મારી ગજલનો એક શે'ર કવિને અપણી કરી વિરમું છું.


રહ્યા ના મૂળ શબ્દો, અર્થ પણ નવા થયા;
અંતર અજવાળી અદ્ભુત કથા તમે દીધી.

C/o. “સંસ્કૃતિ દશન” કાર્યાલય,
સુતનપરા શેરી નં.-૧, નીલકંદ નગરાની સામે,
બાગ દરવાજા, માણસદ-૩૬૨ ફેલો. (મિ. જૂનાગઢ)
મો. ૮૯૩૪૬૦૨૪૮૮



ઇતિહાસ

૧૩ એપ્રિલ એટલે.... જલિયાંવાલા બાગનો નરસંહાર



ડૉ. ભિંહિર એમ. વોરા

મિત્રો, ભુજથી લગભગ ૧૫ કિ.મી. દૂર વંદેમાતરમ મેમોરિયલ આવેલું છે. જેમાં આજાઈના ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના બધા પ્રસંગોનું બારીકાઈથી શબ્દો અને એક કોમ્પ્યુટર બેઝ્ડ ખુલ્લિયમ બનાવાયેલું છે. જેમાં આપને સૌ પ્રસંગોમાં એમ જ લાગે કે આપણે જાણે તેમાં સામેલ છીએ. આવા જ એક પ્રસંગને જોતાં મને આ લેખ લખવાનું મન થયું છે. જે ભારતની આજાઈમાં એક કાળો ધબ્બો છે બ્રિટીશ સરકારે જેની માફી આજ સુધી માંગી નથી, જે એક ચિંતાનો વિષય છે અને તે પ્રસંગ છે જલિયાંવાલા બાગનો નરસંહાર, જે એપ્રિલની ૧૩ તારીખે થયો હતો.

આમ તો આ વાતનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ પણ ફરી પાછો એકવાર તેનું પુનરાવર્તન કરી લઈએ અને જે નિર્દોષ લોકો શહીદ થયા હતા તેમને આ લેખથી શાદીંજલિ આપીએ. આ વાતને ૧૦૨ વર્ષ પૂરા થયા છે, ત્યારે તેની પૂજભૂમિકા જોઈએ.

અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીઓ જલિયાંવાલા બાગ, ભારતના સ્વતંત્રતા સંગ્રહાલયમાં એક અનોખું સ્થાન ધરાવે છે. **૧૩ એપ્રિલ, ૧૯૧૮ના દિવસે ડ્રિગેડિયર જનરલ રેજિનોલ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હક્કુમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશ્ચિન્હિત શાંત એવા આભાસ-વૃદ્ધ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીઓની ઘણા લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘણાલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રહાલયમાં સૌથી વધારે પ્રભાવ પાડ્યો હોય, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મિત હત્યાકંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકંડ સાથે સરખાવી દેવામાં આવે છે.**

૧૩ એપ્રિલ, ૧૯૧૮નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. **૧૩ એપ્રિલ, ૧૯૧૮ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માણું ન જુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મ દિવસના રૂપમાં ઉજવે**

છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વષોથી યોજાતો હતો. તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવતા હતા. અંગ્રેજી હક્કુમતનું દમનકારી વલણ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રહાલય બાદ શરૂ થઈ ચૂક્યું હતું. તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ હક્કુમતને બુલ્લો સાથ આઘ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટીશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટીશ સરકારે **મોન્ટેગુ-ચેમ્સફોર્ડ** સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટીશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાઠી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (૧૮૯૫) લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૧૮માં એક બ્રિટીશ જ્જ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમાણું કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટીશરોનો વિરોધ કર્ય વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણો, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ રોકટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એકટનો હેતુ આજાઈ માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એકટના કાળા કાયદા પ્રમાણો, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશિપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરન્ટ વગર પકડી શકે, તેમના પર વિશેખ ટ્રિભ્યુનલોમાં સ્પષ્ટતા વગર ચુકાદા ચલાવી શકતા હતા.

રોલેટ એકટ તે સમયે બ્રિટીશ હક્કુમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ તંગ બની ગયું હતું. તેને **કાળા કાયદા** તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વહોરી રહ્યા હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચૂક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એકટના વિરોધનું આધ્બાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટીશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડો કરી હતી. જેનાથી જનતાનો આકોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા ટાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન

એપ્રિલના પ્રથમ સમાઈમાં તેની ચરમ સીમા પર પહોંચ્યું હતું. લાઠોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામજા ઉમટેલો રહેતો હતો. લગભગ ૫ હજાર લોકો જલિયાંવાલા બાગમાં જેગા થયા હતા. બ્રિટીશ સરકારના ઘણાં અધિકારીઓને તેમાં ૧૮૫૭ની કાંતિ અને તેમની દસ્તિએ વિખ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.

આંદોળનના બે નેતાઓ સત્યપાલ અને સેકુદીન કિચ્ચતુની ધરપકડ કરીને કાળા પાણીની સજ્જ આપવામાં આવી હતી. ૧૦ એપ્રિલ, ૧૮૧૮ના રોજ અમૃતસરના ઉપ-કમિશનર પાસે આ બંને નેતાઓને મુક્ત કરવાની માંગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં ૫ યુરોપિયન નાગરિકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટીશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૮થી ૨૦ ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું, પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિસા ફેલાઈ ગઈ હતી અને અન્ય ઉ યુરોપિયન નાગરિકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લો લાગુ કરી દીધો હતો.

બૈશાખીના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. તેમાં કેટલાક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યુ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા હતા કે જે બૈશાખી મેળો જોવા માટે પરિવાર સાથે આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યા હતા. જ્યારે નેતા બાગમાં ઊંચાંવાળા સ્થળે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ રેજિનોલ ડાયર ઇંગ્રીઝ બ્રિટીશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાના હાથમાં ગોળીઓ ભરેલી રાઈફલો હતી. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કર્યું હતું. સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિઃશ્વાસ લોકો પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એકમાત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કૂવામાં કૂદી ગયા. પરંતુ જેતજોતામાં તે કૂવામાં લાશોનો ઢગલો થયો હતો.

જલિયાંવાલા બાગના હત્યાકંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી ૧૨૦ લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે ઘણાં ઘણાં વાતાવર માટે પણ કયાંય

લઈ જઈ શકાયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યા હતા. અમૃતસરના તેઘુટી કમિશનરના કાર્યાલયમાં ૪૮૪ શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ ૩૩૮ શહીદોની યાદી છે. બ્રિટીશ સરકારનો અભિલેખ આ ઘણાં માંગણી રજૂ કરે હતું. તેમના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલાઓમાં ૩૩૭ પુરુષો, ૪૧ કિશોરો અને એક દુઃખસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે ૧૦૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા અને ૨૦૦૦થી વધારે લોકો ઘણાં થથા હતા. મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજિનોલ ડાયરે પોતાના વરિઝ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કચ્ચું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેનાથી બચવા માટે તેમને ગોળીબાર કરવા પડ્યા હતા. બ્રિટીશ લેફ્ટનાન્ટ ગવર્નર માઈકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજિનોલ ડાયરને ટેલિગ્રામ કરીને કચ્ચું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો. **આ જધન્ય હત્યાકંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી.** તેના દ્બાખામાં ભારતના સેકેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગુએ ૧૮૧૮ના અંતમાં મામલાની તપાસ માટે **ઇન્ટર કમિશન**ની નિમણુંક કરી હતી. કમિશન સામે બ્રિગેડિયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતા પહેલા જ કર્યો હતો અને લોકોને મારી નાખવા માટે બે તોપો પણ ત્યાં લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બધાર જ રાખવી પડી હતી. ઇન્ટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડિયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો અને તેને અધિકારીઓની એક ખાસ યાદીમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને ભારતમાં ન રાખવાનો નિર્ણય પણ કરાયો હતો. ત્યારબાદ સ્વાસ્થ્યના કારણોથી તે બ્રિટન પાછો ફર્યો હતો. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકંડની નિંદા કરીને પ્રસ્તાવ ખારિજ કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોઉર્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ ખારિજ કર્યો હતો. વિશ્વાપી નિંદાના દ્બાખામાં, બ્રિટીશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ ખારિજ કર્યો, ત્યારબાદ ૧૮૨૦માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડ્યું હતું. ૧૮૨૭માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આજાદી માટે લોકોના જોશમાં આવી ઘણાંથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકંડ બાદ લોકોમાં આજાદીની આકંશા

વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતા સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આજાદી માટેની યાહત જોઈને ગાંધીજીએ ૧૯૨૦માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. ૧૩ માર્ચ, ૧૯૪૦ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટીશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમસિંહને ૩૧ જુલાઈ, ૧૯૪૦ના રોજ ફાંસીએ ચઢવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નહેરુએ ઉધમસિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી. જલિયાંવાલા બાગના હત્યાકાંડે ત્યારે ૧૨ વર્ષની ઉમરના ભગતસિંહના વિચાર પર ધેરો ગ્રભાવ પાડ્યો હતો. હત્યાકાંડની માહિતી મળતા જ ભગતસિંહ પોતાની શાખાએથી ૧૨ માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ધરે લઈ ગયા હતા. આ ભગતસિંહ પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ ફાંસીના માંચે ચઢવ્યા હતા. આમ, આ ઈતિહાસને, આ મુજિયમમાં નજીકથી કમ્પ્યુટર ટેકનોલોજીના માધ્યમથી જોયો તો મને અંદરથી થયું કે આ લોકોનો શો વાંક હતો? તેની પાછળ શહીદ ઉધમસિંહ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા વીર અને શહીદોથી જ દેશને સાચી આજાદી મળી હતી. તેમનું બલિદાન કદ્દી પણ ભૂલી જવાય તેવું નથી. આપણી યુવા પેઢી આ જ્ઞાનને હંમેશ યાદ રાખે એટલે જ મેં આ લેખ લખ્યો છે.

જ્ય હિંદ, વંદે માતરમ અને શહીદો અમર રહો તેવા નારાથી મારો આ લેખ પૂરો કરું છું.

હજુ પણ બ્રિટીશના બુદ્ધિજીવીઓ ભારતમાં આવીને પોતાનો દોષ માને છે પણ માઝી માંગવા તૈયાર નથી. ખરેખર, તો બ્રિટીશ સંસદે એક માર્ફાનો પ્રસ્તાવ પાસ કરવો જોઈએ. તેને બદલે હજુ પણ રાબેતા મુજબ ભારતના આંતરિક મામલામાં પોતાનું માથું માર્યા કરે છે. પણ સરકારની મજબૂત વિદેશ નીતિથી તેઓ નબળા પડે છે એ પણ એક સારી બાબત છે. મિત્રો, અનેક અખબારો અને પુસ્તકોમાં નામી અનામી લેખકોએ આ બનાવની સાચી વાતો લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે તે સૌને મારા વંદન. નહિતર આ ઈતિહાસ આપણી સમક્ષ આવ્યો જ ન હોત, તે પણ એક હકીકત છે.

સંદર્ભ: ભારતનો ઈતિહાસ, વિવિધ અખબારી લેખો અને જલિયાંવાલા બાગનો ઈતિહાસ

“પરમેશ્વરી”, પ્લોટ નંબર ૧૬૫, હોસ્પિટલ રોડ,
વિજયનગર એરીયા, મુજફા, કર્ણાસ્થા ೫೯೦ ૦૦૭.

મો. ૯૮૮૮૦ ૭૭૨૮૫

વિદેશી અને આપણી સંસ્કૃતિ – કોણ ચઢે?

(અનુસંધાન : પાના નં. – ૧૮ ઉપરથી ચાલુ)

દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત ફરજ સમજે અને શરૂઆત ‘હું’ થી કરે. બાકી દરેક વ્યક્તિ એવું વિચારે કે ‘મારે શું?’ તો તે સુવ્યવસ્થિત અને સ્વચ્છ ભારતનું નવનિર્મિષ અશક્ય છે. એના માટે દરેક વ્યક્તિએ પોતે જેવું ઈશ્છતા હોય તેવું વર્તન તેણે બીજા સાથે રાખવું જોઈએ. દરેક સમાજની બે બાજુ હોય છે : સારી અને નરસી. તો આપણે વિદેશી સમાજની માત્ર સારી બાબતોને અપનાવીને જીવન સુદ્રટ બનાવવું જોઈએ.

કાયદાની દિલિએ જોઈએ તો પણ આપણા દેશનો કાયદો રક્ષકને બદલે ભક્ષક વધુ છે કારણકે કોઈમાં કેસ દાખલ થાય પછી માણસની જિંદગી પૂરી થતાં સુધી તેનો નિવેદો આવતો નથી. કંઈ તો વ્યક્તિ કેસ કરવાનું માંડી વાળે છે અથવા કેસ કર્યો હોય તો લડવાનું માંડી વાળે છે. ગુનેગાર પણ પૈસા દ્વારા સજી ભોગવ્યા વિના આરામથી છૂટી જાય છે અને નિર્દ્દેખ દંડાય છે. જ્યારે સાચી વ્યક્તિ પાસે પૂરતી સાબિતી અથવા સાક્ષી ન હોય ત્યારે તેને ન્યાય મળતો નથી. ઘણી વખત પૈસા દ્વારા મોટા માથાઓ પણ ખોટા સબૂત અને સાક્ષી દ્વારા આરામથી અહૃદાસ્ય કરતા છૂટી જાય છે. આપણા કાયદાના બંધારણમાં પણ ફરજાર કરવાની જરૂર છે. જેમાં આપણા કરતાં વિદેશી સંસ્કૃતિ ચઢિયાતી છે.

આપણી સંસ્કૃતિનું માન જાળવવા માટે શરૂઆત ‘હું’થી થવી જોઈએ. દરેક વ્યક્તિએ પહેલ કરી આદર્શ જીવન જીવવા માટે નૈતિક ફરજ બજાવવી જોઈએ.

વિદેશી સંસ્કૃતિ કરતાં આપણી સંસ્કૃતિ, સંસ્કારની દિલિએ ચઢિયાતી છે. જ્યાં દ્યાય, માયા, મમતા, પ્રેમ જોવા મળે છે જ્યારે વિદેશમાં આવી લાગણીઓ ઓછી જોવા મળે છે.

છતા આપણા કરતાં વિદેશમાં રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન વ્યવસ્થિત રીતે થાય છે. આપણા દેશમાં જ્યાં - ત્યાં કચરો નાખી ગંદકી થાય છે. આપણે તો જાણો આપણા આખા દેશને ઉસ્ટબીન બનાવી દીધો છે. જ્યારે વિદેશમાં જ્યાં ત્યાં કચરો નાખનારને પણ દંડ કરવામાં આવે છે. ત્યાં ટેર ટેર ઉસ્ટબીન છે. આપણે તો ઉસ્ટબીન હોવા છતાં સગવડ પડે ત્યાં આરામથી કચરો ફેંકી દઈએ છીએ.

છેલ્લે, દુઃખ સાથે એટલું જ કહેવાનું મિત્રો કે, આપણે આપણી સંસ્કૃતિને ભૂલી વિદેશી સંસ્કૃતિને અપનાવીને આપણો પેલી કહેવત પ્રમાણે ‘ન ઘરના કે ન ઘાટના રહ્યા’ જેવી સ્થિતિ આજે આપણી સંસ્કૃતિની છે.



संस्कृति

વિદેશી અને આપણી સંસ્કૃતિ – કોણ યાડે?



ભાવના હીરપરા

વિદેશી સંસ્કૃતિ કરતાં આપણી સંસ્કૃતિ ચહિયાતી છે એવું આપણે ઈચ્છા હોઈએ તો પહેલાં આપણે ખુદે જ આપણા જીવનની નીતિ, રીતિ, શિષ્ટાચાર, શિસ્તતા, સ્વચ્છતા, શિક્ષણ, કાયદો, પહેરવેશ, કામના ધોરણો વગેરેમાં બદલાવ લાવવાની જરૂર છે. હું અને તમે ભધાએ વાતો કરનારે શરૂઆત ‘હું’ થી કરવાની જરૂર છે. દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ ગણી પહેલ કરવી જોઈએ.

આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. એ માટે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. ધારણા યુવકો કે યુવતીઓ વિદેશી વસ્તુ વાપરવામાં ગૌરવ અનુભવે છે. પોતાનો વટ પાડે છે. ધારણા મા-બાપને પણ પોતાના છોકરા-છોકરીને વિદેશ ભાગવા અથવા નોકરી વ્યવસાય માટે મોકલવાની આંધળી ઢોટ છે, જે ખોટું નથી પરંતુ પહેલા આપણે આપણા દેશનું ગૌરવ જાળવી આપણા દેશનો વિકાસ કરવો જોઈએ. તિથી હાંસલ કરી વિદેશ સ્થાયી થવાના બદલે આપણા દેશની સેવા કરવી જોઈએ.

આપણી સંસ્કૃતિના વિકાસ માટે તન-મન-ધનથી સેવા કરવી જોઈએ, અનું રક્ષણ કરવું જોઈએ. **આજે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ.** આપણી સંસ્કૃતિ આજે વિદેશમાં વખણાય છે. લોકો તેનું ગૌરવ લે છે કે ભારતીય લોકો સંસ્કારી છે. દુઃખની વાત તો એ છે કે આપણે ખુદ જ આપણી સંસ્કૃતિની અસ્મિતા જાળવતા નથી કે તેનું ગૌરવ જાળવતા નથી.

આપણે જ વિદેશી રંગે રંગાઈ ગયા છીએ. વિદેશી સંસ્કૃતિમાં બધું જ ખરાબ નથી. પરંતુ આપણે તેના ખરાબ પાસાને અપનાવ્યા છે અને સાચું અને સાચું છોડી દીધું છે. ટૂંકમાં, વધુ પડતા ફેશનેબલ થઈ ગયા છીએ. આપણે તેમના ટૂંકા કપડા અપનાવ્યા છે. આપણી સાડી તે લોકો પહેરે છે. આપણે તેમની અંગેજી ભાષા અપનાવી છે, તે ખોટું નથી પરંતુ આપણે આપણી મૂળ સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. આપણે આપણી ભારતીયતા ભૂલવી ન જોઈએ. આપણાને આપણા દેશનું ગૌરવ અને સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ.

ખરેખર. વિદેશી લોકોએ તો આપણા સંસ્કારોને જ

અપનાવ્યા છે. આપણી નેગેટિવ સાઈડ તેમણે અપનાવી નથી. તેથી જ તો આજે વિશ્વના બાવન દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયેલો છે અને ત્યાં સ્વામિનારાયણના મંદિરો બંધાયેલા છે.

આપણે ખુદ આપણા દેશનું પતન કરીએ છીએ. આજે શિસ્ત પાલનની વાત આવે ત્યારે વિદેશમાં સ્ટિક્ટલી તેનું પાલન થાય છે. આપણે ત્યાં તો લોડો ડ્રાઇવિંગ પણ આડેથડ કરે છે. ચાર રસ્તાઓ પર સિંગલનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. નિયમોને નવે મૂકીને ચાલનારો આપણો દેશ છે. વિદેશમાં ટ્રાફિક નિયમોનું પાલન CCTV કેમેરા હારા થાય છે. જ્યાં કોઈ પોલીસમેનની જરૂર પડતી નથી. આપણે ત્યાં ચાર રસ્તાઓ પર બે-ત્રણ પોલીસમેન હોય છે છતાં સરેઆમ નિયમોનું ઉલ્લંઘન થાય છે અને સો-બસો રૂપિયામાં સેટિંગ કરી છૂટી જાય છે. જેથી દંડ કે સજા થતી નથી. રાહદારી અને ટ્રાફિક પોલીસમેન બંને સેટિંગ કરે છે.

આપણો દેશ સેટિંગનો દેશ છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ભાષાચારને સેટિંગનું રૂપાળું નામ અપાય છે. મિત્રો પણ પૂછતા હોય કે, ‘કેટલામાં સેટિંગ કર્યું?’ વળી, સલાહ પણ આપે કે ‘સેટિંગ કરી નાખને, એટલે પતે!’ આવું માત્ર ટ્રાફિકના નિયમો માટે નહીં, જીવનની ઘણી બાબતો જેમાં કાયદાનું ઉલ્લંઘન થાય છે તેમાં આ પ્રકારનું વલણ જોવા મળે છે. જેમાં સમાજનો એક પણ વર્ગ બાકી રહેતો નથી. જેમાં સરકારી કર્મચારી, પોલીસ, ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરે પોતાના બિસ્સા ભરવા માટે ભાષાચાર કરે છે અને સામેની વ્યક્તિ પણ પોતાના હિત માટે કે કામ કરાવવા માટે પૈસા આપી ભાષાચાર કરે છે.

આપણી સંસ્કૃતિએ વિદેશી સંસ્કૃતિને થોડેધારો અંશો અપનાવી છે – જેમાં ખાસ કરીને બાળપીણી, રહેણીકરણી, પહેરવેશ, ભાષા વગેરે અપનાવી છે તો વિદેશી સંસ્કૃતિની શિસ્તબદ્ધતા, તેના શિષ્ટાચાર, સ્વચ્છતા, ટ્રાફિક નિયમ, કામ કરવાની રીત વગેરે કેમ નહીં? વિદેશી સંસ્કૃતિ ગલત નથી પરંતુ તેમાંથી સમાજને ઉપયોગી સારું અને સાચું અપનાવવં જોઈએ.

સુગ્રથિત સમાજનું નવનિર્માણ ત્યારે જ શક્ય બને જ્યારે

(અનુસંધાન : જારો પાના નં. - ૧૭ ઉપર)



નવલિકા

આવ વ્હાલાં આવ!



નટવર આહલપરા

ગમમાં બેદુ સવજીભાઈ થોડું ભણેલા વ્યવહારું માણસ હતા. સવજીભાઈ અને સમતાબહેન કોરાભંડ બેતરમાં બેઠા હતા. અખાંડ પસાર થઈ ગયો હતો. બંનેએ આકાશ ભણી નજર નાખી.

નિસાસો નાખી સવજીભાઈ બોલ્યા : ‘મનજીની બા, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. બિયારણ, ખાતરનો કેટલો ખર્ચ કર્યો? કેટલી મહેનત કરી. વળ્યું, કાંઈ નહીં!’

પતિને હિંમત આપતા સમતાબહેને કહ્યું : ‘હૈયે ધરવ રાખો. મારો ભગવાન બહુ દયાળું છે. બધા સારા વાના થાશે. આમ આકળા કેમ થાઓ છો?’

અખાંડ પછી શ્રાવણ. સવજીભાઈને કાંઈ સૂજતું નહોતું. થાકી હારીને લમણો હાથ દર્દને બેસી ગયા. બેતરમાં રોજ ન મળતા ગામના લોકો સરકારના રાહત કાર્યોમાં જાહેર થયેલા દુકાળને લીધે પાળા બાંધવાના અને ખાળિયા ખોદવાના કામમાં રહી ગયા. શું થાય? પેટનો ખાડો તો પૂરવોને? આવા વિચારથી મજૂરી કામ કરવા મંડ્યા હતા.

અને એક દિવસ શું થયું? બપોરના બાર વાગ્યા હતા. તપતા મધ્યાહ્ન વાદળાઓ ગોરંભાયા. વાતાવરણે પલટો લીધો. જોરદાર પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. બારમેદ ખાંગા થયા હતા. સૂપડાધારે વરસાદ પડતો હતો. ખાળિયો ખોદતાં મજૂરો રાજીના રેડ થઈ ગયા હતા.

સવજીભાઈ નાચવા મંડ્યા હતા. તેઓ બોલતા હતા : ‘આવ મહારાજ... આવ! આવ, મારા વ્હાલા આવ! અરે, મનજીની બા, મગ-લાપસીના આંધણ મૂકો. આ મારા વ્હાલીડાએ લાજ રાખી છે. આપણને ઉગાર્યા છે, મારા બાપ!’

બાર કલાક અનરાધાર વરસાદથી સવજીભાઈનું બેતર જળબંબાકાર થઈ ગયું હતું. બેતરના શેઢે ઊભેલા દુકાળ રાહત કામના માણસો માથા ઉપર પોટફોલિયો મૂકી મોહું બગાડતાં બોલતા હતા : ‘આ વરસાદે આવીને આપણો આખોયે ‘ખાન’ બગાડી નાખ્યો.’

સવજીભાઈ સાંભળતા હતા. તેમનાથી ન રહેવાયું. તેઓએ માણસોને સંભળાવી દીધું : ‘આ મુંગા ઢોરની, જાડવાની, પશુ-પંખીની અને જવજંતુની દયા ભગવાનને તો હોય ને? આપણે

લાગણી વગરના થઈ ગયા ધીએ. પછી ધરમાં સુખ-શાંતિ ક્યાંથી હોય? હવે, પાછું વાળીને જુઓ મારા ભાઈ. આપણે જ આપણી ધોર ખોદી છે. દયા, માનવતા રાખો. સ્વાર્થી થાઓ મા!’

સવજીભાઈની સામે મોહું બગાડીને સૌ ભાગ્યા અને બોલતા હતા : ‘આ કળયુગમાંય સવજીભાઈ જેવા માણસોય છે ખરાં, કેમ?’

બીજા દિવસે સવારે સવજીભાઈ અને સમતાબહેન પોતાના પૌત્ર-પૌત્રીને વડલાના છાંયે બેતરમાં રમાડતા હતા. છોકરાઓએ રમત માંડી.

સૈયર રમવાને આવો. અમને રમતા નો આવડે. રાખે ગોવિંદ રાધે, શીરાપુરી રાધે, શીરાને તો વાર છે, પૂરીઓ તૈયાર છે. જમે હરગોવિંદ, પીરસે ભોળાનાથ. ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલા માંડે છે. ગણ ગણ મોરલો ને તેલ-તેલ પળી. ઉઠે લાલિયા શુંપડી બળી. બળતી હોય તો બળવા દે, ઠરતી હોય તો ઠરવા દેજે, આવરે કાગડા કઢી પીવા, ઈતે ઈતે પાણી, ધૂળ-ધૂળ ધાણી. આ દરવાજો ખોલુંગા. તાવડીમાં કંકરા તડ-તડ થાય, સાસુ વહે ને વહુ ભજિયા ખાય!

સમતાબહેન અને સવજીભાઈ પૌત્ર-પૌત્રીને કુદરતના ખોળે રમતા જોઈ હરખાતા હતા, ભગવાનને પ્રાર્થના કરતા હતા કે, ‘હે પ્રભુ! અમારી લીલીવાડી કાયમ હરીભરી રાખજે.’

સવજીભાઈનું બેતર ધોરીમાર્ગ ઉપર હતું. ગામની વસતી વીસ હજારની હતી. કોલેજ, સ્કૂલ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, લગભગ બધી સગવડ ગામમાં હતી. સુંદર પંચાયત પણ હતી. સવાર-સવારમાં ધોરી માર્ગ ઉપર ચાલતા લોકોની ચર્ચા સવજીભાઈ સાંભળતા હતા.

‘આ ઓવરવેઈટ એસી કિલો? બાંસઠ હતું તેમાં ટેરિફીક! યાર, તને બી.પી. હાઈ રહે છે, તો મને ડાયાબિટીસ છે. મહેશનું કોલેસ્ટેરોલ વધતું જાય છે. જ્યેશની વાઈફિને લો બી.પી. હેરાન કરે જ છે. મયૂરે એન્જિયોગ્રાફી કરાવી છે, તો ઐતિકે બાયપાસ અને જ્યેશને સોરાયસીસ છે. પ્રકાશની હોજરીમાં પાણી ભરાયું છે.

પુરુષોના ટોળામાં ગણગણાટ હતો. ત્યાં મહિલાઓએ બડબડાટ શરૂ કર્યો.

(અનુસંધાન : જુઓ પાના નં. – ૨૨ ઉપર)



પરિવર્તન

ધી ના ઠામમાં ધી



ઓમ. ડૉ. સોલંકી

અને ત્યારે શેતા તમારો ચોવીસી ચહેરો ગુસ્સાની આગથી તમતમી ગયેલો. તમારી મનોસ્થિતિ કાપો તોય ટીપુંય લોહી ના નીકળે એવી થઈ ગયેલી. તમારા સાસુ સરલાબહેન પર તમને પાર વગરનો ગુસ્સો આવી ગયેલો, પરંતુ કોણ જાણે કેમ તમારા સ્વભાવની વિરુદ્ધ જઈને પણ તમે સરલાબહેનને એક પણ શબ્દ ના કહ્યો. શેતા તમે ગુસ્સાને જ ગળી ગયેલા!

શહેરના શ્રીમંતુ પરિવારમાં ભારે લાડકોડથી ઉછેરેલા શેતા, તમે તમારા મમ્મી-પપ્પાનું પ્રથમ સંતાન. એકની એક લાડકવાયી દીકરી હતા. અને એટલે જ તો પાણી માંગો ત્યારે દૂધ હાજર! એવી પરિસ્થિતિમાં તમારું બાળપણ પૂરેપૂરી સ્વતંત્રતાથી વિતેલું. કે.જ.થી માંડીને કોલેજકાળ સુધીનું શિક્ષણ પણ શેતા, તમારી મરજ મુજબ જ થયેલું. મમ્મી-પપ્પાની વધારે પડતી કાળજી, લાડપાર અને તમારા સ્વતંત્ર મિજાજ જાણો-અજાણે તમારા મનમાં અહંમના અહંકારી બીજનું રોપણ થઈ ગયેલું. જે સુષુપ્ત બીજમાંથી સમયાંતરે અંકુરણ પામીને અહંમનો લીલોછમ છોડ પાંગરી જશે એવી કલ્યના તો શેતા તમે સ્વખમાંય નહોતી કરી. બરાબરને શેતા?

તમારા મેરેજ, શેતા તમારી પોતાની પક્સંદગીથી જ રવિ સાથે થયેલા. રવિ પડજેના શહેરની જાણીતી ફર્મમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા. નસીબ જાણે કે તમને સંયુક્ત પરિવારમાં ખેંચી ગયેલું. જ્યાં સાસુ-સસરા સાથે બારેક વ્યક્તિઓ એક જ રસોડે જમતા હતા. પરિવારમાં તમારા પતિ રવિ સૌથી નાના હતા. સૌથી મોટાભાઈનું બે વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. વચેટભાઈ મેડિકલ સ્ટોરનું સંચાલન કરતા હતા.

લગ્ન જીવનના શરૂઆતના છઅએક મહિના તો ખૂબ સારું ચાલ્યું. પણ પછી શેતા, તમને સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવાની ઈચ્છા થવા લાગી અને એક દિવસ તમે તમારા પતિ રવિ સમક્ષ તમારી આ ઈચ્છા રજૂ પણ કરી દીધેલી. ત્યારે તમારી આ માંગણી પરત્વે રવિએ ઠંડો પ્રતિસાદ આપતા કહેલું : ‘આપણા પરિવારમાંથી તારે અલગ રહેવું છે એમ? અને એ માટે હું મારી બદલી અન્ય સ્થળે કરાવી લઉં. ટીક છે, હું મારી બદલી અંગે વિચારી જોઈશ.’

શેતા, તમારા બંને જેઠાણીઓ સંયુક્ત પરિવાર અને ઘરના વાતાવરણમાં એક-મેક થઈ ગયા હતા. પરંતુ તમને સંયુક્ત

પરિવારમાં અકળામણ થવા લાગી હતી. ક્યારેક તમારા રૂમમાં બિનજરરી ચાલુ રહેલી લાઈટ કે પછી પાણીનો વાશજોઈતો થતો વ્યય જોઈને સાસુ સરલાબહેન તમને મીઠી ટકોર કરી લેતા. સરલાબહેનની આવી ટકોરથી શેતા, જાણો-અજાણે તમારા મનમાં રહેલો અહ્મુ ઘવાતો. તમારા મનમાં ધીરે ધીરે સાસુ તરફ નેગેટિવ ગ્રંથિ બંધાવા લાગી. તમને તમારા સાસુ સરલાબહેન જૂનવાણી અને જક્કી લાગ્યા. નવા જમાનાની એમને બિલકુલ ખબર જ નથી એવું તમે મનોમન માની લીધું.

એક દિવસ તમારા સાસુ સરલાબહેનની ગેરહાજરીમાં શેતા, તમે તમારા બંને જેઠાણીઓ સમક્ષ ફરિયાદના સૂરમાં કહેલું : ‘આપણા સાસુ ઘરના કામકાજ બાબતે અવારનવાર ટકોર કર્યા કરે છે. અમુક બાબતોનો હંમેશાં આગ્રહ રાખે છે. આ બધું તમને જરાય કઢતું નથી? તમે બંને શા માટે આવી બાબતોને સહન કર્યા કરો છો? હવે તો જમાનો ઘણો બદલાયો છે. એટલે એમણે પણ સમય પ્રમાણે બદલાયું જોઈએ ને?’ તમારા બંને જેઠાણીઓ એમના વિચાર, વર્તન અને વ્યવહારમાં પરિપક્વ હતા અને એટલે જ તો શેતા, તમારી વાત શાંતિથી સાંભળ્યા પછી એમણે કહેલું : ‘શેતા, આપણે સૌ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. એટલે વડીલોના મનની શાંતિ માટે ક્યારેક કોઈ બાબતે આપણે થોડું સહન કરવાનું આવે તો પણ કરી લેવું જોઈએ. આવા સંયુક્ત પરિવારમાં રહેવાથી એકબીજાની મુશ્કેલીના સમયે પરસ્પર એકબીજાને હુંફ - ઓથ મળી રહે છે. ઘરના કામકાજમાં આપણા સાસુ તરફથી થતી ટકોર બાબતે જરાયે ખોડું લગાડવાનું ના હોય. એ જે કંઈ કહેતા હશે એમાં તો આપણા આખાય પરિવારની ભલાઈ હશે. કોઈ આપણને ટકોર કરે એથી કોઈ નુકસાન થતું નથી, ઉલટાનું આપણી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ સુધરી જાય.’

બંને જેઠાણીઓની વાત સાંભળ્યા પછી પણ શેતા, તમારા મનનું સમાધાન થયું જ નથી. અને એટલે જ તો સંયુક્ત પરિવારમાંથી અલગ થઈને સ્વતંત્ર રહેવાની ઝંખના તમારા દિલો-દિમાગમાં ઉત્તરોત્તર બળવતર બનતી જ રહી. અને એમાં એક દિવસ વાતનું વતેસર થઈ ગયું!

સંયુક્ત પરિવારમાં વણલઘ્યો એક નિયમ હતો કે સ્નાન

કર્યા સિવાય કોઈએ રસોડામાં પ્રવેશ કરવો નહીં. આ નિયમમાં કોઈ બાંધછોડ ક્યારેય થતી જ નહીં. તમારા પતિ રવિની ગેરહાજરીમાં શેતા, સવારે તમે સ્નાન કર્યા વગર જ રસોડામાં પ્રવેશી ગયા. એ સમયે તમારા સાસુ સરલાબહેને તમને કહ્યું, ‘શેતા, તું સ્નાન કર્યા વગર જ રસોડામાં કેમ આવી? આ બરાબર ના કહેવાય. જા, સ્નાન કરી લીધા પછી જ રસોડામાં આવજે.’ અને ત્યારે શેતા, તમારો ચોવીસી ચહેરો ગુસ્સાની આગમાં તમતમી ગયો. તમને તમારો અહ્મુ ઘવાયો હોય એવું લાગ્યું. તમને મનમાં થયું, આજનો માનવી ચંદ્ર-મંગળ સુધી પહોંચી ગયો છે. આખીય દુનિયા પ્રગતિના પંથે હરણફાળ ભરી રહી છે. આજે સૌ એકવીસમી સદીમાં જુવે છે જ્યારે આ જુનવાણી સાસુના માનસમાં જરા સરખોય ફેરફાર થયો જ નથી. શેતા, આ બધા શબ્દો તમારી જીભ પર આવીને જ અટકી ગયેલા. એટલું જ નહીં, તમારા મનમાં આવેલા ગુસ્સાને પણ તમે ગળી ગયેલા, ખું ને?

શેતા, દિવસોભર તમારા મનમાં સવારનો આ પ્રસંગ વારંવાર રીટેક થતો જ રહ્યો અને તમે મનોમન નિર્ણય કરી જ લીધો — ગમે તેમ કરીનેય રવિની બદલી દૂરના શહેરમાં કરાવી લેવી. જેથી સંયુક્ત પરિવારની આવી ઝંઝટમાંથી કાયમી છુટકારો મળી જાય અને પછી તો પોતાની રીતે પૂરેપૂરી સ્વતંત્રતાથી રહી શકશે.

ચારેક દિવસ પછી મોકો મળતા જ શેતા, તમે રવિને બદલી કરાવવાની વાતની યાદ અપાવી. જવાબમાં રવિએ કહ્યું, ‘શેતા, હું મારી રીતે બદલી કરાવવાના પ્રયત્ન કરું છું... પણ...’

‘જો રવિ, એમાં હવે પણ જેવું કશુંય આવે જ નહીં. બદલી કરાવવા બાબતે ખાનગીમાં કંઈ આપવાનું થાય તો પણ તમે હા પાડી દેજો. હું મારા મમ્મી-પપ્પા પાસેથી લઈ આવીશ. બસ, એકવાર બદલી થઈ જાય પછી જાણો કે ગંગા નહાયા! પછી તો બસ, આપણે બંને આપણી રીતે સુખચેનથી રહીશું.’

સમયનું ચક એની નિરંતર ગતિથી ફરતું રહ્યું.

સમયાંતરે સૌથી મોટા જેઠાડી વિમળાબેનના દીકરાના લગ્ન લેવાયા. આ પ્રસંગે અકાળે અવસાન પામેલા વિમળાબેનના પતિની યાદે સંયુક્ત પરિવારમાં સૌની આંખો ભીની થઈ ગઈ. ભારે હૈથે પ્રસંગની શરૂઆત થઈ. લગ્ન પ્રસંગે દીકરા-વહુને પોંખણા કોણ કરે? એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. કુટુંબ - સગાવહાલામાં આ બાબતે ચણાભણ શરૂ થઈ ગઈ. દીકરો વિમળાબેનનો ખરો, પણ એ તો વિધવા ગજાય! એમનાથી કંઈ દીકરા-વહુના પોંખણા ન થાય! અને કદાચ કરે તો પછી સારા પ્રસંગે અપશુકન થાય. અને પછી તો એના પરિણામ પણ માઠા જ આવે ને? આવા પેચીદા પ્રશ્ન વખતે સરલાબહેને મક્કમતાથી એક જ વાત કરી, ‘વિમળા જ એના દીકરાની મા છે. એટલે

એના દીકરા-વહુને પોંખવાનો હક્ક એને જ છે. વિધવા, દીકરા-વહુને પોંખશો તો અપશુકન થશે એવી જૂની માન્યતા સાચ ખોટી અને ભૂલભરેલી અને જુનવાણી છે. હવે જમાનો આટલો બધો આગળ વધ્યો છે ત્યારે બદલાતા સમયમાં આવી જૂની અને અંધ્રશ્વાસાળી માન્યતાઓ ચલાવી લેવાય જ નહીં. દીકરા-વહુને એની જનેતા ના પોંખે તો પછી બીજું કોણ પોંખે? સરલાબહેનના આ નિર્ણયથી સંયુક્ત પરિવારમાં આનંદ છવાઈ ગયો. સૌથી વધુ આનંદ દીકરાની જનેતા વિમળાબેનને થયો. એમની આંખમાં હરખના આંસુ આવ્યા. એમનું હૈયું ભીનું ભીનું થઈ ગયું. દીકરાના લગ્નનો પ્રસંગ સૌથી સાથે મળીને આનંદથી પૂરો કર્યો.

પછીના દિવસોમાં રવિને કંપનીના કામે ચેનાઈ જવાનું થયું. ત્યાં એને એક અંડવાડિયું રોકાવાનું હતું. વાપરલની અસરના કારણે શેતાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જરૂરી રીપોર્ટ કરાવ્યા પછી ડોક્ટરોએ ત્રણ દિવસ સુધી હોસ્પિટમાં રોકાવાનું કહ્યું. શેતા, તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. આ સમયે શરૂઆતથી જ તમારા સાસુ સરલાબહેન તમારી સાથે જ હતા. હોસ્પિટલના બેડ પર સૂલેલા શેતા, તમારા માથે હાથ ફેરવીને સરલાબહેને તમને કહ્યું, ‘શેતા દીકરી, તું જરાય મુંજાઈશ નહીં. હું તારી સાથે જ છું. બે દિવસમાં જ તને સારું થઈ જશે. હિંમત રાખજે.’ તમારા નાના-મોટા બંને જેઠાડીઓએ રાતના સમયે હોસ્પિટલમાં તમારી પાસે રોકાવાની વાત કરતા કહ્યું, ‘બા, હંડીના કારણે તમે પણ બીમાર પડી જશો. અમે બંને વારાફરતી શેતા પાસે રોકાઈશું.’ પણ સરલાબહેન માન્યા નહીં. હોસ્પિટલમાં એ જ રોકાયા. વહેલી સવારે વેર જઈ પ્રાતઃકિયાથી પરવારીને મસાલાવાળી ચા અને નાસ્તો શેતા તમારા માટે લાય્યા અને તમને ચા-નાસ્તો લેવા કહ્યું. ત્યારે શેતા તમે બોલ્યા કે, ‘બા, હજુ મેં બ્રશ જ કર્યું છે. હમણાં સ્નાન કર્યા પછી ચા-નાસ્તો લઈશ.’ જવાબમાં તમારા સાસુએ કહેલું, ‘અરે દીકરી શેતા, કોઈપણ નિયમ તો સાજ માણસો માટે જ હોય, બીમાર માટે નહીં. તું શાંતિતી ચા-નાસ્તો કરી લે.’ સાસુ સરલાબહેનના આ શર્દૂમાંથી પુત્રવધૂ માટે નીતરતા સ્નેહની સરવાણીમાં શેતા, તમારું અંતર અને આંખ ભીજાતા રહ્યા. મનોમન તમને થયું, ‘મારા સાસુ ભવે કોઈ વાતની ટકોર કરે, બાકી એમના હૃદયમાં તો દીકરા-વહુ માટે જનેતા જેવી જ લાગણીઓના ઘોધ વહે છે.’

હોસ્પિટલમાંથી શેતા, તમે તમારા સાસુ સાથે ઘરે આવ્યા ત્યારે તમે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ બની ગયા હતા. રાત્રે જમ્યા પછી બેડરૂમમાં જઈને તમે તમારા પતિ રવિનો મોબાઈલથી ચેનાઈમાં સંપર્ક કર્યો. સામે રવિએ પૂછ્યું, ‘શેતા મેડમ, કેમ છો? તબિયત સારી થઈ ગઈ ને?’

‘બસ, રવિ, હું એકદમ ફીટ છું. તમે જમી લીધું?’

‘હા, જમીને જ બેડ પર બેઠો છું.’

‘રવિ, મારે તમને એક અગત્યની વાત કહેવી છે. સાંભળો.... મેં અગાઉ તમને તમારી બદલી વિશે વાત કરી હતી એ યાદ છે ને?’

‘હા, હા, બસ, આ અઠવાડિયે જ મને મારી બદલીનો લેખિત ઓર્ડર મળી જશે. એવા મેસેજ બપોરે જ મને મળી ગયા છે. શેતા, હવે તો તું રાજુ થઈશ ને?’

‘ના, ના, રવિ, હવે તમારે બદલી કરાવવાની કોઈ જરૂર નથી.’

‘બદલી કરાવવાની જરૂર નથી એમ? પણ કાંઈ કારણ?’
ઉતાવળા થઈને રવિએ પૂછ્યું.

‘ਬਸ, ਏਮ ਜ. ਆ ਘਰ ਅਨੇ ਆਪਣਾਂ ਸੰਯੁਕਤ ਪਰਿਵਾਰ ਵਿਨਾ ਛੁੱ ਬੀਜੇ ਰਹੇਵਾ ਜਈਂਦ ਤੋ ਤਾਂ ਮਨੇ ਏਕਲੁੰ ਲਾਗ਼ੇਹੇ। ਆਪਣਾ ਸੰਯੁਕਤ ਪਰਿਵਾਰ ਸਿਵਾਅ ਬੀਜੇ ਮਨੇ ਕਥਾਂਚ ਗਮਸੇ ਜ ਨਹੀਂ। ਹਵੇ ਆਪਣੇ ਸੌਨੀ ਸਾਥੇ ਜ ਸੰਯੁਕਤ ਪਰਿਵਾਰਮਾਂ ਰਹੀਥੁੰ। ਰਖਿ, ਕੋਈਪਣ ਕੁਝੁੰਬਮਾਂ ਸੰਬੰਧੋਨੀ ਪਰਖ ਕਟੋਕਟੀਨਾ ਸਮਾਏ।

આવ હાલાં આવ!

(અનુસંધાન : પાના નં. - ૧૯ ઉપરથી ચાલુ)

‘ઉભ્યલ, લીજા, સ્વિટી આ પિત્જા, સેન્ડવીચ, ચાઈનિઝ પાસ્ટરા, ફાસ્ટ ફૂડની મજા લઈએ છીએ છતાં તંદુરસ્તીમાં રોજ તકલીફ! ધોરી માર્ગની બંને બાજુ હાથમાં ત્રિકમ ઉપાડી મજૂરી કરતા મજૂર શરીરે કેવા હેલ્લી છે! કેવા ગણગણે છે! કેવી મજા લે છે! આપણાને બધું મળ્યું છે, છતાં હોસ્પિટલના ઘક્કા જ ખાવા પડે છે!’

સવજુભાઈએ નિસાસો નાખ્યો. આ પરદેશની નકલે તો આપણા દેશની ઘોર ખોડી નાખી છે. બધાને નમાલા જનાવવાનો કારસો લાગે છે.

સમતાબહેને પતિ સવજ્જભાઈને હિંમત આપતા કહ્યું કે,
 ‘સારું છે, આપણા દીકરા મનજી, સવજી, રવજી શહેરમાં નથી
 ગયા. બંને રાજ થઈ વાતો કરતા હતા. બેતરમાં લીમડા નીચે
 ખાટલો ઢાળી દૂર સુધી નજર નાખતા હતા. વરસાદનું વાતાવરણ
 બરાબર જામ્યું હતું. વાદળાએ ચેંદ્રને ઢાકી દીધો હતો. પવનના
 સૂસવાટા વચ્ચે વરસાદ શરૂ થયો હતો. રાતના બાર. તમરાનો
 અવાજ આવતો હતો. મોટા ફળિયાવાળા બે બાજુ રસોડા, મોટી
 ઓસરી ને ચાર ઓરડાવાળા ઘરના કરા. પછીત ઉપરથી પાણીના
 રેલા ચાલતા હતા. ચાળણીમાંથી ઘઉં ચળાઈને બહાર આવે તેમ
 સવજ્જભાઈના ઘરના નણિયામાંથી પાણીની ધારોડી થતી હતી.

સમતાબહેને બાળ રાજીઓને ટબુરીને સુવાડી દીધા હતા. વીજળીના ચમકારા થતા હતા. મેઘની ગર્જનાથી સવજ્જભાઈનું હૈયું નાચ્યાનું હતું. ઘરના ખૂણામાં પડેલા દીવાના અજવાળાથી સવજ્જભાઈના ચહેરા ઉપરનો રાજ્યપો સમતાબહેન જોઈ રહ્યા

જ થાય છે. જે હક્કીકત હવે મને પૂરેપૂરી સમજાઈ ગઈ છે.
તમે તમારી બદલી બંધ રાખવાનો મેસેજ અત્યારે જ કરી દેશો.
ઓ.કે.? ફોન મુકું છું. બાય, રવિ....'

શેતા, તમારા આ નિર્ણયથી તમારા પતિ રવિ એકદમ ખુશ છે. એટલું જ નહીં, હવે એ હળવાકૂલ પણ થઈ ગયા છે. ચેમાઈની હોટલના રૂમમાં બેડ પર સૂતા સૂતા એ વિચારવા લાગ્યા, ‘મારી બદલી કરાવીને સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવાની હડ લઈને બેઠેલી શેતાના માનસમાં આમ અચાનક આવું પરિવર્તન કેમ આવ્યું હશે? આ માટેનું કારણ શોધવા તમારા પતિએ ઘણી મથામજા કરી પણ કશુંય હાથ ન લાયયું. આખરે વિચારવાનું જ બંધ કરીને શેતા, તમારા પતિ રવિ મનોમન બોલી ઉઠ્યા, ‘ચાલો, જે થયું એ સારું જ થયું છે. હવે કારણ શોધવાની પણ જરૂર નથી. આખરે ધી ના ઠામમાં ધી પડી ગયું!’

૩/૨૮, રાજ્યપર્યાય સોસાયટી, મુ. કલિક્કડ,
તા. ઘોટકા, જી. અમદાવાદ.
મો. ૧૦૦૦૦૦ ૪૭૨૪૦

હતા. મનજી, સવજી, રવજી અને તેમની વહુઓય ખુશખુશાલ હતી. સવજીભાઈ દીકરા-વહુને કહેતા હતા : ‘મારા બાલુડાઓ, આજે તો અમૃતવર્ષા થઈ રહી છે. ધરતીનું દૈયું ભીજાઈ રહ્યું છે. અગનજવાળા શમી રહી છે. મારા જાડવામાં ચેતન પૂરાશે. પશુ-પંખી કેવા નાચે છે! માનવ મન હરખાતું હશે. નાદિયું ખળખળ વહેશે. આઠે પહોર આનંદો... આનંદો. મારા ભગવાન, આજે મારા હિલના દીવામાં તેલ પૂરી રહ્યો છે. સચરાચર જગત લીલુંછમ બની જશે. ચારેકોર ટાઢક ટાઢક થઈ ગઈ છે. મારા ફૂલ જેવા બાલુડા ગાઢ નિદ્રામાં કેવા પોઢી ગયા છે! સર્વત્ર વાદળની જરમર, મોરના ટહુકાર તથા જરણાનો કલનાદ સંભળાતો હતો. ધરતીની ધૂળમાંથી ઉઠતી સોડમ સુંધવી ગમે તેવી હતી. આવા સુંદર વાતાવરણમાં સવાર ક્યાં પડી ગઈ, કોઈને ખબર પણ ન પડી.

સમતાબહુને વાત માંડી : ‘હું બિયારણ લઈ આવી છુ.’

થોડું ભણેલા સવજ્જભાઈ તરત બોલ્યા : ‘મનજીની મા, હું હજ અને બળણ લાવ્યો છું. આપણે બંને મહેનત કરીશું. મનજી, સવજી, રવજ્ય જોડાશો. પણ મીઠા ફળ હોંશથી ખાશું. ઉમંગથી ગિતો ગાશું. ભારતનો આત્મા ગ્રામ્ય વિસ્તારનો નવજન્મ અને ભારતનો પુનરુદ્ધાર કરવા સોએ કમર કસી ખેતી કરવી જોઈયો.’

ਪਿਤਾਨੀ ਵਾਤ ਸਾਂਭਜੀ ਮਨਤੁ, ਸਰਤੁ, ਰਵਤੁ ਅਨੇ ਗਣੋਧ
ਵਹੁਆਓਏ ਏਕ ਅਵਾਜ਼ੇ ਕਹ੍ਯੁ : 'ਆਪੁਤੁ, ਅਮੇ ਹਾਰਣੁ, ਫ਼ਰਣੁ.'

‘શ્રી પવનતનાય’, પલોર નં. ૬૪ કી/એ, સિમલ નગર
શેરી નં.-૩, આલાપ સેન્ટ્યુરી પાછળ, યુનિવર્સિટી રોડ,
ગાંધીનગર-૩૬૦ ૦૦૫. મો. ૯૯૭૭૦ ૦૦૦૪૨



વિકાસ

કળાનું મહિત્વ



પારુલ દેસાઈ

ઇશ્વરે મનુષ્યનું સર્જન કર્યું છે અને આ માનવીને પણ સર્જનાત્મક બનાવ્યો છે. આ સર્જનાત્મકતાની અભિવ્યક્તિ તે કળા, કસબ, હુમર, કલ્પના અને અંગત આવડત દ્વારા કંઈક નવું સર્જન કરવાની આત્મસૂજ એટલે કળા. આમ તો કળા શબ્દનો અર્થ કોઈ એક ક્ષેત્ર પૂરતો મર્યાદિત નથી હોતો. રવીન્દ્રનાથ ટાગોર કહેતા, ‘કલામાં મનુષ્ય પોતાના ભાવની અભિવ્યક્તિ કરે છે.’ તો એટો કહે છે, ‘કલા સત્ય કી અનુકૃતિ હૈ, અનુકૃતિ હૈ.’

દરેક વ્યક્તિમાં જન્માજત કળા રહેલી છે. તેમાં પણ સ્ત્રીની કલાસૂજ તો વધુ પ્રમાણમાં હોય છે. કળા દ્વારા વ્યક્તિનો માનસિક વિકાસ સુદ્રદ બને છે. નિષ્ઠાતો કહે છે કે, કળા અન્ય કોઈ રોજિંદા કાર્યમાં રસ અને એકાગ્રતા વધારે છે. પોતાનામાં રહેલું કૌશલ્ય દર્શાવતા તેથોની નિર્ણય શક્તિ મજબૂત બને છે. બાળકનું મગજ જેટલું વધારે સક્રિય બને તેટલા તેના જ્ઞાનતંત્તુ કોષના જોડાણો વધુ જરીલ બને છે. તેના કારણે યાદશક્તિ વધે છે. કળાથી દરેક બાબતને નવી રીતે જોવાની તેમજ નવી શોધ કરવાનું પ્રેરક બળ મળે છે. વળી પરફેક્શન ન આવે ત્યાં સુધી ફરી ફરીને એ જ કાર્ય કરતા રહેવાની આદત પડે છે. કળા પોતાની કલ્પના સાકાર કરવાની સ્વતંત્રતા આપે છે. સાથે જ જીવનના એકધારા કાર્યોમાં નવીનતા બસ્તે છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો મોકો મળતા માનસિક તણાવ દૂર થાય છે. માટે જ કળાને બદાર લાવવા બાળપણથી જ વિવિધ કલાસીસ કે ઘરમાં જ પ્રોત્સાહન આપવું જરૂરી છે. ક્યારેય ચિત્ર, ડેન્ચિ કાફિના પ્રદર્શન જોવા લઈ જાઓ. તેનામાં રહેલા કૌશલ્યને જીવંત કરી તેના જીવનને ઉમંગથી ભરી દો. તેના દ્વારા બનાવેલી કલાકૃતિને ઘરમાં સજાવીને રાખો. આ રીતે કદર થતાં તેનો આત્મવિશ્વાસ વધશે. સાથે જ પોતાના કરેલ કાર્યને વધુ સારું બનાવવા પ્રેરાશે. શક્ય છે કે બિવિધમાં પોતાની આ કળાને જ વ્યવસાયમાં ફેરવી સફળતા મેળવી શકશે.

કળાની વાત કરીએ ત્યારે સોથી પહેલાં તો ગુજરાતનું કચ્છ જ ચાદ આવે. ‘અસાંજો કચ્છડો બારેમાસ’માં અગાઉ તો વરસાદનો અભાવ, ઉજુગુજ જમીન એટલે આજીવિકાનું મુખ્ય સાધન જ હસ્તકળા. વર્ષો પહેલાં કાઈઓ ભરતકામની કળા લાવ્યા. કચ્છના કશેકશમાં કળા તો હતી જ. વળી ત્યાં મુંદ્રા અને કુંડલા જોવા દરિયાઈ વેપારના કેન્દ્રો હોવાથી પર્શીયન અને મુગલકળાની અસર પણ રહી. સુતરાઉ, રેશમી, ઉની કાપડ પર નાજુક મોતીકામની ગુંથણી, આલલા સાથે દોરા કે ઉનનું ભરતકામ કરવામાં આવે. એ જ રીતે ભાવનગર અને કાઠિયાવાડમાં દેશી ભરત અને મોતીના



ચાકળા, ટોડલીયામાં મોર, પોપટ, હાથી, તીંટ, ઘોડાની ભાત જોવા મળે. આવું તો આખા ભારત દેશમાં ઘણું છે. પ્રાચીન સમયની માંગ અનુસાર થોડા ફેરફાર કરી કળામાં વૈવિધ આવ્યું. અમુક નવી જ કળાનો જન્મ પણ થયો એમ કહી શકાય. આ જ રીતે નિછારમાં મધુભની પેઇન્ટિંગ ખૂબ જ જાણીતું છે. ટૂંક સમય પહેલાં ત્યાંના રેલવે સ્ટેશન પર આ ચિત્રો દોરવામાં આવ્યા છે.

હાલ એની ઉપરાંત લામાસા, મડ મિરર, ક્રિલિંગ, ભરતકામ, માટીકામ, ગોટાપતીના પર્સ, બંગરી, આભૂષણો, મોતીના પેચ, દોરી વર્ક, દોરાના આભૂષણ, બંગરી-ચૂડી-ચુડા, જ્લાસ પેઇન્ટિંગ, એકેલિક રંગોલી, નાની મોતી કંકાવટી, તોરણ, લેમ્બ, ઘર સુશોભનની અઢળક વેરાયટી જોવા મળે છે. ઈન્ટરનેટના માધ્યમ થકી નવા નવા નમૂના જોવા મળે અને તે શીખી શકાય. સાથે સોશિયલ મીડિયાને કારણે માર્કેટ પણ સહેલાધથી મળી રહે છે.

દરેક વ્યક્તિ કલાકાર છે. કોઈ તેને ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે અને એ જ કળાને કેરિયર બનાવી આર્થિક ઉપાર્થન પણ કરે છે. જેના થકી નામ-દામ બને કમાય છે. અથવા દિવાળીમાં જાતે જ વસ્તુઓ બનાવી, ઘર સુશોભન કરી પોતાની કળા પ્રદર્શિત કરવા સાથે પૈસાની બચત પણ કરી શકાય. માત્ર મનમાં જ વિચારીને મનમાં જ ધરબી રાખવાથી તે કલાસૂજ મરી પરવારે એવું પણ બને. એના કરતાં કેટલીકવાર પોતાની કળાની અભિવ્યક્તિ કરતાં કરતાં વ્યક્તિની ઓળખ જ બની જાય એવું બને. શાશપણ દ્વારા કળાનો સદ્ધ્યપ્રોગ કરી, કમાણી કરી શકાય. સાંસ્કૃતિક નૃત્ય, સંગીત, નાટક, પરંપરાગત ભરતકામ, શિલ્પ કામ, હસ્તકલા, માટીકામ જેવી અનેક કળામાં પારંગત બની તેમાં જ કેરિયર બનાવી શકાય. ઘર સુશોભનની વસ્તુઓ ભારતમાં અને વિદેશમાં ઊંચા દામે ખરીદવામાં આવે છે. તો સંગીત, ગાયન અને નૃત્યના શો દેશ-વિદેશમાં કરી માન-સન્માન સાથે આજીવિકા મેળવવાની તક મળે છે.

આજે જે આપણી સંસ્કૃતિના પ્રતીક એવી વિવિધ કળાને જાળવવા પ્રયત્નો કરવામાં આવે તો દેશનો સામાજિક વિકાસ સાથે આર્થિક વિકાસ પણ ચોક્કસ થદ શકે. ચાલો, સ્વદેશી અપનાવીને આપણા દેશનો આર્થિક વિકાસ કરવામાં આ વિસરાયેલી કળાને જીવંત રાખનારને પ્રોત્સાહન આપીને તેઓ પાસેથી જ બધી ચીજવસ્તુઓ ખરીદીને દેશને શક્ય તેટલો ‘આત્મ નિર્ભર’ બનાવીએ.

“નીતિયમ”, સહકાર નગર મેજન રોડ, મહિલા કોલેજ પાછળ,
એસ.બી.એસ. સોસાયટી, રાજકોટ. મો. ૯૪૨૬૫ ૦૨૧૮૦



‘ਸਬਕਾ ਸਾਥ, ਸਬਕਾ ਵਿਕਾਸ’

દોશી મહેન્દ્ર સાકરચંદ

‘ભાષા’ એ અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. ભાષાના માધ્યમથી જ જ્ઞાન અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસારણ થાય છે. આથી જે તે ભાષા-સમાજમાં બહુભાષીય સંસ્કૃતિને ગ્રોત્સાહન આપવાના હેતુથી વર્ષ ૨૦૨૧ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનને લક્ષ્યમાં રાખીને ‘માતૃભાષા’ના ઉત્કર્ષ અને સંવર્ધન કરવાના ઉદેશને અનુલક્ષીને બંને ગૃહને ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉદ્ઘોધન કરેલ. આ ઉદ્ઘોધનના અનુસંધાને ભારત સરકાર સંચાલિત ભારતીય ભાષા સંસ્થાન (મૈસુર)ના આસિ. ડાયરેક્ટર ડૉ. ચૌધરી અને નેશનલ ભારતીય ભાષા મંચના ટ્રસ્ટી ડૉ. એ. વિનોંડ તથા સિનિયર જર્નાલિસ્ટ ડે. સુરેશા રાજ્યસભા ટેલિવિજન પર ભાષા લુંમ થવાની સંભાવના હોય તેવી ‘માતૃભાષાના બચાવ’ અને આવી ભાષાને લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટેના ઉપાય વિષયક ચર્ચાનું આયોજન કરેલ હતું.

ભારતીય ભાષા સંસ્થાનનો મુજ્ય ધ્યેય ભારતીય ભાષાના ઉત્કર્ષ અને સંવર્ધન કરવાનો છે (સિવાય સંસ્કૃત, ઉર્દૂ, સિંહી, અંગ્રેજી). તાજેતરમાં ભારતીય ભાષા સંસ્થાનના સહયોગથી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશના સરહદી વિસ્તારમાં બોલાતી ‘કચ્છી’ના ઉત્કર્ષ તથા સંવર્ધન (Promotion - Preservation) માટે સ્પીચ - વેરાઈટિઝ ઓફ કચ્છી ડાયલેક્ટસના ઉચ્ચારિત અને લેખિત સ્વરૂપના અભ્યાસ કરવા માટે કચ્છ પ્રદેશના જુદા જુદા વિસ્તારમાં બોલાતી સ્થાનિક ભાષાના ભાષકોના ઉચ્ચારણનું વોઈસ રેકૉર્ડિંગ તેમજ સ્થાનિક ભાષાની સંરચનાના અભ્યાસ માટે કાર્યશાબદિનનું આયોજન કરવામાં આવેલ. આ બંને કાર્યક્રમમાં કરવામાં આવેલ અભ્યાસનું IPAમાં (International Phonetic Alphabet Script) લિખંતર કરવામાં આવેલ છે, જે બોલીના મૂળ ઉચ્ચારિત સ્વરૂપને અને ભાષાના સંરચનાના સ્વરૂપને લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટે આ પ્રક્રિયા નમૂનારૂપ ઉપયોગી નીવડશે.

આ કાર્યક્રમમાં ‘કચ્છી’ ભાષાને માતૃભાષા તરીકેના મોખા
તેમજ માતૃભાષાના માધ્યમ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવા માટેની
‘કચ્છ’ની ક્ષમતાની પણ વિચારણા અને તેનો અત્યાસ ભારતના
ભાષા વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો. ‘કચ્છી’
આ બંને બાબતો માટે સક્ષમ છે. પરંતુ રાજ્ય સરકારે ભાષાકીય
બંધારણની જોગવાઈ અન્વયે કચ્છીને સ્વતંત્ર બોલી તરીકે માન્ય
કરેલ છે. (૧૯૭૧) અને ‘ગુજરાતી’ને માન્ય ભાષા (Standard
Language / Mother tongue) તરીકે માન્યતા આપેલ છે.

માન્યભાષા (Standard Language / Mother tongue) ની ‘પરિભાષા’, જે તે વિસ્તારમાં બોલાતી ભાષાઓમાં વધુ પ્રભાવશાળી અને વધુ ભાષકો, સામાજિક - સાંસ્કૃતિક મોખ્યો ધરાવતી, વહીવટી અને શિક્ષણના માધ્યમની ભાષા, કે જેને રાજ્ય સરકારે માન્યભાષા (Standard Language / Mother tongue) તરીકે મોખ્યો આપેલ હોય જ્યારે ‘કચ્છી’ને સ્થાનિક ભાષા (Native Language / Mother Tongue) વળ્ફકૃત કરી છે. આ બંનેની પરિભાષામાં માત્ર શિક્ષણ અને રાજ્યના વહીવટી કાર્યની ભાષા માટેના હક્કનો સમાવેશ સ્થાનિક બોલીમાં થતો નથી. આ સિવાયના સમાન ગુણધર્મો ‘કચ્છી’ સ્થાનિક ભાષા ધરાવે છે. ‘કચ્છી’ ભાષાની લિપિ ન હોવાથી કચ્છીને ‘ભાષા’નો મોખ્યો આપવામાં આવેલ નથી. આ બ્રમણાને ભૂતી જવી પડે. કારણકે છેલ્લા દાયકાથી ‘કચ્છી’નું લિપંતર ગુજરાતી લિપિ-જોડણીમાં કરવામાં આવી રહ્યું છે અને જે રૂઢ પણ થઈ ગયું છે. ગુજરાતી લિપિમાં માત્ર કેટલાક ‘વર્ણ’ને ચિહ્ન-પ્રતીક અને કેટલાક ભાતીગળ ‘વર્ણ’ના અલગ પ્રતીકો ગુજરાતી ભાષાની લિપિમાં મર્યાદિત હોવાને કારણે આવા વર્ણ લિપિમાં ગુજરાતી - કચ્છી લિપિનો સ્વીકાર કરવામાં આવે તો ‘કચ્છી’નો રાજ્ય સરકારની જોગવાઈ હેઠળ ‘ભાષા’ તરીકે મોખ્યો સ્થાપિત થઈ શકે.

માતૃભાષા દિન નિમિત્તે એટલું દરેક ‘કચ્છી ભાષકે’ વિચારવાનું રહેશે કે, સરકારે નવી પ્રાથમિક શિક્ષણની નીતિમાં પ્રાથમિક શિક્ષમ માતૃભાષાના માધ્યમ દ્વારા આપવાની જોગવાઈ કરી છે, જેના લાભથી કચ્છ વિસ્તારના ૮૨ ટકા દ્વિ-ભાષિક બાષકોના બાળકો માતૃભાષાના માધ્યમથી પ્રાથમિક શિક્ષણના લાભથી વંચિત ન રહે.

માતૃભાષા હિન નિમિત્તે દેનિક પત્ર અને સામયિકમાં ‘કચ્છી ભાષા’ વિષયક સામગ્રી પ્રકાશિત જરૂર થાય છે પણ તેમાં ‘કચ્છી’ની વિગતોનું પુનરાવર્તન કરતા માહિતીપ્રધાન લેખ હોય છે. કચ્છી બોલીના દ્વિ-ભાષિક સ્વરૂપ ‘કચ્છી’ માતૃભાષા અને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની ક્ષમતા તેમજ લિપિ જેવા સાંપ્રત પ્રશ્નો વિષયક લેખ ભાગે જ પ્રકાશિત થાય છે. આ દેનિક પત્ર સામયિકની મર્યાદા છે કે કચ્છી ભાષાની સમસ્યા વિષયક લેખો લખાતા નથી એ જીત તપાસ કરવા માટેનો પડકાર છે.

કચ્છ

કચ્છના કલ્યાણજુની નીતિએ નિમાંયું મુંબઈનું કલ્યાણ



નરેશ અંતાવાડી




ભારતના વિશાળ ભૂ ભાગ ઉપર પશ્ચિમ દિશાએ આવેલું કચ્છ એની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે સમૃદ્ધ અને ધનિક વેપારી વર્ગને કારણે તથા કલા, સંસ્કૃતિ અને સંસ્કારને કારણે વિશ્વભરમાં જાહીરું છે. અતીતની તવારીખમાં ‘સંસ્કાર સેતુ’ બનેલા આ ગરવા પ્રદેશમાં અનેક સમૂહો વિવિધ સ્થળોએથી આવ્યા અને ગયા પણ. આવેલી પ્રજાઓ જેમ પોતાના સંસ્કારો અહીં છોડતી ગઈ તેમ અહીંથી ગયેલાઓ પણ કચ્છી સંસ્કારોને લઈને દેશ-દેશાવરમાં ફેલાતા ગયા.

વિશાળ સમૃદ્ધ કંઈ ધરાવતા રાજ્યને દેશ દેશાવરથી વેપાર-વણજ્યથી જોડાયેલા આ પ્રદેશની જનતાએ ભારત અને ભારતની બહાર પણ ‘વસુદેવ કુટુંબકમ્’ તથા વૈદિક સંસ્કૃતિની ઉદાત્ત ભાવના સાથે જ્યાં પણ ગયા તે ગામ, પ્રદેશ કે દેશ; અરે પડોશીને પણ સંસ્કાર સંપત્તિ થાય, સમૃદ્ધ થાય એવી બેવના રાખીને જે તે પ્રદેશ કે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે તો વતન કચ્છના ભાઈ-ભાંડડાંઓનો પણ ખ્યાલ રાખ્યો છે. એની મુશ્કેલીમાં મદદરૂપ થવા હંમેશાં પહેલ કરી છે. દેશ પરદેશની ધરતી માથે જ્યાં જ્યાં કચ્છીઓ જઈ વસ્ત્યા છે ત્યાં ત્યાં એક કચ્છ ખું કરી દીધું છે. કચ્છીઓની કચ્છની બહાર મુંબઈમાં સૌથી વધારે વસતી છે અને મુંબઈના વિકાસમાં કચ્છીઓનું પ્રદાન પણ સવિશેષ રહ્યું છે. મુંબઈના કેટલાય વિસ્તારોના નામ કચ્છીઓના નામ સાથે સંકળાયેલા જોવા મળે છે. મોટાભાગે આવા નામો કોઈ વિશેષ વ્યક્તિ કે દાનવીરના નામ સાથે જોડાયેલું હોય છે પરંતુ મુંબઈના પર કલ્યાણનું નામ તો એક સામાન્ય કચ્છી મજૂરના નામ સાથે જોડાયેલું છે તેથી તેનું મહત્ત્વ વધી જાય છે. કલ્યાણ એ મુંબઈ સાથે જોડાયું તે પહેલાંથી જ પોતાનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. તેનો ભૌગોલિક પરિચય મેળવીએ તો એ મહારાષ્ટ્ર રાજ્યનું પશ્ચિમ રેલવેનું એક મહત્વનું જંકશન છે. તેને મુંબઈના અન્ય પર ડેંબીવલી સાથે જોડીને સંયુક્ત મહાનગર પાલિકાનું નિર્મિણ કરાયું છે. નવી મુંબઈ, થાણે, ઉત્ત્વાસનગર, અંબરનાથ, કરજત, વસઈ અને વિચારની સાથે જ તેનો સમાવેશ બૃહદ મુંબઈ સાથે કરવામાં આવ્યો છે. મુંબઈની નજીકમાં જ રહેવા માટેનું કલ્યાણ એ પ્રદૂષપણ મુક્ત એક ઉત્તમ સ્થળ છે. વળી કલ્યાણ જંકશન એ મુંબઈથી લાંબા અંતરના તથા મુંબઈ ઉપનગરીય તમામ રેલવે વ્યવહારથી જોડાયેલું છે. આમ તો કલ્યાણનો ઈતિહાસ ઈ.સ. ૫૩૦-૫૪૫થી મળે છે પરંતુ તેનો અહીં ઉલ્લેખ અત્યારે અપ્રસ્તુત છે. કલ્યાણ જંકશનનું નામ કચ્છી સાથે કઈ રીતે જોડાયું એ રસપ્રદ ઘટના

વડીલ ધનજીભાઈ ભાનુશાલીના સૌજન્યથી અહીં રજૂ કરી છે.

ઘટના એવી છે કે, માંડવીના કલ્યાણજી શીવજી રોજગારોટી માટે પોતાનું નસીબ અજમાવવા ઈ.સ. ૧૯૮૦-૪૦ના અરસામાં મુંબઈ ગયા. આરંભમાં મુંબઈમાં કોઈ કામ ન મળતાં મજૂરી કરવાનું પણ આ કચ્છીએ પ્રેમથી સ્વીકાર્યું. એ સમયે મુંબઈના હાલના માર્શિકદ બંદર સુધી દરિયાના પાણી આવતા. પરંતુ પેસેન્જર લઈ આવતી સ્ટીમર કાંઠાથી ૩૦૦ મીટર દૂર ઊભી રહેતી. ત્યાં ઉત્તરતા શ્રીમંતુ પ્રવાસીઓ અને ખાસ કરીને બ્રિટીશ અમલદારોને પોતાના ખલે ઊંચકીને દરિયા કિનારે લાવવાનું કામ મજૂરો કરતા. કલ્યાણજી પણ આ કામ પ્રામાણિકતાથી કરતા. એક મુસાફરને ખભે બેસાડી, કિનારે લાવવાની મજૂરી ૧ પૈસો લે. તેમની નીતિ એવી કે જે દિવસે ૧૦ પૈસા મજૂરી મળી જાય તો ૧૧મો પૈસો પ્રવાસીઓ પાસેથી ન લેતા અને મફતમાં પ્રવાસીઓને કિનારે લઈ આવતા. એક દિવસ ત્યાં નખાતી રેલવેના કામે એન્ડરસન નામના બ્રિટીશ અમલદાર સ્ટીમર મારફત મુંબઈ આવ્યા અને કલ્યાણજી તેમને પોતાના ખલે ઉચ્કીને કિનારે લઈ આવ્યા. અમલદારે ખુશ થઈ ચાર આના મજૂરીના તેમને આપ્યા. પરંતુ એ દિવસે કલ્યાણજીને મજૂરીમાં ૧૦ પૈસા અગાઉથી જ મળી ગયા હોઈ ચાર આના સ્વીકારવાની ના પાડી અને પોતાની ટેકની વાત કહી. આથી ખુશ થઈ એન્ડરસને પોતાનું વિજિટીંગ કાર્ડ આપ્યું અને કંઈ કામ હોય તો યાદ કરવા કહ્યું. થોડા દિવસો વિત્યા પદ્ધી ખરાઈ કરવા કલ્યાણજી કર્ફના આધારે એન્ડરસન પાસે પહોંચ્યો. ત્યાં એન્ડરસને તેમને ખૂબ માનપાન આપ્યા અને ચર્ચેટથી નવા બની રહેલા સ્ટેશન સુધી રેલવે લાઈનના ટ્રેક પર માટી કામનો ટેકો એન્ડરસને કલ્યાણજીને ખાસ આગ્રહ કરીને આપ્યો. અશિક્ષિત એવા કલ્યાણજીએ આ ઈજારો સ્વીકાર્યો એટલું જ નહીં પણ નિયત મુદ્દત કરતાં છ મહિના વહેલું કામ પૂર્ણ પણ કરી આપ્યું. અને એ ટ્રેક પર તા. ૧૯મી એપ્રિલ, ૧૯૮૩ના રેલવે શરૂ કરાઈ ત્યારે આ ટ્રેક પરના રેલવે સ્ટેશનના લોકાર્પણ સમયે અંગેજ અમલદારે કલ્યાણજી શિવજુને ખાસ મંચ પર બેસાડી એ નવા સ્ટેશનનું નામ કલ્યાણજીના નામ પરથી જ ‘કલ્યાણ’ સ્ટેશન અપાયું અને તેની પ્રામાણિકતા, ટેક અને ખંતનો ખાસ ઉલ્લેખ કરીને તેને ધન્યવાદ આપ્યા. આ ઘટના કચ્છના ઈતિહાસ સાથે કદાગ સીધી રીતે જોડાતી નથી પરંતુ કચ્છીયતની એક મિશાલ જરૂર બને છે.

‘ખૂબી નિકેતન’, ર૨/બી, શિવમ્ પાર્ક,
નાના ચક્કા મંદિર પસે, માધાપર રિંગ રોડ, મુજફ્ફત, કચ્છ-૩૯૦ ૦૦૧.
ફોન : (૦૨૮૩૨) ૨૪૩૨૪૨, મો. ૯૯૯૯૯૯ ૨૦૪૯



ત्यागभूत : भारतीय नारी 'आक्रिका'

નવો વિભાગ.... નારી ગૌરવગાથા

નારી ધરતું આભૂષણ છે, તેમ બધા કહેતા હોય છે. પરંતુ નારીનું સન્માન કરવાની સાથે તેમની આંતરિક શક્તિને બહાર લાવવામાં મદદ કરનારી વ્યક્તિઓ ઘણી ઓછી છે. એમી માર્ય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો. આંતરરાષ્ટ્રીય સંગઠન યુ.એન.એ. દ્વારા તે દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નારી જગતે પરિવારની જવાબદારી સાથે કલા, સાહિત્ય તથા કોપોરેટ જેવા ક્ષેત્રોમાં કાઢું છે. તાજેતરની કોરોના મહામારીમાં બિઝનેસ નારીઓએ પોતાના પરિવાર અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને સાબિત કર્યું કે નારી શક્તિ મહાન છે. આ મહામારીના સમયે નારીએ વોરિયર તરીકે મહાન સેવા પણ આપી હતી. આ રીતે ઓઈએ તો નારી જગતે પોતાની જિંદગીના દરકે તબક્કે વિવિધ પ્રકારના અનેક મોરચા સંભાળવાના હોય છે અને સફળતાપૂર્વક સંભાળતી હોય છે. જેમાં તેની મહાનતાના દર્શન થાય છે. હકીકતમાં પુરાણકાળથી મનુષ્યના સાંસ્કૃતિક અને ધાર્મિક ઘટતરમાં સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે. આ વિષય સંદર્ભમાં આપણે શરૂ કરીએ છીએ.... એક નવો વિભાગ.... નારી ગૌરવગાથા.

લેખ મોકલાવવા આહવાન

સ્વીઓમાં ખુમારી જગાવતા અને તેનાં સંબંધિત વિગત અન્યને પ્રેરણાદાયી બને તેવા લેખ આવકારપાત્ર છે. આ પ્રકારના લેખ અનુકૂળતાએ અને પ્રકારિત કરીશું.

આ વિષયે આપના લેખ મોકલાવવા આપશીને આમંત્રણ છે.

તજશ લેખક, કવિ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલનો આ વિષય પર આધારિત એક લેખ અતે પ્રસ્તુત છે.

— *diyi hisar*

ભારતવર્ષનો ધર્મ ભારતવર્ષના પુત્રોથી નહીં, પણ પુત્રીઓ
એટલે કે દીકરીઓના પ્રતાપે જ આજે અચળ - સ્થિર રહ્યો છે.
ભારતીય નારીઓએ હજુ પણ પોતાનો કર્તવ્ય-ધર્મ છોડ્યો નથી.
જે તેણે સમયના પ્રવાહમાં તણાઇને પોતાનો સ્ત્રી તરીકેનો
આદર્શ - ધર્મ છોડ્યો હોત, તો આ દેશ કયારનોય
અધિપતન અને નાના નાનાનાને હવાલે થઈ ગયો હોત. છેક
પ્રાચીનકાળથી લઈ વર્તમાનકાળ સુધી ભારતીય સ્ત્રીઓમાં
સદ્ગુર્તન, સેવાભાવ, સંતોષ, પતિભક્તિ, સ્નેહ, દયા ને ત્યાગ
- સમર્પણની જ્યોત અખંડ જલલી રહી છે.

આપણા જાણીતા મધ્યકાલીન ભક્ત કવિ શામળ ભાડ
સ્ત્રીઓ વિરે લખે છે કે, સ્ત્રીનું કર્તવ્ય પુરુષની ચિંતા દૂર કરવાનું
અને પતિની ઉત્તરતી ઉમરે તેના દૃષ્ટોમાં ભાગ લેવાનું, તેની
સેવા-ચાકરી કરવાનું છે. શામળ લખે છે કે :

જોબનમાં રે રંગ, સંગ સુખ ટાંક તાનની,
વહાલપણે કરી વાત મટાડે પીડા મનની.
સુખદુઃખમાં સમભાગ, રાગ રૂડો ગુણ આતી,
ચહુરા ચિત હરનાર, સાર ઉરમાં મહમાતી.
વળી વૃદ્ધપણે સેવા કરે, દેખાથી દિલદુઃખ ટણે,
એ અંતકાળે અળગી નહીં, બહુ સ્નેહે સાથે બળે.

આવી જ ત્યાગ સમર્પણાની અને સેવાની મૂર્તિ એટલે
અન્ધિકા. ઉત્તર મથુરાના નિવાસી જ્યવીર નામના મોઢ વણિકની એ બહેન હતી. અન્ધિકા એ કાળમાં આશ્રમમાં ભણી ઉચ્ચ વિદ્યા પામી હતી અને તમામ દર વિદ્યાઓમાં તે પારંગત હતી. સંગીત વિદ્યાની તાલીમ તો તેણીએ દિલથી લીધી હતી. ઘોડેસવારી તેનો શોખ હતો. ધર્મક્ષેત્રો પણ તે આગળ હતી. પર્યુષણ વ્રતને તે સારી રીતે નિભાવતી હતી.

એકની એક બહેન અનિકા પ્રત્યે ભાઈ જ્યવીરને ખૂબ જ વધાલ હતું. લાડકડી બહેનને કોઈ વાતની ઉણાપ ન રહેતે માટે ભાઈ તકેદારી રાખતો. કુમારી અવસ્થા વટાવી અનિકા યુવાનીમાં પ્રવેશી હતી. એકની એક બહેન તરફનો ભાઈ જ્યવીરનો વાત્સલ્યભાવ તેને અળગી કરવા જરાય રાજી ન હતો. જ્યવીર સમજતો હતો કે બહેને આજ નહીં તો કાલે, પારકે ઘેર મોકલવી જ પડશે. બહેન વિના પોતે પોતાને આત્મા વગરના શરીર જેવો મહેસૂસ કરશે. આવા વિચારે જ્યવીરે નક્કી કરી લીધું કે અનિકા વેરે જે કોઈ વરવા માંગે તેણે તેને વરીને આજન્મ મારા ઘરમાં જ (ઘર જમાઈ) રહેવાને બંધાવું પડશે.

આ વાત જ્યવીરે પોતાના મિત્ર દેવદત્ત સમક્ષ કરી અને કહ્યું કે, આજ નહીં તો કાલે અનિકાને વિદાય આપવી જ પડશે. માટે મારી આ શરતને માન્ય રાખે તેવો કોઈ વણિકપુત્ર હોય તો મને વાત કરજે. ત્યારે દેવદત્તે કહ્યું : ‘જ્યવીર, આપણે બંને મિત્રો છીએ અને સાથે વેપાર કરીએ છીએ. આપણે એકબીજાને સારી રીતે જાણીએ છીએ. હું અનિકાને સારી રીતે ઓળખું છું. જો તારી ઈચ્છા હોય તો હું અનિકાને વરવા તૈયાર છું અને તારી દરેક શરતનું ઋષભદેવ મહારાજને સાક્ષીમાં રાખીને પાલન કરવા હું બંધાઉ છું. હું તારા જ ઘરમાં રહીશ અને ઘર છોડીને હું મારે ઘેર કદી પણ નહીં જાઉ.’

પોતાની સાથે જ વેપાર કરતો અને ગુણમાં ગુણિયલ એવો દેવદત્ત અનિકાને ઘરજમાઈ તરીકે રહીને પરણવા તૈયાર થયો છે એ વાતથી જ્યવીર ઘણો જ રાજુ થયો. તેણે ધામધૂમથી બંનેના લગ્ન કરાવી દીધા.

લગ્નને આઠ-નવ મહિના વીતવા આવ્યા હતા. દેવદત્તને માતા-પિતાની યાદ સત્તાવી રહી હતી. એક ખીના મોહમાં પોતે માતા-પિતાની સેવાને બદલે અનિકાનાં સૌંદર્ય પાછળ ઘેલો બન્યો હતો, તે વાતથી દેવદત્ત ઘણો જ વ્યથિત હતો. પણ મિત્ર જ્યવીરની શરત ઋષભદેવ મહારાજની સાક્ષીએ અક્ષરસઃ પાળવાનું વચન આપ્યું હતું. તેથી તે માતા-પિતાના ઘેર જઈને તેમની સેવા ચાકરી કરી શકવા અસર્મથ હતો.

એવામાં એક દિવસ દેવદત્તને એના માતા-પિતા તરફથી પોતાને ગામ કુશીનગર તેડાવતો સંદેશો મળ્યો. સંદેશો વાંચતા દેવદત્તની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. સંદેશામાં તેના વૃદ્ધ અને અશક્ત એવા માતા-પિતાની સેવા કરવા માટે દેવદત્તને કુશીનગર આવી જવા જણાવાયું હતું. દેવદત્ત ભારે મૂળવણામાં મૂકાયો. એક બાજુ વૃદ્ધ માવતરની સેવા કરવાની ફરજ હતી, તો બીજુ બાજુ વચન પાલનની જવાબદારી હતી. તેના મનના ભારના બેય પલડા ઊંચા નીચા થવા લાગ્યા.

પતિની વથ્યા સુજાણ એવી અનિકા ન સમજે એટલી ભોટ ન હતી. તેણે આ બાબતે દેવદત્તને પૂછ્યું ત્યારે દેવદત્તે માતા-

પિતા તરફથી મળેલો સંદેશો અનિકાને વાંચી સંભળાવ્યો. સંદેશો સાંભળી અનિકા બોલી : ‘આપ નિશ્ચિત - નન્યિત થઈ જાવ. આપના માતા-પિતા વૃદ્ધ થયા છે. આપણા બેયની ફરજ છે કે આપણે તેમની પાસે જઈને તેમની સેવા કરવી જોઈએ. આ જગતમાં તમામ પ્રકારના ઋષણમાંથી છૂટી શકાય છે, પણ માવતરના ઋષણમાંથી પુત્ર કયારેય છૂટી શકતો નથી.

દેવદત્ત બોલ્યો : ‘પણ એ કેવી રીતે બને? મેં તારા ભાઈને આ ઘરમાં જ આજન્મ રહેવા વચન આપ્યું છે. વચનમાં ઋષભદેવ મહારાજને સાક્ષીતરીકે રાખ્યા છે. હું વચનભંગ થાઉંતો માંનું જીવતર લાજે. દ્રવ્યનો નાશ થાય, ભાઈ-ભાંડું ગુસ્સે થાય, માવતર મને કર્મહીણો ગણે, તો પણ વચને બંધાયેલો હું મારા વચનને નહીં તોંકું. રાજ દશરથે પણ વચનને ખાતર મ્રાણનો ત્યાગ કર્યો હતો. જ્યારે હું તો પામર માનવી છું. હું મારા વચનને કેવી રીતે તોડી શકું?’

અનિકા ખૂબ જ સમજુ હતી. વળી વણિકની દીકરી. એટલે બુદ્ધિમાં પણ પાવરધી હોય એ સ્વાભાવિક ગણાય. તેણે કહ્યું : ‘હે સ્વામિનાથ! પુત્રએ પત્નીની નહીં પણ માવતરની સેવા કરવી જોઈએ. તમારા માતા-પિતા, એ હવે મારા પણ માતા-પિતા ગણાય. માવતરની સેવા સમાન જગતમાં બીજું કોઈ તીર્થ નથી કે સેવા પણ નથી. તો પછી એમની ખાતર પ્રતિજ્ઞાભંગ થાય તો તેમાં દોષ નથી. વળી તમાંનું સ્વર્ગ તમારા માતા-પિતાના ચરકોમાં છે. તમને જે કાંઈ દૂરદર્શિતા મળી છે તે તમારા માતા-પિતાના પુઝસંસ્કારની પ્રસાદી છે. માટે હે સ્વામી! તમે કોભ ન અનુભવો અને કુશીનગર જવા માટેની તૈયારી કરો. હું મારા ભાઈ જ્યવીરને પણ સંતાનોની માતા-પિતા પ્રત્યેની ફરજ અને સેવા બાબતે સમજવી લઈને આપના વચનમાંથી મુક્ત કરવીશ.’

અનિકાએ પોતાના ભાઈ જ્યવીરને દાખલા - દલીલો અને વિવેકબુદ્ધિથી સમજાવ્યો અને પતિ દેવદત્તની સાથે પોતાના સાસરે જવાની રજા માંગી. અનિકાની વિવેકભરી અને ડાહી વાતો જ્યવીરને ગળે ઉત્તરી ગઈ. તેણે દેવદત્તને પોતાના વચનમાંથી મુક્ત કર્યો.

આ તાકાત છે સ્ત્રીમાં. સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના આવરણ નીચે જ જીવી રહ્યા છે. એક આત્મા પોતાને બે વિભાગમાં એટલે કે પતિ અને પત્નીરૂપે વિભાજિત કરે છે. જેમ કે સમુદ્રધાર્ય જીવાણુંને બે આવરણ હોય છે. જેમાં એક આવરણ બીજા આવરણનું પૂરક છે. બહારનું આવરણ ન હોય તો છીપમાંનું જીવાણું બચી શકે નહીં. એમ સ્ત્રી અને પુરુષ પણ આવા પરસ્પરના આવરણોના સહારે જીવી રહ્યા હોય છે.

માત્ર પોતાની હ્યાતી ટકાવી રાખવા માટે નહીં, પણ બીજાની હ્યાતી જીળવી રાખવા માટે ગ્રેમની ઉત્પત્તિ થઈ અને

(અનુસંધાન : જુસો પાના નં. - e ઉપર)



નારી ગૌરવગાથા

સંકડો દીકરીઓને મદદરૂપ બનતી : નિશિતા રાજ્પૂત



પ્રવીણભાઈ જી. મેંદપરા

ભારતીય સંસ્કૃતિ ઋગવેદકાળથી પણ ઘણી આગળ છે. માનવ જીવનના ઉગમની સાથે જ સંસ્કૃતિનો ઉગમ થયો. આ સંસ્કૃતિએ જ માનવને ઘડ્યો છે, શાશગાર્યો છે અને તેનામાં પરોપકારી ભાવના અને ત્યાગના લીંપણ અને માનવીય મૂલ્યોને ઉજાગર કર્યો છે. સાર્વજનિક જીવન તરફ જિંદગીને વહાવવા અને તેમાં રહીને સમાજસેવા કરવા તરફ હોડ જમી છે પરંતુ એ લક્ષ્ય સિદ્ધ બહુ ઓછાથી થાય છે. સેવા એટલે, ‘નિઃસ્વાર્થભાવે કોઈને મદદ વાસ્તે કરેલું કર્મ.’ તે ધર્મમાં આવેષ્ટિત પાખ્યો છે.

આજે સાચા ત્યાગ અને સમર્પણ વગરની સેવા, સેવકોને ફણતી નથી. સેવાના આદર્શ પાછળ જે ત્યાગ હોવો જોઈએ તેવો ત્યાગ રાષ્ટ્ર અને માનવસમાજ માટે વર્તમાન સમયમાં દેખાતો નથી. આજે સેવાના નામે મેવા ખાવાવાળા સેવકોનો ફાલ મોટો છે. પરંતુ તેની સામે ત્યાગનો ફાલ જૂજ પ્રમાણમાં દેખાય છે.

પ્રત્યેક માણસે સમાજ, પોતાના દેશ, જીવનની ઉભાતિ અને આદર્શો માટે બને તેટલી સેવા કરવી જોઈએ. આધ્યાત્મિક બનીને પ્રભુની સેવા કરવી એ બચાબર છે પરંતુ અંકિયન, નિરાધાર જીવો પ્રત્યે પણ દ્યા રાખી તેમને મદદરૂપ બનવું એ પણ એક ધર્મ છે, ભક્તિ છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે અન્ય લક્ષ્યોનો ત્યાગ કરીને અનન્ય ભક્તિ દ્વારા પરમેશ્વરની સેવા કરે છે, તે ત્રણે ગુણો : સત્ત્વ, રજ અને તમોગુણને ઓળંગી મોક્ષ પામે છે.

આત્માની સેવા એ જ પરમાત્માની સેવા છે. દરેક જીવમાં જે આત્મા વસે છે, તે સ્વયં પરમાત્માનો જ અંશ છે. **માટે દરેક જીવની સેવા કરવાથી મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે.**

સેવાના ત્રણ પ્રકાર છે : સાત્ત્વિક, રાજસિક અને તામસિક. જેમાં અભિમાન રહિત સેવા તે સાત્ત્વિક સેવા છે. સ્વાર્થ સાથે કરેલી સેવા એ રાજસ સેવા છે અને પરિણામ જોયા વિના અજ્ઞાનથી કરેલી સેવા એ તામસિક (તામસ) સેવા છે.

એક નાનકડો પ્રસંગ છે : એક શહેરમાં ભાડેથી ગાડી ફેરવનારો એક ધોડાગાડીવાળો માણસ દ્યાવાન અને ધર્મને માનનારો હતો. એક હિવસ તેણે ધર્માર્થી રબીને પૂછ્યું, ‘હે મહારાજ, ધર્મ પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા છે. ભગવાનનાં દર્શન

કરવાની હંમેશાં તાલાવેલી રહે છે, પણ હું મારા પરિવારનું ભરણપોષણ થાય તે માટે એક ગામથી બીજે ગામ ગાડી હાંક્યા કરું છું. આથી પ્રભુના દર્શન કે તેમની પ્રાર્થના કરવા મંદિરે જઈ શકતો નથી. તો હું શું કરું? હું મારો આ ધંધો છોડી દઉં? મને ભગવાન અત્યંત વહાલા છે.’

સંત રબીએ ગાડીવાળાનો સવાલ સાંભળીને પૂછ્યું, ‘ભાઈ! શું કયારેય તું રસ્તામાં જતા વૃદ્ધ ગરીબ મુસાફરને મફતમાં ગાડીમાં બેસાડે છે જરો?’

ગાડીવાળો બોલ્યો : ‘હા મહારાજ! ઘણીવાર આવા પ્રસંગો બને છે. રસ્તે જતા જરા વૃદ્ધો, અંકિયન ચાલકો વગેરેને હું ગાડીમાં પૈસા લીધા વિના બેસાડું છું.’ ત્યારે સંત રબી કહે : ‘ભાઈ, તું આમ જ કામ ચાલુ રાખજો. આ રીતે તું ભગવાનની સેવા કરતો રહે. તારે કોઈ મંદિરે જવાની જરૂર જ કરાં છે? તારી મદદ ભાવનામાં જ પરમેશ્વર આવી વસ્યો છે.’

આવી જ સેવાની હિમાયતી આદર્શ દીકરી વડોદરામાં વસે છે. નારી ગૌરવને આબે અડાડી તેમણે ભારતીય સંસ્કૃતિના ધબકારને વધારે ધબકાવીને ગૌરવ વધારવાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

છું શૌર્યમાન, છું કાંતદશી, કહો ન અબળ,
અબળાપણું મારું તો દ્યાની લહાણમાં છે.

નારીની ઓળખાં શું સૌંદર્ય એકમાત્ર છે? નારીના આદર અને ગૌરવની અનેક કહેવતો છે. જેવી કે : બાપનું ઢાંકણ બેટડો, ધરનું ઢાંકણ નાર. નારી તું નારાયણી, નારી નરનું નૂર એવી અનેક કહેવતો છે. પ્રાચીન સમયમાં ગાર્ગી, લોપામુદ્રા, માહિષતી જેવી વિદૃષ્ટિ નારીઓની અનેક કથા તથા વર્તમાન સમયમાં અનેક નારીઓએ દેશ, સમાજ, ધર્મ-પરિવારમાં નામનાઓ મેળવી છે.

સંસાર સાગરમાં સુધારત રેલાવતી નારી ફૂલ શી કોમલ અને વજથી કઠોર, શુધ્યતાનો પર્યાય, સુગંધી વ્યક્તિત્વની સ્વામિની છે. ધારે તો અવશ્ય પોતાના ધારેલા આકાશને આંબી જઈ અવકાશે ઉત્કર્ષ પામે છે. નારીને અબળા અને સબળા કહી છે. નારી અબળા એટલે પોતાની મર્યાદામાં રહીને

પ્રેમનો પર્યાય અને કરુણાનો સાગર છે. પોતાના નાના બાળકને પ્રેમથી નવડાવે છે અને જ્યારે તે બાળક ઉપર જોખમ આવે ત્યારે તે એક વીરાંગના બનીને જીવ આપતા પણ અચકાતી નથી. એટલે તેને સબજા અને વીરાંગના કહી છે.

એ દીકરીનું નામ નિશિતા રાજ્યપૂત છે. આ દીકરીએ હુમન રિસોર્સિસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો ડિપ્લોમા કર્યો છે. આ દીકરીને સેવાના સંસ્કારો બાળપણથી મળ્યા છે. નિશિતા કહે છે : **જગતના તમામ દાન કરતાં ચિદિયાતું દાન એ વિધાદાન છે.** આજે દેશમાં હજારો દીકરીઓ એવી છે કે જેમને ભષણું છે પણ ફી ભરવાના પૂર્ણ પૈસા તેમના પરિવાર પાસે નથી હોતા. ફી વગર કોઈ શૈક્ષણિક સંસ્થા એડમિશન નથી આપતી. નાણાં વગર આવી દીકરીઓ અભ્યાસથી વંચિત રહે છે.

કુદરતનું મહાન સર્જન.... નારી જતિનું સજ્માન કરીએ....

- ★ નારી જતિને પ્રેમ આપીએ.
- ★ તેમનું ઉચિત સન્માન કરીએ.
- ★ ધાર્મિક કાર્યમાં તેમનું માર્ગદર્શન લઈએ.
- ★ તેમની સેવાની કદર કરીએ.
- ★ કોઈની હાજરીમાં તેમનું કદી પણ અપમાન ના કરીએ.
- ★ માત્ર વાસના તૃદ કરવાનું અંગ ના માનીએ.
- ★ તેમના વિશાળ અનુભવનો સર્વાંગી લાભ લઈએ.
- ★ તેમના પ્રેમની કિંમત કરીએ.
- કચ્છ - અંજરમાં ઘણા વર્ષો અગાઉ જેસલ જાડેજા નામનો એક મહાન લુંટારો થઈ ગયો. સતી તોરલની સમજાવટથી જેસલ જાડેજાએ પોતાની લુંટફાટની કામગીરી છોડી દીધી. ત્યારબાદ જેસલ પીર તરીકે ઓળખાવા લાગ્યા અને પૂજનીય બન્યા.
- આ વાર્તા મુજબ અંજરમાં જેસલ-તોરલની સમાધિ છે.
- શિવાજી મહારાજે હિંદુ ધર્મનું રક્ષણ કર્યું, તેમાં માતા જાબાઈનો અમૂલ્ય ફણો નોંધાયેલો છે.
- કોઈ વિચિત્ર ઘટનાના સમયે અથવા તો અવનવા પ્રસંગે મનુષ્ય દ્વારા બોલાઈ જાય છે.... ‘હે મા....!’
- એક દિવસ હું સાઈકલ પર માણાવદરથી વેળવા તરફ જતો હતો. ત્યાં અચાનક જ મારી સાઈકલનું આગળનું વીલ રોડની સાઈડમાં એક ખાડામાં ઉતરી ગયું....!
- મારાથી સહેજે બોલાઈ ગયું.... ‘હે...મા....’ અને વીલને મારા હાથે આમતેમ કર્યું અને જાણે ચમત્કાર સર્જયો. મારી સાઈકલનું વીલ સીંહું થઈ ગયું.

ફીના પૂરા નાણાં ન હોવાથી આવી હોશિયાર દીકરીઓને ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેલું પડે છે, ને પરિવારને મદદરૂપ બનવા મજૂરીકામે વળગવું પડે છે.

નિશિતાએ આવી દીકરીઓનો સર્વે કર્યો અને છેલ્લા દસ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૧થી વડોદરા શહેર અને આસપાસના ગામોની સેકડો દીકરીઓની સ્કૂલ ફી ભરી રહી છે. **૨૦૧૧માં ૧૫૧ દીકરીઓની ફી ભરી હતી.** નિશિતા દાતાઓ પાસેથી માત્ર ‘એકાઉન્ટ પેઇઝ’ ચેક સ્લીકારે છે ને આજે **૨૦૨૧ સુધીમાં ૨૬,૦૦૦ જેટલી દીકરીઓની ફી ભરી છે.**

C/o. કનૈયા પ્રોવિઝન સ્ટેર,
બાગ દસ્તાજા, શાક માર્કેટ રોડ,
માણાવદર-૩૬૨ ફૃદી. મો. ૯૮૨૪૯ ૩૨૧૬૬

- કોઈપણ વ્યક્તિને જ્યારે પોતાની માની યાદ આવે ત્યારે આંખમાંથી આંસુઓ સરી પડતા હોય છે.

નારી જતિને લાભ લાભ વંદન!!

ગિરધરલાલ એચ. સોલિન્ડ
બાલાસરા શેરી, શ્રીજી કૃપા,
માણાવદર-૩૬૨ ફૃદી (મિલ્લો : જૂનાગઢ)

સુભિ રે.... બલબીરા

(અનુસંધાન : પાના નં. – ૩૦ ઉપરથી ચાલુ)

બાઈક ઘસડાવાનો અવાજ સંભળીને, આજુબાજુના બેતરોમાં કામ કરતા માણસો, બાઈક પડેલું જોઈને દોડી આવ્યા. સંજ્યને અને બાઈકને ઊભા કર્યા. સહેજ ઘસરકો પણ થયો નહોતો અને બાવળની શૂળો પણ છેટી રહી ગઈ હતી. ત્યાંજ એના સેલ ફોનની રિંગ વાગી. મેં ફોન કર્યો હતો. એણે કહ્યું, ‘પણ્યા, રસ્તામાં જ છું, આવું છું.’ ફોન પૂરો કરીને મોબાઈલની સ્કીન સામે તેણે જોયું, તો જોતો જ રહી ગયો! અરે આ શું? જે સ્કીન પર એણે કોઈ કુદરતી દશ્ય મૂકેલું, એના બદલે હનુમાનજીનો ફોટો સ્કીન પર આપમેળે આવી ગયેલો. કઈ રીતે?!

શરીર ઘસડાવાથી મોબાઈલમાંથી કુદરતી દશ્યને બદલે હનુમાનજીનો ફોટો જોઈ, આશ્રય, આનંદ અને ઉત્સાહથી મનમાં હનુમાન દાદાની કૃપા વાગ્યોળતો ધરે પરત આવ્યો. રસ્તામાં બનેલી હકીકત અમને જાણાવી ત્યારે અમને સૌને અહેસાસ થયો કે ‘સંકટ કટે મિટે સબ પીરા....’


કોઈપણ બાબતે અંધશ્રદ્ધા નહીં પરંતુ પોતાનો વિશ્વાસ જ મોટી વસ્તુ છે. પોતાના મનમાં જરા પણ મેલ-પાપ હોય નહીં તો ગમે તેવી આફતના સમયે વ્યક્તિનો આપોઆપ જચાવ થાય છે. ઉપરની હકીકત આ વાતનું સમર્થન કરે છે.

સોજન્ય : શરદભાઈ ભુટાક



યાદગીરી

સુમિરે.... બલબીરા (સૃતિપટ પર સંભારણાં)



સંપાદન :

બલવીરસિંહ જાડેજા

સત્ય ઘટના પર આધારિત....

પ્રિન્ટિંગ મિસ્ટેક

ઘણાં વર્ષો પૂર્વે મારા પિતાશ્રીને થયેલો એક અનુભવ, જે મને તેઓએ કહેલ, તે યાદગાર પ્રસંગની રજૂઆત અતે કરું છું.

મારા પિતાશ્રીના એક મિત્રએ તેમને એક પુસ્તક ભેટમાં મોકલાવ્યું હતું. પ્રથમ પાના પર લેખકનાં માતુશ્રીનો ફોટો હતો અને ફોટો નીચે સ્વ. જમનાબેન સુચક (માતાજીનું નામ) લખેલ હતું. છાપકામ કરનારે માતુશ્રીનાં નામની આગળ સ્વ. એટલે સ્વર્ગસ્થ છાપેલું, જે ખરેખર ભૂલ હતી. ત્યાં ગંગા સ્વરૂપ (ગં.સ્વ.) હોવું જોઈતું હતું કારણ તે સમયે તેમના માતુશ્રી હયાત હતા પણ વિધવા હતા.

મારા પિતાશ્રીને થયું કે લેખકના માતુશ્રીનું અવસાન થયું લાગે છે. તેથી તેમણે પોતાનો શોક પ્રદર્શિત કરવા લેખકને એક પોસ્ટકાર્ડ લખીને દિલસોજ વ્યક્ત કરી હતી. પરંતુ હકીકતમાં થયું એવું કે માતુશ્રીનાં અવસાનના ત્રીજા-ચોથા દિવસે લેખકશ્રીને પોસ્ટકાર્ડ મળતાં તેમને પણ આશ્ર્ય થયું હતું. વાસ્તવમાં જ્યારે અન્ય એક લેખક મિત્રે પેલા લેખકને ભૂલની જાણ કરી ત્યારે શું ભૂલ થઈ હતી તેની ખબર પડી.

બે અઠવાડિયા પછી લેખકશ્રીએ મારા પિતાશ્રીને વળતો જવાબ લખ્યો કે તમે શોક સંદેશો લખેલો ત્યારે મારા મા ખરેખર જીવિત હતા પણ જ્યારે પત્ર મખ્યો ત્યારે હયાત ન હતા. આમ મુફ રીડિંગ તથા પ્રિન્ટિંગ ભૂલને કારણે જે ઘટના ઘટી હતી તે મને હજુ પણ યાદ આવે છે.

- ભરત અંજારિયા

'આસોપાલવ', છન્કમટેક્સ સોસાયટી, રેયા રોડ,
રાજકોટ-૩૬૦ ૦૦૭. મો. ૯૮૨૬૪ ૧૯૮૪૪



**શક્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી,
આમ છતાં....**

અમારા પરિવારમાં એક સમયે સત્ય ઘટનાનો અદ્ભુત અનુભવ થયો હતો, જેની વિગત ટૂંકમાં નીચે મુજબ છે.

બ્રાહ્મણના કુટુંબમાં જન્મ એટલે ધર્મ અને આસ્થાના ગુણો જન્માત હોય જ. છતાં મને અમર એવા હનુમાનજી ઉપર વધુ શ્રદ્ધા. બાળપણથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ટેવ. આજની યુવા પેઢી માને કે ના માને પડી જીવનની ઘટમાળમાં આવેલી મુશ્કેલીઓમાં મને હનુમાન ચાલીસાના બળે હેમખેમ પાર ઉતારીને, મારી શ્રદ્ધાને મજબૂતી બક્ષી છે.

નિવૃત્તિ પછી રહેવાનું મહુવા, પરંતુ બાજુના શહેર રાજુલા બાજુ કામકાજ અંગે આવવા જવાનું કાયમ રહે. મહુવા રાજુલા રોડ પર લગભગ ૧૫ કિ.મી. દૂર એક ખતરનાક વળાંક છે. વાહન ચલાવવનારાઓ સહેજ પણ ગફલતમાં રહે, તો અક્સમાતનો ભોગ બન્યાના કાયમ પ્રસંગો બને.

ધરની ગાડી માટે મહુવાની માર્કેટમાં સ્પેરપાર્ટ્સ મળતા ન હોવાથી અને બાજુના રાજુલામાં જરૂરી સ્પેરપાર્ટ્સ મળશે તેની જાણ થતાં, નાનો દીકરો સંજ્ય બાઈક લઈને, ગાડીના પાર્ટ્સ લેવા રાજુલા ગયો.

'ભાઈ, સાચવીને જજે. ખાસ તો પંદર કિ.મી.ના વળાંકે ધ્યાન રાખજે. ઉતાવળ કરીશ નહીં.' પત્નીએ ચિંતા વ્યક્ત કરી શિખામણ આપી.

'અરે, કાઈ નહીં થાય. મારા હનુમાનજી દાદા આપણી સાથે છે. 'સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા.' કહીને મેં નિશ્ચિંત રહેવા જગાવ્યું. પણ....'

'ધટમાં ઘોડા થનગને ને આત્મ વિઝે પાંખ, વનદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.'

યુવાન દીકરો કાર માટે સ્પેરપાર્ટ્સ લેવા રાજુલા ગયો અને બાપોરે પરત આવતો હતો ત્યાં જ - એ જ વળાંકે અને એજ જગ્યા, ટ્રાફિક નહોતો અને બાઈકની સ્પીડ વધુ હતી અને એ જ વળાંક પર ક્યાં ગફલત થઈ, બાઈક લપસી. સાંનું હતું કે હેલ્પેટ પહેરેલી હતી પણ વળાંકનો રસ્તો પહોળો કરવા, કાપેલા બાવળિયાની શૂણો ચારે તરફ વેરવિખેર પડી હતી.

યોગાનુયોગ એ વખતે મને સૂઝ્યું કે, 'હજુ સંજ્ય કેમ ના આવ્યો? અત્યારે તો આવી જવો જોઈએ!' મેં ફરી એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.

(અનુસંધાન : જુઓ પાના નં. - ૨૯ ઉપર)



સ્વાસ્થ્ય

વર્લ્ડ સ્લીપ ડે - ૨

(World Sleep Day)



ડૉ. મહેશલાલ ગાડા
(સિનિયર
મનોયિકિલ્સક)



ડૉ. ઈસા પટેલ (ગાડા)
(બાળકો તથા પુણ્ય માટેના
મનોયિકિલ્સક)

આપણે 'મંગલ મંદિર'ના ગત અંકના લેખમાં જ્ઞાયું કે વર્લ્ડ સ્લીપ ડે - જાગતિક વિશ્વ નિંદ્રા દિવસ - ૨૦૦૮થી માર્ચ મહિનામાં મનાવવાય છે. વિશ્વ નિંદ્રા દિવસના જાહેર જનતાની જ્ઞાનકારી માટે કાર્યક્રમો યોજાય છે. જેમાં સુર્તિદાયક તથા સ્વાસ્થ્યમય ઊંઘ અને ઊંઘની સમસ્યાઓ માટે તથા સારવાર માટેની વૈજ્ઞાનિક માહિતી અપાય છે.

આ વર્ષે ૧૮ માર્ચ, શુક્રવારના દિવસે વિશ્વ નિંદ્રા દિવસ મનાવવામાં આવ્યો. આ વર્ષનું સૂત્ર છે : "નિયમિત ઊંઘ, સ્વાસ્થ્યમય ભવિષ્ય." (Regular Sleep, Healthy Future).

બ્રેઇનમાં આવેલ શારીરિક અવયવો (લિબિક સિસ્ટમના અવયવો હાઈપોથેલામસ, સુપ્રાકાઈસ્મેટિક, ન્યુક્લિયસ, બ્રેઇન સ્ટેમ, થેલામસ, પિનિયલ ગ્રંથિ) ઊંઘનું નિયમન કરે છે. મેલેટોનિન તથા ગાબા ન્યુરોટ્રોન્સમિટર્સ મહત્વનો ભાગ ભજવે છે.

બ્રેઇન વેવ તથા ન્યુરોનલ પ્રક્રિયા પરથી ઊંઘના તબક્કાઓનું વર્ગીકરણ કરાયેલ છે. નોન-રેપિડ આઈ મુવમેન્ટ સ્લીપ (NEEM) - સ્ટેજ-૧, સ્ટેજ-૨, સ્ટેજ-૪ તથા રેપિડ આઈ મુવમેન્ટ (REM) તબક્કાઓ છે.

મનુષ્યને સપનાઓ આર.ઈ.એમ. તબક્કામાં આવે છે. પરોફિયે આવેલા સપનાઓ ઘણી વખત યાદ રહે છે.

આ લેખમાં ઊંઘની સમસ્યાઓ તથા સારવાર વિશે માહિતી મેળવીએ.

● ઊંઘની સમસ્યા (અનિંદ્રા) (Insomnia) :

૧. ઊંઘ મોડેથી આવે : શરૂઆતમાં ઊંઘ આવવામાં તકલીફ થાય (Early Night Insomnia). એક વખત ઊંઘ આવે પછી ઊંઘમાં ખલેલ ન પહોંચે.
૨. રાત્રિમાં વચ્ચેના સમયમાં ઊંઘ ઉડી જાય (Middle Night Insomnia) શરૂઆતમાં ઊંઘ આવે પણ વચ્ચે ઊંઘ ઉડી જાય અને પછી ઊંઘ ન આવે પરંતુ પરોફિયે ઊંઘ આવે. સવારના સમયસર ઊંઘ ઉડી જાય.
૩. વહેલી સવારે ઊંઘ ન આવે (Early Morning Insomnia) : પરોફિયે વહેલી ઊંઘ ઉડી જાય અને પછી

ઊંઘ ન આવે.

ઊંઘ આવવા માટેની બધી સગવડો હોવા છતાં ઉપરોક્ત તકલીફમાંથી એક અથવા વધારે તકલીફ હોય / થાય તો અનિંદ્રાની તકલીફનું નિદાન થાય છે.

● નિદાન :

અનિંદ્રા, એ બીમારીનું લક્ષણ છે. બીમારીનું નિદાન નથી. અનિંદ્રાના લક્ષણનું બે વિભાગમાં વર્ગીકરણ કરાય છે.

૧. પ્રાથમિક (Primary Insomnia)
૨. દ્વિતીય (Secondary Insomnia)

અનિંદ્રાની ફરિયાદ દ્વિતીય કે અન્ય બીમારીને લીધે હોય તો મૂળ બીમારીની યોગ્ય સારવાર કરવાથી મૂળ બીમારી કાબૂમાં આવે છે તથા અનિંદ્રા લક્ષણ પણ દૂર થાય છે. અનિંદ્રા માટે અલગથી સારવાર કરવાની આવા કિસ્સામાં જરૂર નથી. ટાઈફોઇડની બીમારીવાળા દર્દને મૂળ બીમારી ટાઈફોઇડ માટે દવા અપાય છે, નહીં કે તાવ માટે.

● સારવાર :

અનિંદ્રાની ફરિયાદ પ્રાથમિક અનિંદ્રાની બીમારી તરીકે હોય કે કોઈક વખત દ્વિતીય બીમારીની યોગ્ય સારવાર બાદ પણ અનિંદ્રાની ફરિયાદ રહે તો નીચે પ્રમાણે સારવાર કરાય છે.

**દવા સિવાયની સારવારની પદ્ધતિઓ
(Non-Pharmacological Methods)**

(અ) ઊંઘ માટેના સોનેરી નિયમો તથા ટેવો (Good Sleeping Habits, Sleep Hygiene)

૧. બેડરૂમ શાંત, આરામદાયક, અંધકાર / ડાર્નવા પ્રકાશવાળો હોવો જોઈએ. બહારથી ખલેલ ન પહોંચે.
૨. શરીરની સ્થિતિ (Position) સૂતી વખતે આરામદાયક હોવી જોઈએ.
૩. પથારીનો ઉપયોગ ફક્ત સૂવા માટે જ કરો. દિવસના ભાગમાં કે સાંજે પથારીમાં આગોટવાનું ટાળો.

(અનુસંધાન : જુઓ પાના નં. - ૩૪ ૮૫૨)



ધરસંસાર

હેત અને Hate



....નાટકનો પડદો ઉંચકાય છે....

અંક : પહેલો, દર્શય : પહેલું....

એક માતા પોતાના બાળકને હેતથી, તેની આંગળી પકડીને નિશાળે મૂકવા જાય છે. બાળક રહે છે. કહે છે, ના... મા... મારે નિશાળે નથી જવું. તારી પાસે જ રહેવું છે. મા, તું મને મૂકીને ના જતી... મા, આવું શું કરે છે? મા, હવે હું નહીં રહું. પણ મા કહે છે, જો બેટા, તારે નિશાળમાં ભણી, સાંઠું શિક્ષણ મેળવી તારે મોટા માણસ વિનયી, સજ્જન, હોશિયાર બનવાનું છે. આપણા કુણનું નામ રોશન કરવાનું છે. બાળક ખૂબ રહે છે, પરંતુ માતા હૃદય કઠણ કરી બાળકને નિશાળે મૂકી ઘર તરફ મનોમન ઊંચા વિચારો કરતી કરતી પાછી ફરે છે. મનમાં દીકરાના હિતના વિચારો ચાલુ છે. તેનું આ હેત, તેના હિત માટે છે. માટે મા કમર કસી, કષ વેઠી, ઉજાગરા કરી, ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરે છે.

.... ૨૫ વર્ષ પછી....

અંક : બીજો, દર્શય : પહેલું

સમય વહેતો જાય છે. બાળક, બાળક મટી કિશોર અવસ્થામાંથી હવે યુવાન બને છે. ઘરમાં તેની પસંદગીની સુંદર મજાની પુત્રવધૂ આવે છે. ઘર હર્યુભર્યું લાગે છે. તેમાં વળી સમયાંતરે પૌત્રનો જન્મ થતાં ઘરમાં બાળકની કિલકિલાટી... કલરવ... ગુંજનથી આનંદનું વાતાવરણ સર્જ્ય છે. માતાના અનુભવથી, પુત્રનું લાલન-પાલન સુંદર થાય છે. પુત્ર અને પુત્રવધૂ નિશ્ચિત અને ખુશ છે. બાળક મોટો થાય છે. માતાને પણ આનંદ છે.

ત્યાં જ એક દિવસ એ યુવાન માતાનો હાથ પકડી, હાથમાં બેગ પકડાવી ઘરડાધર તરફ લઈ જાય છે. મા ઘણી આજ્જુ કરે છે, આકંદ કરે છે. બેટા, મારે ત્યાં નથી જવું. મને તારી પાસે રહેવું છે. હું ઘરના એક ખૂણામાં પડી રહીશ. મારે તારી, તારા બાળકોની હૂંફની જરૂર છે. બેટા પ્લીઝ, મને ક્યાંય નહીં ફાવે. આ પિંડને અહીં પાંજરામાં પડી રહેવા દે. પણ દીકરો કહે છે, ‘મા, હવે મને તારી જરૂર નથી. હું તારા હિત માટે તારી પાછળની ઉમર શાંતિથી પસાર થાય, તને તારી ઉમરના માણસો મળે માટે જ તને ઘરડાધરમાં મૂકવા આવું છું.’ દીકરો માને મૂકીને ચાલ્યો ગયો. માનું હૃદય ભાંગી પડ્યું.

મન અતીતમાં સરી પડ્યું. શું આવો દિવસ જોવા માટે મે

તન-મન-ધનથી દિવસ-રાત જોયા વગર, આ દુઃખ જોવા માટે મેં મારા દીકરાને મોટો કર્યો?

વાવો તેવું લણો...

કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરડાધરો વધી રહ્યા છે તેનું કારણ શું? જે મા-બાપે તમને લાગણી અને પ્રેમનું સિંચન કરી મોટા કર્યા, તેમને જ્યારે તમારા સહારાની જરૂર છે, ત્યારે જો તમે તેમને વૃદ્ધાશ્રમ કે ઘરડાધરમાં મોકલશો તો તમે ક્યારેય તમારો વિચાર કર્યો છે કે ભવિષ્યમાં તમાં સંતાન પણ આ કાર્ય કરી શકે છે!

...૫૦ વર્ષ પછી....

પેલા દંપતીનું નાનું બાળક હવે કિશોરાવસ્થામાંથી યુવાન બન્યો. એક દિવસ તે એક ફોર્મ લઈ આવ્યો. તેણે પોતાના પણ્ય-મભ્મીની સહી લીધી. પણ્ય પૂછે છે કે, બેટા, આ શાનું ફોર્મ છે? ત્યારે તે બાળક મટી યુવાન બનેલો પોતાના પણ્યાને જવાબ આપે છે. ‘પણ્યા, જો તમે બાને ઘરડાધરમાં મૂકી આવ્યા. એમાં જો એમનું હિત તમને દેખાતું હતું તો હું પણ એ જ કરી રહ્યો છું, જે તમે આજ્ઞી રૂપ વર્ષ પહેલાં કર્યું હતું. હું પણ તમારા હિત માટે જ કરી રહ્યો છું. માટે તમે સહી કરો. અત્યારથી ફોર્મ ભરીશું ત્યારે બે-ગ્રાન્ડ વર્ષ નંબર લાગશે ને! આ તો હું તમારા હિત માટે જ કરું છું.’

ઘરડા ઘર... વૃદ્ધાશ્રમની સંખ્યા વધવાનું કારણ આજની વિભક્ત કુટુંબ વ્યવસ્થા. વિભક્ત કુટુંબમાં રહેનાર બ્યક્ટિ ચારથી પાંચમી બ્યક્ટિને સહન કરી શકતો નથી. તેઓને પોતાના જીવનમાં ઉપરી કે વડીલ બ્યક્ટિની દરમિયાનગીરી પસંદ નથી. દરેકને મુક્ત ગગનમાં વિચારવું છે. સંસ્કૃતિ મૃતઃપ્રાય થઈ રહી છે. પ્રકૃતિ (સ્વભાવ) કાળ-ક્ષેત્ર મુજબ બદલાયો છે. માણસ વિકૃત બની ગઈ છે. માનવકૃતિ... માણસ કૃતિ બની ગઈ છે.

આને આગળ વધતી અટકાવવા માટે... પહેલ દરેક સીએ, કે જે પરણીને, ઘરમાં વહુ બનીને આવી છે, તેણે કરવાની છે. સાથે વડીલોચે પણ સ્વભાવમાં પરિવર્તન લાવવાની જરૂર છે. વડીલો એક પગથિયું નીચે આવે, યુવાનો એક પગથિયું ઉપર આવે. બંને પક્ષે જો Mutual understanding હશે તો Problem will be solved. There will be no problem for ever. કોટુંબિક એકતામાં જ અખંડિતતા રહેલી છે. સંયુક્ત કુટુંબને તૂટતા બચાવો તેમાં જ આપણી ભવાઈ છે. બાકી સંસારમાં તિરાદ

(અનુસંધાન : જુઓ પાના નં. - ૧૧ ઉપર)



કારકીર્તિ

હોબી માટે વ્યક્તિત્વ કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે?



દીરેન દવે


દરેકને જીવનમાં કોઈ ને કોઈ શોખ હોવો જોઈએ. નવરાશના સમયમાં જે પ્રવૃત્તિ કરવી તમને ગમે તેને હોબી ગણી શકાય. જેમ કે વાંચન, ડિકેટ, સંગીત વગેરે. જ્યારે વ્યક્તિત્વ કસોટી માટે તૈયારી કરતા હોઈએ ત્યારે હોબી નવા દાખિકોણથી જોવાની તક મળે છે.

સનદી સેવા કે ગુજરાત મુલ્કી સેવાઓ માટે યોજાતી વ્યક્તિત્વ કસોટીમાં ‘હોબી’ એક કોલમ તરીકે રાખવામાં આવે છે અને બોર્ડના સભ્યો તેને લગતા અનેક પ્રશ્નો પૂછે છે. કેટલાક ઉમેદવારો આ કોલમ ખાલી રાખે છે. વ્યક્તિત્વ કસોટી દરમિયાન તેના ખુલાસારૂપે એવો જવાબ આપે છે કે તેમને આ માટે સમય મળતો નથી. આ પ્રકારના લૂલા બચાવથી કદી સારી છાપ પડતી નથી. સરવાળે નિષ્ફળતા મળે છે. અનેક વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછતા હોય છે કે સર ‘હોબી’માં શું લખવું? આ પ્રશ્નનો કોઈ ફિક્સ ઉત્તર હોઈ શકે નહીં. આથી **હોબી પસંદ કરતાં નીચેના મુદ્રા દ્વારાનાં રાખો.**

1. તમે જે છો તે જ કહો, ખોઢું બોલવા જતા ચોક્કસ પકડાઈ જશો. વ્યક્તિત્વ કસોટી તમારું સાચું વ્યક્તિત્વ જાણવા માટે છે, તેમાં ખોઢું બોલવાથી ક્યારેય સારા ગુણ મેળવી શકતા નથી.
2. તમારા શોખ કે હોબી વિશે સ્પષ્ટતા અત્યંત જરૂરી છે. જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ હોબીમાં ‘વાંચન’ લખે છે. હવે જ્યારે તમે આવો શોખ દર્શાવો ત્યારે પરીક્ષકને એક વિશાળ ક્ષેત્ર આપી દો છો, જેમાં તમે ખરેખર કેટલું સંતોષકારક જણાવી શકો તે પ્રશ્ન છે. તમારા મુદ્રાને વધુ સ્પષ્ટ કરી શકાય કે તમે શું વાંચો છો? તમે એવું લખી શકો કે ‘ગુજરાતી નવલકથા વાંચવાનો શોખ’ અથવા ‘સફળ વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાનો શોખ.’ આ સ્પષ્ટતાથી તમને પ્રશ્ન પૂછવાનું ફલક મર્યાદિત થઈ જશે અને તમે સંતોષકારક જવાબો આપી શકશો. આજ રીતે ‘રમતગમત’ હોબી લખવી તેના કરતા ‘ડિકેટ’, ‘હોકી’, ‘ચેસ’ કે કોઈપણ સ્પષ્ટ રમત નામ સાથે જણાવવી જોઈએ.
3. વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. જો કોઈ રમતનો શોખ દર્શાવો તો તમારા ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન, તેના રેકોર્ડ, હાલમાં રાખ્યી કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ટુનિમેન્ટ, રમતની ખાસિયતો અને નિયમો વગેરે વિશે પ્રશ્નો આવી શકે. જેમ કે એક આવકવેરા અવિકારી ઉત્તર પ્રદેશ રાજ્યના હતા અને અમદાવાદમાં તેનું પોસ્ટિંગ હતું. આઈ.એ.એસ. ઇન્ટરવ્યૂ માટે તેણે ટ્રાવેલિંગને શોખ ગણાવ્યો હતો. મોક

ઇન્ટરવ્યૂમાં મેં તેને પૂછ્યું કે તમે ક્યાં ફરવા ગયા છો? તેણે કહ્યું કે, સર, મારી કામગીરીની જવાબદારીમાં વધુ ફરવાનો સમય મળતો નથી પરંતુ મેં અમદાવાદ જોયું છે. બોર્ડ પૂછ્યું કે, તમે ગાંધી આશ્રમ જોયો છે? અમદાવાદમાં ‘દાદા હરિની વાવ’ ક્યાં આવેલી છે? ગુજરાતમાં યહુદીઓ માટેનું ધર્મસ્થળ ‘સિનેગોગ’ વિશે તમે શું જાણો છો? આ પ્રશ્નનો તેની પાસે કોઈ ઉત્તર નહોતો. જ્યારે તમે કોઈ પણ હોબી દર્શાવો તો તેના વિશે ઊંડો અભ્યાસ કરો. જે તે સ્થળના સામાજિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે પાસા વિશે પૂરતી જાણકારી હોવી જરૂરી છે.

4. બોર્ડના સભ્યોના જ્ઞાન વિશે કદી શંકા કરવી નહીં. બોર્ડના પાંચ સભ્યો બેગા થાય ત્યારે તેમની પાસે સમગ્ર બ્રાન્ચાંડનું જ્ઞાન છે તેમ માનવું! કેટલાક ઉમેદવારો ઓવરસ્માર્ટ બની એમ માનવાની ભૂલ કરે છે કે ૧૫-૩૦ મિનિટના ઇન્ટરવ્યૂમાં બોર્ડને કાંઈ ખબર ન પડે! આવા કેન્દ્રિક માટે ઉદાહરણારૂપ ડિક્સો છે : એક ઉમેદવારે પોતાની હોબીમાં ‘ફારસી કવિતા વાંચવાનો શોખ’ જણાવ્યો. બોર્ડ તેને કોઈ ફારસી કવિતા સંભળવા કહ્યું. તેણે એક કવિતા બોર્ડ સમક્ષ લલકારી. બેન્ગ્રા અંતરા ગાયા બાદ ઉમેદવાર મુંજાયો. ત્યારે બોર્ડના એક સભ્યે જયાંથી ઉમેદવાર અટક્યો હતો, ત્યાંથી આગળ કવિતા ગાઈ સંભળાવી! અંતે તેને સારા ગુણ આપવામાં આવ્યા. પણ જો તે બોર્ડ સમક્ષ જૂં બોલ્યો હોત તો તેને ક્યારેય પસંદ કરાત નહીં!
5. અયોગ્ય રીતે લખાયેલ હોબી તમારા ઇન્ટરવ્યૂ માટે જોખમી બની શકે. જેમ કે એક ઉમેદવારે ‘મેળી બનાવવાનો શોખ’ લખ્યો હતો. આવી ભૂલ આત્મહત્વા બરાબર છે!
- આમ, વ્યક્તિત્વ કસોટી માટે જો ‘હોબી’ની તૈયારી કરો તો આપ ખુદ આપની હોબીને અને તેની સાથે પોતાને રી-ઇન્વેન્ટ કરી શકો! આ બધા પાસા પર જો વિચાર કરશો તો કોઈપણ બાબતને બહુ આયામી (મલ્ટી ડાયમેન્શન) રીતે જોવાની ક્ષમતા કેળવી શકશો! માત્ર વ્યક્તિત્વ કસોટી માટે જ નહીં પણ જીવનના તમામ ક્ષેત્રો ખૂલ જ ઉપયોગી થઈ શકો! આમ, વ્યક્તિત્વ કસોટી એ કોઈ ફેશન પરેડ નથી. સારા તૈયાર થઈ અને સારી રીતે વાતો કરવાની કોઈ ઇવેન્ટ નથી! પણ એક પરિસંવાદ થકી આંતરમનનો લેવામાં આવતો એકસ-રે છે!



જીવ કર્મથી બંધાયેલો સંસારમાં ભસ્યા કરે.
બારે પ્રકારે તપુ મળી સહુ કર્મની નિર્જરા કરે.
અનશન આદિ બાહ્ય ને વિનયાદિ અભ્યંતર કહ્યા,
સામાયિક કરતાં નીપછે પ્રભુ વીર એમ ભાંખી ગયા.

આત્મા સંસારમાં વિષયાદિક મહિનતાથી પર્યટન કરે છે. તે મહિનતાનો કષ્ય વિશુદ્ધ ભાવ - જગથી હોવો જોઈએ. જે વડે મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક.

આઈ ઘરીના અહોરાત્ર વર્થં ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંત કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશ્વષ સામાયિક સાર્થક કરે છે.

વિરતિ સવારમાં વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. એને ખૂબ આનંદ આવ્યો. કયાં મુંબઈનું ભાગડોડાનું જીવન અને કયાં અહીંની શાંતિ! પરંતુ એ તો સંજોગાધીન છે. જ્યાં રોજરોટીનું સાધન છે, ભાગતર ચાલુ છે ત્યાં તે રીતે રહેવું જ પડે. પરંતુ આ રીતે જ્ઞાનસત્ત્રમાં આવવું, વ્યાખ્યાન સાંભળવા, નવું નવું જ્ઞાણવું, શીખવું એ તો જીવનનો અદૃભુત લહાવો છે. એને અહીં આ રીતે જ્ઞાનસત્ત્રમાં જોડાઈ કર્ય આવવાની સહેજ પણ ઈચ્છા નહોતી. મમ્મી પપ્પાના દબાણને લઈને આવી હતી. પરંતુ હવે તો પાછા જવાનું મન નથી થતું. ખૂબ સારું લાગે છે. એક તદ્દન નવો અને આવશ્યક અનુભવ છે.

વ्याख्यानमां એણો સांભળ્યુ કે જીવ સમયે સમયે સાત આઈ કર્મ બાંધે છે. કર્મની આવ ચાલુ છે. કર્મથી બંધાયેલો જીવ ચાર ગતિ સંસારમાં ફર્યા કરે છે. **જીયાં સુધી આત્મા કર્મમુક્તા ન થાય ત્યાં સુધી એને મોક્ષ નથી મળતો.** આ વાક્ય સતત એના મનમાં રમ્યા કરતો હતો. તો હવે કરવું શું? કર્મ બાંધેલા તો છે, નવા બંધાયા કરે છે તો પછી છટવાનો વારો કયાંથી આવે?

જ્ઞાનસત્ર દરમિયાન આત્મજ્ઞાન ડીપિકા ભાગ-૧ પુસ્તકનો એનો અભ્યાસ ચાલુ હતો. એમાં એક વાક્ય એને મળ્યું જેમાં એનો ઉત્તર સમાયેલો હતો. “સામાયિક કરતા ૧૨ પ્રકારે તપ નીપજે છે, જે તપ એ કર્મનિર્જરાનું કારણ છે. કર્મનિર્જરા કરતાં કર્મમુક્ત થવાય છે.”

વિરતિને થયું, વાહ, આ તો બહુ જ સહેલો ઉપાય છે.
વિરતિ વિચારતી ગઈ અને જ્ઞાનના પ્રકાશમાં એને ધીરેધીરે

કલ્યાણ

નિર્જરા માટે સરળ રસ્તો : સામાયિક (૭)

પાણિબેન કનકસેન શાહ

સામાયિક તપ દ્વારા તપ કેમ નીપજે છે તે સમજાતું ગયું. એને લાગ્યું કે સામાયિક અવશ્ય કરવો જોઈએ. જેટલા વધુ સામાયિક થાય તેટલા કરવા. જેટલો સમય સામાયિકમાં રહેવાય એટલું સારું.

ભગવાન મહાવીરે તપના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે :
 બાધ અને અભ્યંતર. બાધ તપના છ પ્રકાર છે : અનશન,
 ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને
 પડિસંબિનતા. જ્યારે અભ્યંતર તપના ભેદ છે પ્રાયશ્ચિત, વિનય,
 વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એમ છ. કુલ મળીને
 તપના બાર ભેદ થયા. આ બાર ભેદ સામાયિક દ્વારા કેમ નીપજે
 તે વિચારશું.

● અનશાન :

અનશન એટલે અમનો ત્યાગ. તેના બે ભેદ ગણાય : થોડા
કાળનું અનશન, જાવજીવનું અનશન.

સામાયિક દરમિયાન કશું ખાવાપીવાનું નથી. આહારનો સંપૂર્ણપણે ત્યાગ છે. એ દરમિયાન સમભાવની સાધના અને દેહભાવ છોડવાની પ્રેક્ટિસ કરવાની છે. આત્મભાવોમાં રમણતા કરવાની છે. અનેના ત્યાગ સાથે આહારમાત્રના વિચારનો ત્યાગ કરવાનો છે.

આહારની સાથે આરંભ સમારંભ રહેલો છે. એટલે એ સાથે છકાય જીવોની વિરાધના થાય છે. વનસ્પતિ કાયના સાથ વિના ભોજન ક્યાંથી બને? પૃથ્વી (મીહું), પાણી, અજિન અને વાયરાની જરૂર પડે. એ બધી વિરાધના પછી આહાર તૈયાર થાય. સામાયિક કરતાં એથી દૂર રહેવાય અને છકાય જીવોની દયાના ભાવ વણાયેલા રહે, એટલે એ સમયે આહાર સંબંધી ચિંતનથી દર રહેવું.

સામાયિક લીધો છે એટલે પાણીપુરી, દહીવડા, ઢોસા, પાસ્તા જેવી વાનગીઓ યાદ આવી. એનો રસ જીબમાં આવ્યો. તો એ મનનાં માટાં પરિણામ (ભાવ) છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચોક્સાઈપૂર્વક છતાં સહજપણે સામાયિક કરીએ તો અનશન નામનું પહેલું તપ સુખેસુખે નીપજે છે. માટે યાદ રાખવું કે અનશન એ તો અણાહારી પદ પામવા માટેની સીરીનું પ્રથમ પગથિયું છે. આહાર સંજ્ઞા તોડવાનું સાધન છે. આવું તપ સામાયિક દ્વારા નીપજે.

● બીજી કમે ઊણોદરી :

ઉદરને ઊણું રાખવું તે ઊણોદરી. કાંસી કાંસીને પેટ ભરવું નહીં. ભૂખ હોય એનાથી ઓછું ખાવું. આ વાત તો સમજાતી નથી. સામાયિકમાં આહાર લેવાનો નથી પછી પેટને અધૂરું કે પૂરું રાખવાની વાત ક્યાંથી થાય? આના ઉત્તરમાં ઊણોદરીનો અર્થ સમજવો પડશે. ઊણું રાખવું. ઉદરનો અર્થ માત્ર 'પેટ' કરીએ તો સમજશે નહીં. ઊણોદરીનો અર્થ માત્ર ઓછું ખાવું એટલા પૂરતો ન કરતાં, એનો વિશેષ વિચાર કરવો. વૃત્તિઓ પર સંયમ રાખવાથી, કેળવવાથી આ તપ નીપજે છે.

પ્રત્યેક ઈન્દ્રિયને એનું આગવું ઉદર છે. જીવની ચાર સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) અને મન તેમજ ઈન્દ્રિયોના તૃપ્તિબિદ્ધુથી થોડા દૂર રોકાઈ જવું, અધૂરું રાખી દેવું તે ઊણોદરી છે.

સામાયિકમાં ઊણોદરી કેમ થાય? સામાયિક સમયે સ્વપ્રશંસા કે અન્ય વ્યક્તિ માટેના અવર્ણવાદથી દૂર જઈએ. જેમ ટેલિફોન પર રોંગ નંબર કરી ફોન મૂકી દઈએ તેમ દૂર જતા રહેવું, તે છે શ્રોતેન્દ્રિયની ઊણોદરી.

મન બહુ નઠારું છે, ચંચળ છે. આંખ માટે કોઈ સંદેશો લાવે, સારું નરશું ના ભાવ આવવા જ ના દઈએ. મનને સ્પર્શો તે આત્મા સુધી પહોંચાડવું જ નહીં.

સુગંધ આવી કે બદબૂ આવી તે વખતે સુબુદ્ધિ પ્રધાનની વાત યાદ રાખવી. પુદ્ગલનો સ્વભાવ છે સારાનું ખરાબ થાય, ખરાબનું સારું થાય. ખાતી કાચી કેરી પાકી થાય. પાકી કેરી બગડી જાય, સડી જાય માટે એમાં લપટાવું નહીં.

રસેન્દ્રિયને વાતો કરવામાં રસ બહુ આવે. એ વાર્તા રસથી દૂર રહેવું. અહીં બેસવું, હવા આવશે, ગરમી નહીં થાય, હવે તડકો આવ્યો, જગ્યા બદલી નાખું, જગ્યા ખરબચ્ચી છે – આ બધા ભાવોથી પર થતાં સ્પર્શેન્દ્રિયની માંગ હુકરાવાશે.

સામાયિક દરમિયાન દ્વય ઊણોદરી સાથે ભાવ ઊણોદરી થશે. વૃત્તિ કાબૂમાં રહે, કષાયના ભાવ બલવત્તર ન બને. કોઈ કષાયે હુંકડાં કર્યો તો એને શાંત પાડવું એ ઊણોદરી છે.

પૂર્ણપણે ઊણોદરી તપ આદરનાર આ પાંચે ઈન્દ્રિયોને નવકારના આ પાંચ પદ સાથે જોડી દે છે.

- મને જે કાન મળ્યા છે તે દ્વારા હું અરિહંત પ્રભુના પ્રરૂપાયેલા સૂત્ર સિદ્ધાંત સાંભળવા પામું – શ્રોતેન્દ્રિય.

- આંખો દ્વારા હું સિદ્ધ ભગવતના શુદ્ધ અલોકિક સ્વરૂપના દર્શન કરું – ચક્ષુએન્દ્રિય.

- નાક દ્વારા આચાર્ય ભગવંતના શુદ્ધ નિર્મળ ચારિત્રની સુવાસ લઉં – ધ્યાણેન્દ્રિય.

- ઉપાધ્યાયજી મહારાજ પાસેથી સમ્યક્ જ્ઞાનનો રસ પામું. તેમની વાણીનો રસાસ્વાદ લઉં – રસેન્દ્રિય.
 - સાધુ સાધ્વીજીઓની ચરણરજ પામું, તેમનું સતત સાનિધ્ય પામું – સ્પર્શેન્દ્રિય.
- આ છે તે ઊણોદરી તપ તે ગુણોદરી તપ.

(ક્રમાંક)

ઘનવંતરી વિનિક્તિસાલય,
શ્રીજી નગર, મુંદ્રા, કચ્છ.

વર્લ્ડ સ્લીપ ડે – (૨)

(અનુસંધાન : પાના નં. – ૩૧ ઉપરથી ચાલુ)

- સવારના ઉઠવાનો સમય નિયમિતપણે એક જ રાખો. રાતના ગમે તેટલી મોઢેથી ઊંઘ આવી હોય તો પણ સવારના રોજના સમયે ઉઠી જાઓ.
- રાતના પોતાના સમયે સૂર્ય જાવ. ઊંઘ ન આવે તો પણ પથારીમાં સૂતા રહો. પથારીમાં રિલેક્સેશન કરો. ભગવાનના નામનું રટણ કરો. આંખો બંધ જ રાખો.

(બ) મનને ઉતેજુત / અશાંત કરનારી પરિસ્થિતિ / ઘટનાઓથી દૂર રહો (Stimulus Control)

- ચા, કોઝી, કોલાયુક્ત ઠંડા પીણા સાંજ બાદ ન લો.
- સાંજ બાદ ધૂમ્રપાન, તમાકુનું સેવન ન કરશો.
- રાતનું જમવાનું યોગ્ય સમયે લો. શક્ય હોય તો સૂવાના સમયની બે કલાક પહેલા જમી લો. રાતનું ભોજન હળવું લો. રાત્રે પેટ ભરીને ન જમો.
- સૂવાના સમય પહેલા દલીલબાળ ટાળો. મનને ઉતેજીત કરનારી પરિસ્થિતિ ટાળો.
- સૂવાનું ટાળો.
- સાંજ બાદ જોમભરી (Vigorous) શારીરિક કસરત ન કરો.
- રાતના ટી.વી. જોવાનું ટાળો (ઊંઘ ન આવે તો પણ શક્ય હોય તો રાતના ૧૧.૦૦ વાગ્યા બાદ લાઈટ બંધ કરી દો.)
- ઊંઘ ન આવે તો પણ રાત્રે ઘડિયાળ ન જુઓ.
- ઊંઘ ન આવે તો પણ પથારીમાં રહો.
- રાત્રે ૧૧.૦૦ વાગ્યા બાદ મોબાઇલ ફોન, કોમ્પ્યુટરનો ઉપયોગ ટાળો.

સારવારની અન્ય પદ્ધતિઓ વિશે હવે પછીના લેખમાં જાણકારી મેળવીશું.

(ક્રમાંક)

SOME GOLDEN THOUGHTS....

“Small deeds done are better than great deeds planned.”

“Do not be afraid to demand great things of yourself. Powers which you never dreamed you possessed, will leap to your assistance.”

“Steady, determined and purposeful action is one prayer that is always answered.”

“Do the most uninteresting tasks first, the plesanter ones last.”

“Learn something new everyday – keep your eyes, your ears, and most of all your mind, open at all times.”

*“Before everything else,
getting ready is the secret of success.”*

*“If you will set the example,
you won’t need to set many rules.”*

*“If we do not change our direction,
we are likely to end up
where we are headed.”*

“Experience is not what happens to a man. It is what a man does with what happens to him.”

“The art of life lies in a constant re-adjustment to our surroundings.”

“Jumping at a several small opportunities may get us there more quickly than waiting for a big one to come along.”

“The true reward of a thing well done is to have done it.”

“Keep trying. It’s only from the valley that the mountain seems high.”

Presentation : Dinesh R. Mehta

તમારા ફેવરીટ ફિલ્મી પાત્રોને ઓળખો : જવાબો



ગોમસ ગેલેરી

પરીક્ષા



સંકલન : કિરણબેન પી. છક્કર

પરીક્ષા-૧ : આંકડાઓની આંટીઘૂંઠી

નીચે આપેલ ચાવીઓ સાથે મથામણ કરી યોગ્ય સંખ્યા શોધી કાઢો...

A

૧. પહેલા અને બીજા આંકડાનો સરવાળો ‘૬’ મળે છે.
૨. ગીજામાંથી પહેલો આંકડો બાદ કરીએ તો જવાબ ‘બેદી’ સંખ્યા આવે છે.
૩. બીજા અને ગીજા આંકડાનો ગુણાકાર ‘૧૫’ મળે છે.
૪. પ્રથમ ત્રણ સંખ્યાનો સરવાળો ‘૮’ મળે છે.
૫. ચોથા આંકડામાંથી બીજો આંકડો બાદ કરીએ તો જવાબ ‘ત્રીજો’ આંકડો મળે છે.
૬. છેલ્લા ત્રણ આંકડાનો ગુણાકાર ‘૮૬’ મળે છે.
૭. બીજા આંકડામાંથી પાંચમો આંકડો બાદ કરીએ તો જવાબ ‘પહેલો’ આંકડો મળે છે.
૮. ગીજા અને ચોથા આંકડાનો સરવાળો ‘એકી’ સંખ્યા મળે છે.
૯. પાંચમા આંકડામાંથી પહેલો આંકડો બાદ કરીએ તો જવાબ ‘ત્રીજો’ આંકડો મળે છે.
૧૦. જો બધા આંકડાઓનો સરવાળો કરીએ તો જવાબ ‘૨૧’ મળે છે.

B

૧. પહેલા અને બીજા આંકડાનો સરવાળો ‘૧૦’ મળે છે.
૨. ગીજામાંથી પહેલો આંકડો બાદ કરીએ તો જવાબ ‘એકી’ સંખ્યા આવે છે.
૩. બીજા અને ગીજા આંકડાનો ગુણાકાર ‘૪૨’ મળે છે.
૪. પ્રથમ ત્રણ સંખ્યાનો સરવાળો ‘૧૬’ મળે છે.
૫. ચોથા આંકડામાંથી બીજો આંકડો બાદ કરીએ તો જવાબ ‘પાંચમો’ આંકડો મળે છે.
૬. છેલ્લા ત્રણ આંકડાનો ગુણાકાર ‘૧૦૮’ મળે છે.
૭. બીજા આંકડામાંથી પાંચમો આંકડો બાદ કરીએ તો જવાબ ‘૫’ મળે છે.
૮. ગીજા અને ચોથા આંકડાનો સરવાળો ‘એકી’ સંખ્યા મળે છે.
૯. પહેલા અને પાંચમા આંકડાનો ગુણાકાર કરીએ તો જવાબ ‘ત્રીજો’ આંકડો મળે છે.
૧૦. જો બધા આંકડાઓનો સરવાળો કરીએ તો જવાબ ‘૨૭’ મળે છે.

પરીક્ષા-૨ : જો અને તો

નીચે આપેલ ચાવીઓ સાથે મથામણ કરી યોગ્ય જવાબ શોધી કાઢો...

ક

૧. જો બીજો, ગીજો અને પાંચમો અક્ષર કાઢી, પાંચમા અક્ષરની જગ્યાએ ‘મ’ મૂકીએ તો ‘હુનિયા’ મળે.
૨. જો ગીજો અને ચોથો અક્ષર કાઢી, પહેલા અક્ષરનો કાનો પણ કાઢીએ તો ‘અજીણા’ મળે.
૩. જો પહેલો, બીજો અને પાંચમો અક્ષર કાઢી, પાંચમા અક્ષરની જગ્યાએ ‘વાલા’ મૂકીએ તો ‘આજીજી’ મળે.

ખ

૧. જો પહેલો, ચોથો અને પાંચમો અક્ષર કાઢી, બીજા અક્ષર પર અનુસ્વાર લગાવીએ તો ‘માંચડો’ મળે.
૨. જો બીજો, ગીજો અને પાંચમો અક્ષર કાઢી, પાંચમા અક્ષરની જગ્યાએ ‘વાલા’ મૂકીએ તો ‘આજીજી’ મળે.
૩. જો પ્રથમ ત્રણ અક્ષર કાઢી, પાંચમા અક્ષર પછી ‘ઃ’ મૂકીએ તો ‘મોટા અવાજનું’ મળે.

ગ

૧. જો પ્રથમ ત્રણ અક્ષર કાઢી, ચોથા અક્ષર પછી ‘સ’ મૂકીએ તો ‘પાલ્વિમેન્ટ’ મળે.
૨. જો બીજો, ગીજો અને ચોથો અક્ષર કાઢી, તેની જગ્યાએ ‘દ’ મૂકીએ તો ‘સહાય’ મળે.
૩. જો પહેલો, ચોથો અને પાંચમો અક્ષર કાઢી, પહેલા અક્ષરની જગ્યાએ ‘ના’ મૂકીએ તો ‘હલકાઈ’ મળે.

(જવાબો આ જ અંકમાં અન્યત્ર આપેલા છે.)



ગોમસ ગેલેરી

તમારા ફેવરિટ ફિલ્મી પાત્રોને ઓળખો



ભાવના એ. જીવેરી



પિકચરના પાત્રો
આપેલા છે. તેના
પરથી તે પિકચરનું
નામ ઓળખી
બતાવો.

(જવાબો આ જ અંકમાં
અન્યત્ર આપેલા છે.)

ભૂલાયો ટપાલી (ગંગલ)

છું છલોછલ તોય ખાતી; એ જ છે જાહોજવાલી!
યાદ તો કાણી મશક છે — ને સ્મરણ તારું પખાલી!
ખેકતું અત્તર : પવન છે; રૂ બની ગૈ મારી ચાલી!
ઓરડો શોધે યુવાની — થાકની પીધી મેં ખાલી!
રોજ કાગળ લાવતો'તો; એ જ ભૂલાયો ટપાલી.

રમેશ પટેલ, લેખક-કવિશ્રી — સુરત
મો. ૯૮૨૫૧ ૦૦૨૫૫

માણસ

છંદ બંધારણ : ગાગા, ગાગા, ગાગા, ગાગા, ગાગા
રસ્તા વચ્ચે અટવાયો છે,
માણસ આજે રઘવાયો છે.
મારીના વાસણ તૂટ્યાં છે—
માણસ માણસ ટકરાયો છે!
શેરી શેરી અફવાઓ છે,
સમજું માણસ ભરમાયો છે.
કરવત-શી વાળી ટોળાની,
માણસ કેવો વહેરાયો છે.
શોધે પડછાયો વૃક્ષોને—
ટદુકો આજે ખોવાયો છે
અજવાળાએ પીધું જાકળ;
સૂરજ ભીનો ઢોળાયો છે.
મ્હોરાં પહેરી ફરતો માણસ—
માણસ કોને સમજાયો છે?

રમેશ પટેલ, લેખક-કવિશ્રી — સુરત • મો. ૯૮૨૫૧ ૦૦૨૫૫

આ વાત છે

છંદ બંધારણ : લગાલગા, લગાલગા, લગાલગા, લગાલગા
ન તાજની, ન તાજની, ન રાજની આ વાત છે,
કે ભીતરેથી આવતા અવાજની આ વાત છે.
આ કાણ્ણિયા, રદીફ કે બહર તો એની એ જ છે,
વિચાર સાવ છે અલગ, મિજાજની આ વાત છે.
છે દર્દ વિશ્વમાં ઘણા, મલમ ન કામ લાગતા,
અગમથી આવનાર એ હીલાજની આ વાત છે.
ન તાર હો અલગ-થલગ, ન સૂર પણ પડે જુદા,
બધે જ પ્રેમના સતત રિયાજની આ વાત છે.
ફળો લગાર ડાળખીએ લાગતાં નમી પડે,
પછે તમામ વૃક્ષ તે નમાજની આ વાત છે!
સમંદરી તુફાન કે ન વાંક છે તરંગનો,
જઈ કિનારે દૂષતા જહાજની આ વાત છે.
આનિદ ભક્ત, લેખક-કવિશ્રી — હિંમતનગર

દેખાય છે

છંદ બંધારણ : ગાલગાગા, ગાલગાગા, ગાલગા
રાત કાળી ને તમસ દેખાય છે,
જિંદગી આખી બેબસ દેખાય છે.
ભાવ વિનાના થયા ભોજન હવે,
સ્વાદમાં ના રસ કે કસ દેખાય છે!
ખૂબ ઉંચી તેં ચણી હિમારતો,
પણ મને કેવળ ફરસ દેખાય છે!
એક બાળક કરતાં બુદ્ધિ ક્યાં વધુ છે,
વય જોતાં જાંન વરસ દેખાય છે.
સંત દેખાવા વધારી દાટી, પણ;
આચરણમાં તો તમસ દેખાય છે!
કોઈમાં ક્યાં ઘાસ સંતોષાઈ પૂરી,
રોજ એની એ તરસ દેખાય છે!
મિલકતે જુદા કર્યા બે ભાઈઓ,
કોઈમાં લાંબી લડત દેખાય છે!
અંધશ્રદ્ધામાં આ મન ભટકી રહ્યું,
દંભી ગુરુમાં જો સચ દેખાય છે!
સુખી માણસનું પહેરણ ના મળ્યું,
તેથી દુઃખી સૌ માણસ દેખાય છે!

ચંદ્રકાંત પટેલ 'સરલ', લેખક-કવિશ્રી — માણાવદર
મો. ૯૯૩૫૮૦૨૪૨૮

ગીત

છંદ બંધારણ : ગાલગાગા, ગાલગાગા
પૂરવા પંખી, નવું પિંજર હશે,
પાંખને એ વાતનો બસ ડર હશે.
ધર મહીં વૃદ્ધા ફરે છે એકલી,
દીકરા કાજેય કીધાં કર હશે.
એ હવે ભીડમાં દેખાય ના,
એમણે વનમાં જ બાંધું ધર હશે.
ભાઈઓ વચ્ચે દીવાલો જે ચણે,
હોય ખેતર કે પછી એ જર હશે.
થાક - પીડા એક પળમાં ઓગળે,
મસ્તકે માતા તણો જ્યાં કર હશે.

દરીશ પંક્યા, લેખક-કવિશ્રી — ભાવનગર
મો. ૯૮૮૮૮ ૦૭૬૨૭

પ્રભુ! પ્રાર્થના હૃદયની આ મારી

ચિત્ત મારું સદ્ગુરુ ચરણે રાખજે,
પ્રભુ! પ્રાર્થના હૃદયની આ મારી.

વચન સાંભળીને સદ્ગુરુના ચિંતન કરું,
કૃપા તારી પામું ને જીવનમાં ધરું,
મારી નિષ્ઠા - મક્કમતા ટકાવજે.

પ્રભુ!

ગતિ મારી સદ્ગુરુ ચીંધ્યા રાહે વહે,
મતિ મારી સદાયે સમર્પિત રહે,
ક્ષતિ થોડી પણ થાય તો સુધારજે.

પ્રભુ!

કરું જે કંઈ કૂતિ મુજ ઉપાસના બને,
સદ્ગુરુનો બનું એવી ચાહના મને,
જન્મે જન્મે સંગાથ આ નિભાવજે.

પ્રભુ!

ડૉ. નાનુભાઈ પી. પંડ્યા, લેખક-કવિશ્રી - ભાવનગર
મો. ૯૮૨૭૫ ૫૮૦૪૩

મા જમાડે તે ગમે

છંદ બંધારણ : ગાલગાગા - ગાલગાગા - ગાલગા

કોળિયા દઈ મા જમાડે તે ગમે,
ને પછી ખોળે રમાડે તે ગમે.

વાવવું તે આપણી મહેનત ગણો,
તે પછી ઈશ્વર ઉગાડે તે ગમે.

વહાલ વરસાદી બની વરસે ધણું,
એટલે સૂરજ દંડાડે તે ગમે.

જેમણે કીધું હતું કે સૂર્ય જા,
એ જ આવીને જગાડે તે ગમે.

એમ પકડાવું નથી જલદી કંઈ,
એ ભલે આમ જ રમાડે તે ગમે.

છે ભળી જાવું ધરાની ધૂળમાં,
છેવટે એમાં સુવાડે તે ગમે.

એ વિના રહેતો અજીંપો અંતરે—
ને ગજલ હો જે દહાડે તે ગમે.

ડૉ. નાનુભાઈ પંડ્યા, લેખક-કવિશ્રી - ભાવનગર
મો. ૯૮૨૭૫ ૫૮૦૪૩

પ્રતીક

અકારણ તો નહીં જ હોય આ લગ્નના રિવાજો
તેની પાછળ પણ હોતા હશે કંઈક કારણ.

કદાચ રિંગની અદલાબદલી હોતી હશે પ્રતીક,
જે રીતે રિંગ થતી એકબીજાની આંગળીમાં એડજસ્ટ
તે રીતે પોતે પણ થશે એકબીજાની જિંદગીમાં એડજસ્ટ. અકારણ....

કદાચ વરમાળાની અદલાબદલી હોતી હશે પ્રતીક,
એકબીજાનું સદા સન્માન કરવાની,

સાચા અર્થમાં એકબીજાના બેટરહાફ બનવાની. અકારણ....

કદાચ હસ્તમેળાપ હોતું હશે પ્રતીક

જીવનની દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું,

સાચા અર્થમાં એકબીજાના સોલમેટ બનવાનું. અકારણ....

કદાચ ગાઠબંધન હોતું હશે પ્રતીક,
એકબીજાને સ્વતંત્રતા આપીને પણ એકબીજાની સાથે જોડાયેલા રહેવાનું

અસ્તિત્વની અલગ ઓળખ છતાં એક અસ્તિત્વ બનીને રહેવાનું
અકારણ....

કદાચ મંગળસૂત્ર હોતું હશે પ્રતીક

સદા પત્નીનું માન સન્માનનું રક્ષણ કરવાનું

સદા પત્નીની પડ્યે ઊભા રહેવાનું. અકારણ....

કદાચ સિંદુર હોતું હશે પ્રતીક,

સદા પ્રેમ કરતા રહેવાનું

દરેક પરિસ્થિતિમાં ચાહતા રહેવાનું. અકારણ....

કદાચ સમપદીના વચનો હોતા હશે પ્રતીક,

કે આ વચનો માત્ર બોલવાના નથી,

પણ આ વચનો છે જિંદગીભર નિભાવવાના. અકારણ....

જગૃતિ દશા “જાનકી” - મોરલી

મો. ૯૮૨૪૨ ૧૫૦૪૦

તથા

વિના શ્રમે મળેલાની કિંમત કરાતી નથી
પરસેવાથી મેળવેલાની કિંમત કરાતી નથી.

જેની કિંમત ન હોય તેનું મૂલ્ય અમૂલ્ય છે,
જે અમૂલ્ય હોય તેની કિંમત કરાતી નથી.

વૃક્ષ કેરા આધારે પાંગરતી હોય છે વેલી,
ટેકો આપનારની અવગણના કરાતી નથી.

બદલા ઉપકારના આપી ઝાંણ ચૂકવાય નહીં,
એવું કરનારાની ગણના ક્યાંય કરાતી નથી.

પ્રભુએ આપ્યું હોય છે ધણું ધણું આપણને,
ક્યારેક કેંક ગુમાવતા ફરિયાદ કરાતી નથી.

જસમીન દેસાઈ ‘દપણ’ - રાજકોટ

મો. ૯૮૨૮૩ ૪૬૮૭૨

મહત્વની માહિતી

દેશ વિદેશનું અવનવું

- એશિયાનો એક જ દેશ થાઈલેન્ડ એવો છે કે જ્યાં કદ્દી પશ્ચિમી સત્તા નહોતી.
- ઈ.સ. ૧૬૩૧માં છપાયેલા એક બાઈબલમાં સેવનથી કમાન્ડમેન્ટમાં ‘કદ્દી દૂરાચાર કરીશ નહીં’ વાક્યમાં ભૂલથી ‘નહીં’ છાપવાનું રહી ગયેલું. આ બાઈબલ આજે પણ ‘વિકેર’ એટલે કે ખરાબ બાઈબલ તરીકે જાણીતું છે.
- સૌથી ટૂંકું યુદ્ધ ઈ.સ. ૧૮૮૫માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે લડાયેલું. માત્ર ઢા મિનિટમાં જ ઝાંઝીબારે શરણાગતિ સ્વીકારેલી.
- અમેરિકાએ અલાસ્કા વિસ્તાર રશિયા પાસેથી વેચાતો લીધેલો અને એક એકરના બે સેન્ટ યૂકવેલા.
- ફિનલેન્ડ સૌથી વધુ તળાવ ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૧,૮૭,૮૮૮ તળાવ છે. તમામ ૫૦૦ ચોરસ મીટરના છે. કેનેડામાં પણ બે લાખ કરતાં વધુ તળાવ છે. તળાવની વ્યાઘ્યા ગુંચવણાભરી હોવાથી સૌથી વધુ તળાવ ધરાવતા દેશનું બિરુદ્ધ વિવાદાસ્પદ છે.
- બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનું ખુલ્લિયમ છે. તેમાં જાતજાતના સ્ટ્રોબેરી, તેની વાનગીઓ અને સ્ટ્રોબેરીના બગીચાનું મધ્ય પણ જોવા મળે છે.
- શ્રીસનું હવામાન એટલું શાંત છે કે ત્યાં મોટાભાગના થિયેટરો ઓપન એર હોય છે.
- અમેરિકામાં વર્ષે લગભગ એક લાખ વાવાજોડા થાય છે. તેમાંના દસ ટકા વાવાજોડા ગંભીર મનાય છે.

ગતિના નિયમ

જગત આખુ ગતિમય છે. પરંતુ દરેક ગતિ કેટલાક નિયમોને આધીન છે. આજથી ચારસો વર્ષ પહેલા વિખ્યાત વિજ્ઞાની આઈએક ન્યુટને આ નિયમો શોધી કાઢ્યા હતા. ઈ.સ. ૧૮૮૮માં ન્યુટને ૨૪૪ કરેલા આ ગ્રાણ નિયમો આજે વિમાન ઉડાવવામાં પણ મદદરૂપ થાય છે.

નિયમ પહેલો : કોઈપણ વસ્તુને કોઈ બળ કે અવરોધ લાગે નહીં ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો હંમેશાં ગતિમાન રહે છે. આપણે પથ્થરને ઊંચીઓ નહીં ત્યાં સુધી જમીન પર સ્થિર રહે છે અને ફેંકેલા પથ્થરને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બેંચે છે. એટલે તેની ગતિ અટકીને તે જમીન પર પડે છે.

નિયમ બીજો : કોઈપણ ગતિમાન પદાર્થની ગતિનું પ્રમાણ અને દિશા તેને લાગેલા બળના પ્રમાણમાં જ હોય છે. આપણે કોઈ વસ્તુને ધકેલીએ ત્યારે તે આપણે ધક્કો માર્યો હોય તે જ દિશામાં બસે છે અને ખસવાની ગતિ તેને લાગેલા બળ જેટલી જ હોય છે.

નિયમ ત્રીજો : કોઈ ગતિમાન પદાર્થ તેની ગતિની વિરુદ્ધ દિશામાં તેટલું જ બળ પેદા કરે છે. બંદૂકની ગોળી બંદૂકમાંથી છૂટે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. જેટ વિમાન આ નિયમને આધારે જ ગતિમાં રહે છે.

ઇલેક્ટ્રિકમાં ટ્રાન્સફોર્મર શું છે?

ઇલેક્ટ્રિક વડે ચાલતાં વિવિધ સાધનોમાં જુદી જુદી માત્રાનો વીજપ્રવાહ વપરાય છે. આપણા ધરમાં કે ઓફિસમાં આવતો વીજપ્રવાહ અતિશય શક્તિશાળી હોય છે. ટી.વી., ફિઝ, ઈલ્યુ, માઈકોવેવ વગેરેને વિવિધ માત્રાના પ્રવાહ જોઈએ. વળી પાવર હાઉસમાં ઉત્પન્ન થતી વીજળીને જુદા જુદા વિસ્તારોમાં અનુકૂળ માત્રા કરીને મોકલવી પડે. આ માટે ટ્રાન્સફોર્મર ઉપયોગી થાય છે. ટ્રાન્સફોર્મર એટલે રૂપાંતરિત કરતું સાધન. ટ્રાન્સફોર્મર વિના આપણે વીજળીનો ઉપયોગ કરી શકીએ નહીં. કેટલાક સાધનોમાં ટ્રાન્સફોર્મર હોય છે તે જરૂર પૂરતો વીજપ્રવાહ મેળવે છે.

ટ્રાન્સફોર્મરની શોધ માઇકલ ફેરાડેએ કરી હતી. તારના ગુંચળામાંથી વીજપ્રવાહ પસાર થાય ત્યારે તેને અવરોધ ઊભો થાય છે. આ અવરોધ કોઈલ કે ગુંચળામાં રહેલા તારની સંખ્યા અને જાડાઈ ઉપર આધારિત છે.

વીજ પુરવઠા માટેની વીજ લાઈનમાં ઘણા સ્થળોએ ટ્રાન્સફોર્મર મૂકેલા જોવા મળે છે. ટ્રાન્સફોર્મર ફેરાડેસ લો ઓફ ઇલેક્ટ્રોમેન્ટિક ઇન્ડક્શનના નિયમના આધારે કામ કરે છે. ગુંચળામાં વીજપ્રવાહ વહે ત્યારે તેની આસપાસ બીજું ઇલેક્ટ્રિક ફિલ રચાય છે. આ ફિલ બીજા ગુંચળાના સંપર્કમાં આવે તે ગુંચળામાં ઓછી માત્રાનો વીજપ્રવાહ પેદા કરે છે. ટ્રાન્સફોર્મરમાં નજીક નજીક રહે તેવી બે કોઈલ હોય છે. ટ્રાન્સફોર્મરમાં સિંગલ ફેઝ, દુફેઝ, શ્રી ફેઝ ઉપરાંત વિવિધ સાધનોમાં ઉપયોગ માટે અનેક પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. **મોબાઇલના ચાર્જરમાં પણ ટ્રાન્સફોર્મર હોય છે.** તે પાવર ઓછો કરવા ઉપરાંત પાવરને એ.સી. માંથી ડી.સી.માં પણ ફેરાવે છે. ટ્રાન્સફોર્મરનો સૌથી મોટો ઉપયોગ લાઉડ સ્પીકરમાં થાય છે.

સુખ અને હુદાયા બહુ તરફાવત નથી.
જેને મન સ્વીકારે તે સુખ અને અસ્વીકારે તે હુદા.

મહાત્વની માહિતી
વિશ્વનો અતભ્ય ગણતરી ચંત્ર

(ગતાંકથી ચાલુ)

- ત્રણ નાડી : ઈડા, પીંગા, સુષુભ્ના
- ત્રણ સંધ્યા : પ્રાતઃ, મધ્યાಹ્ન, સાંય
- ત્રણ શક્તિ : ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, કિયા શક્તિ
- ચાર ધામ : બદ્રીનાથ, જગભાથ પુરી, રામેશ્વરમુ, દ્વારકા.
- ચાર મુનિ : સનત, સનાતન, સનંદ, સનત કુમાર
- ચાર વર્ષ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર
- ચાર નીતિ : સામ, દામ, દંડ, ભેદ
- ચાર વેદ : સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ
- ચાર સ્ત્રી : માતા, પત્ની, બહેન, પુરી
- ચાર યુગ : સત્યયુગ, ત્રૈત્યયુગ, દ્વાપર યુગ, કળીયુગ
- ચાર સમય : સવાર, સાંજ, દિવસ, રાત
- ચાર અષ્ટારા : ઉર્વશી, રંભા, મેનકા, તિલોતમા
- ચાર ગુરુ : માતા, પિતા, શિક્ષક, આધ્યાત્મિક ગુરુ
- ચાર પ્રાણી : જળચર, થળચર, નભચર, ઉભયચર
- ચાર જીવ : અંડજ, પિંડજ, સ્વેદજ, ઉદ્ધિભજ
- ચાર વાણી : ઓમકાર, અકાર, ઉકાર, મકાર
- ચાર આશ્રમ : બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
- ચાર ભોજ્ય : ખાદ્ય, પેય, લેખા, ચોષ્ય
- ચાર પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ
- ચાર વાદ્ય : તત્ત્વ, સુષ્ઠિર, અવનદ્રવ, ધન
- પાંચ તત્ત્વ : પૃથ્વી, આકાશ, અભિન, જલ, વાયુ
- પાંચ દેવતા : ગણેશ, હુર્મિ, વિષ્ણુ, શંકર, સૂર્ય
- પાંચ જ્ઞાનેન્દ્રિય : આંખ, નાક, કાન, જીબ, ત્વચા
- પાંચ કર્મ : રસ, રૂપ, ગંધ, સ્પર્શ, ધ્વનિ
- પાંચ અંગાળી : અંગુઠો, તર્જની, મદ્યમા, અનામિકા, કનિષ્ઠા
- પાંચ પૂજા ઉપયાર : ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નેવેદ્ય
- પાંચ અમૃત : ધૂપ, દહીં, ધી, મધ, સાકર
- પાંચ પ્રેત : ભૂત, પીશાચ, વેતાલ, કુભાડ, બ્રહ્મ રાક્ષસ
- પાંચ સ્વાદ : મીઠો, ચર્ચા, ખાટો, તીખો, કડવો
- પાંચ વાયુ : પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન
- પાંચ વર્તવૃક્ષ : સિધ્ધવટ (ઉજ્જૈન), અક્ષયવટ (પ્રયાગરાજ), બોધિવટ (બોધગયા), વંશીવટ (વંદાવન), સાક્ષીવટ (ગયા)

- પાંચ પતા : આમ, પીપળો, બરગદ, ગુલર, અશોક
- પાંચ કન્યા : અહિલ્યા, તારા, મંદોદરી, કુતી, દ્રૌપદી
- છ અથુ : શીત, ગ્રીઘ, વર્ષા, શરદ, વસંત, શિશિર
- છ જ્ઞાનના અંગો : શિક્ષા, કલ્ય, વ્યાકરણ, નિર્દૂક્તા, છંદ, જ્યોતિષ
- છ કર્મ : દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ્ય, દાન
- છ દોષ : કામ, કોષ, મદ (ઘમંડ), લોભ (લાલચ), મોહ, આળસ
(કમશા:)

જ્વાત જનની સ્ત્રી.... નારી તું નારાયણી....

શું આ બધા Tagની સ્ત્રીને ખરેખર જરૂર છે? છોકરીઓને જ્યારે પહેલીવાર menstrual cycle (મેન્સ્ટ્રુઅલ સાઈકલ) ચાલુ થાય ત્યારે એક રમતિયાળ અને ચંચળ છોકરીમાંથી સ્ત્રી બનવાની સફર એટલે પહેલી ભીની લાગણી. પોતીકા ઘરેથી પારકાના ઘરે જઈને પોતીનું બનાવવાની સફર પણ એક અનોખી લાગણી છે. ઉદરમાં રહેલા ગર્ભને નવ મહિના રાખીને રાતોરાત માતા બની ઉત્તમ પ્રકારની ફરજ નિભાવવાની હોય છે. આ રીતે જીવનની સફર તબક્કાવાર આગળ વધે છે.

શું આ જ આપણા બધાના જીવનની સમાનતા નથી? તો પછી શા માટે તે કહેવા ચીસો પાડવી પડે, આંદોલન તથા નારા લગાવવા પડે? સમાન હક્ક અને સમાન હોક્કો માંગવો પડે? કદાચ આપણે આ બધાથી ઉપર છીએ.

આખો દિવસ કામ કરીએ અને સાંજે સ્વજનોની એક મીઠી મુસ્કાન “Thank You” કહેવા! બાળક દોડીને Hug કરીને કહે, ‘મા, I love you. You are the best Mom in this World.’ તે ઉપરાંત Husbandના એક હુંફણા સ્પર્શ સાથે જ્યારે એટલું કહેવાય કે, ‘હું તારી સાથે હું.’ એ જ આપણને એક સંપૂર્જ્ઞ સ્ત્રી હોવાનો અહેસાસ કરાવે છે.

બાકી દરેક સ્ત્રીમાં એટલું બધું Potential છે કે Defence Astronates થી લઈને Politics, Entrepreneurship અને Entertainment સુધી દરેક ક્ષેત્રમાં સ્ત્રી સફળ જ રહી છે. હું દરેક સ્ત્રીને એટલું કહીશ કે પુરુષથી ચિહ્નાતી બનવાની દોડ કરવા કરતા, પુરુષ સાથે ચાલવાની વધારે મજા છે. કેમકે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી જ તો રહેલી છે.

Happy woman's day to all lovely ladies.

જગ્યાતિ ચંદ્રશીલ મહેતા - અમદાવાદ
અ-૧૧૦૮, પાંચ કક્ષાનિયા, છસ્કોન - આંબલી રોડ,
આંબલી, અમદાવાદ-૩૮૦ ૦૪૮.
મો. ૯૮૦૮૮ ૬૦૦૬૮

૪૧

જેના આંખના તારા સમાન
અમે બે અનમોલ રતન
એટલે હું અને મારી બહેન.
યાદ રહે એ વ્હાલ, એ ટેમ
જ્યારે મારી બા વરસાવતી પ્રેમ.
મીના ભીના થઈ જતા અંતર અમારા
મનના મંદિરમાં આવીને વસતી અમારા.
ખબર જ ન રહી ક્યારે ચાલી ગઈ
બસ મુકૃતી ગઈ એ યાદોની લકીર...
એ યાદોની લકીર...

કહેવાય છે કે વડલા વગરના ઘરની કલ્પના કરવી અશક્ય છે. વડીલ, એ તો ઘરના આધારસ્તંભ, નીંવ સમાન છે, જે ઝતુઓ પ્રમાણે શીતળતા, હુંક બંને આપતા રહે છે. ‘મારી બા’ એ શાદ બોલતા જ વહાલ ઉભરાય, વાત્સલ્ય દેખાય. પણ આજે એ શાદ લુમ થઈ રહ્યો છે. અથવા એમ કહી શકાય કે મોર્ડન શબ્દોએ તેનું સ્થાન લઈ લીધું છે. કદાચ ‘લાગણી’ તો એ જ અકંબંધ રહેશે પણ તેનો ભાવાર્થ, તેના સંદર્ભ પ્રમાણે બદલાતો રહેશે.

‘બા’ વડલા સમાન - વડીલ જેની હાજરીમાં આખુંય ઘર નાચી ઉઠ્યું. ઘરના સદસ્યોની જિંદગી તેમની આસપાસ ફરતી. અથવા એમ કહીએ ‘બા’ની જિંદગી ઘરના પરિવારના સદસ્યોની આસપાસ ફરતી. ક્યારેય પણ પોતાના અસ્તિત્વથી અલગ એ વિચારતી નહીં.

આજે પણ આવા ‘બા-બાપુજી’ (દાદા-દાદી) આપણી આસપાસ હશે, જેમને આપણી ચિંતા હશે, આપણી કાળજી હશે પણ કદાચ એ આપણી નજરમાં નહીં આવતા હોય અથવા આપણે તેમની નજરમાં નહીં લાવતા હોઈએ. આવતી પેઢી માટે કદાચ આ શાદ સાચે આ ‘સંબંધ’ વિસ્મૃત થઈ જશે. આ લુમ થતા ‘સંબંધ’ અને શાદને સાચવવાની સાવયેતી આપણા પછીની પેઢી માટે સન્માર્ગદર્શન બની રહે તે માટે આજે આપણે આ ‘સંબંધ’ને સંજોગોને રાખવા હિતાવહ છે.

આપણે ‘વુમન્સ તે’ – ‘મધ્યસ તે’ આવા કેટલાય ‘દિવસો’ની સારી રીતે ઉજવણી કરીએ છીએ પણ કદાચ એ ‘વુમન’ના ભાગરૂપે આવતાં સંબંધોના સર્વનામોને ભૂલી જઈએ છીએ અથવા યાદ રાખવા જેવા લાગતા નથી અથવા તો તેની મહત્તમ અને ગરિમા આપણે સમજ્યા નથી. આ સંબંધોના સર્વનામો જેવા કે બા, મા, પત્ની, બહેન, ભાલી, ફોઈ, કાકી, મામી, નાની વગેરે વગેરે. પણ આજે આ સંઘળાય સંબંધો માટે એક જ શાદ વપરાય છે અથવા એક જ લાગણીમાં વ્યક્ત કરતા હોઈએ છીએ જે ઘણું કન્ફ્યુઝિંગ લાગે છે. જરાક વિચારીએ....

ડૉ. મેહા સંઘવી - મુજ
મો. ૧૪૨૮૨ ૨૦૩૮૬

પુસ્તક : “મુક્તકોની મહેફીલ”નું વિમોચન



પોરબંદર જિલ્લાનું
રાશાવાવ નગર એના
પાણીદાર પાણી તથા
પાણીના બોર માટે પંકાયેલ
છે. રાશાવાવ શહેરના
પાણીદાર પાણીની વાત શ્રી
અવેરયંદ મેધાણીએ તેમની
‘પરણોતર’ લોકવાતામાં વણી લિખેલી છે.

મૂળ ઘેડ વિસ્તારના મહિયારી ગામના કવિ લેખક અને રાશાવાવ શહેરમાં છેલ્લા ૩૦ વર્ષોથી સ્થિત મણિલાલ ડી. રૂધાણી ગંલ, મુક્તકો, લંઘ કથાઓ વગેરેનું છેલ્લા ૪૫ વર્ષોથી સર્જન કરે છે. તેના સર્જનમાં સીધા સાદા લોક બોલીના તળપદા શબ્દોની મીઠાશને લીધે સારી એવી લોકપ્રિયતા દાંસલ કરી છે.

આ સજકે અગાઉ સાત પુસ્તિકાઓનું પ્રકાશન કરેલ છે. તા. ૦૧-૦૩-૨૦૨૧ના રોજ તેમનું આઠમું પુસ્તક “મુક્તકોની મહેફીલ”નું વિમોચન પર્વ ખૂબ જ સાદગી અને કોરોના સંબંધી ગાઈડ લાઈન્સ મુજબ મર્યાદિત સાહિત્ય રસીકોની હાજરીમાં ઉજવાયેલ હતું.

આ નિમિત્તે સાહિત્ય રસિક સર્વ શ્રી જગદીશભાઈ આચાર્ય, બાબુભાઈ ચૌહાણ, અશોકભાઈ રાઠોડ તથા કિશોરભાઈ રાજપરાએ હાજરી આપી સર્જકને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે સર્વશ્રી બાલેન્દુ શેખર જાની - રાજકોટ, અકબરભાઈ સોરઠિયા - પોરબંદર, જીજેશભાઈ પોપટ - પોરબંદર, દિલીપભાઈ આચાર્ય, રજનીકાંતભાઈ ઓઝા, બાબુલાલ ગોર, જ્યંતીભાઈ જોશી, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ તથા સ્નેહલતાબેન નિમાવત (અમદાવાદ) એ શુભેચ્છાની વર્ષા કરી હતી.

સર્જકના મુક્તકો ભાવવાહી, ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજ ગ્રાણ પ્રકારના છે. તેના બે શેર વાચકોના દિલોછિમાગ પર ધારેલી અસર કરવામાં બહુધા સફળ થયા છે. નમુના રૂપે તેના બે શેર કાફી છે.

પારકી થાપણ છે કોઈની આ જિંદગી
નથી રહેવાની સદા ચાલી જવાની
પાનેતર ઓઠીને નહીં તો
કફન ઓઠીને ચાલી જવાની.



હોય તલબ જેને માટિરાની, એ “દીવ” સુધી જાય છે
કદમ અમારા તો દોસ્તો, ‘સોમનાથ’ અટકી જાય છે.

ભુજની લાલન કોલેજના સ્ટાર વિદ્યાર્થી અને જાહીતા સેવાભાવી ડૉ. કનુભાઈ ગણાગાનું નિધન



આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા ધર્મિક ક્ષેત્રે અહનીશ લોકસેવા પ્રદાન કરનાર ડૉ. કનુભાઈ જેરામભાઈ ગણાગાનું ૮૩ વર્ષની વયે ટૂંકી બીમારીમાં નિધન થતાં કચ્છમાં અતિ શોકની લાગડી ફેલાઈ જવા પામી છે. તેઓ પોતાની પાછળ જાહીતા સ્વીરોગ ચિકિત્સક પત્ની ડૉ. દમયંતીબેન ગણાગા, આઈ સર્જન પુત્ર ડૉ. સત્યમ ગણાગા, તેમના પત્ની ડૉ. રીતિકા, પૌત્ર પ્રિયાંશ અને પુત્રી ડૉ. કૃપાલી, દોહિત્ર મર્મને વિલાપ કરતા છોડી ગયા છે.

ડૉ. કનુભાઈનો જન્મ કરાંચીમાં તા. ૪-૫-૧૯૮૮ના રોજ થયેલો. તેમના પિતાશ્રી જેરામભાઈ ગણાગા અગ્રણી રોટેરિયન હતા. વર્ષો જૂની ગણાગા ટ્રાન્સપોર્ટ તેમના નામથી પ્રસિદ્ધ છે. કનુભાઈએ ભુજમાં શિક્ષણ મેળવ્યું. લાલન કોલેજમાં ૧૯૮૬-૮૭માં સ્પોર્ટ્સ સેકેટરી હતા. વર્ષો લગ્ની તરણ મિત્ર મંડળના કન્વીનરપદે રહ્યા. આંખના રોગોના ઉપયાર માટે તેઓ વધુ શિક્ષણ પ્રામ કરવા યુરોપ, અમેરિકામાં અભ્યાસ અર્થે ગયા. ત્યાં ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરી, ભુજના હોસ્પિટલ રોડ પર ગણાગા હોસ્પિટલ ખાતે કાર્યરત રહ્યા.

વિદેશોમાં અભ્યાસ દરમિયાન યુનિ. ઓફ એમસ્ટરડમ - હોલેન્ડમાં લેક્યરર તરીકે સેવા આપી, અમેરિકાની મેડિકલ સોસાયટીમાં ફ્લોશિપ મેળવી. ઓસ્ટ્રેલિયન મેડિકલ સોસાયટીમાં ફ્લોશિપ તથા ગ્રાજ (ઓસ્ટ્રેલિયા)માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશનનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું. બે વખત વિશ્વભ્રમણ પણ કર્યું. બેલ્યુન્નમાં આંતરરાષ્ટ્રીય પોસ્ટ ગ્રેજ્યુઅટ મેડિકલ સ્ટુડન્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટપદે રહેલા. ગુજરાત રાજ્યના આઈ.એમ.એ.ના કારોબારી સમિતિના મેમ્બર રહેલા. ઓનરરી ઓધેલોલોજિસ્ટ તરીકે આદિપુરની ડિવાઈન લાઈફ સોસાયટી, જનકલ્યાણ મંડળ - કોડારા, મસ્કા ટી.બી. હોસ્પિટલ આદિમાં તેઓ સેવા આપતા હતા.

ભુજમાં ‘સત્યમ કનુભાઈ ગણાગા’ આઈ.એમ.એ. હાઉસ માટે તેઓશ્રીએ રૂપિયા અઢી લાખનું દાન પ્રદાન કર્યું છે. ગુજરાત રાજ્યમાં આંખ તથા સ્વીરોગ નિષ્ણાતો માટે પ્રતિવર્ષ એક ટ્રોઝી અર્પણ કરી છે.

તાજેતરમાં જ અયોધ્યા મંદિર નિર્માણ ક્ષેત્રે ડૉ. કનુભાઈ ગણાગાને રૂ. ૨૫,૦૦૦/- (રૂપિયા પચ્ચીસ હજાર) અને

ભુજના લોહાણ મહાજનને શિક્ષણ તથા આરોગ્યની સુવિધા અર્થે રૂ. ૨૧,૦૦,૦૦૦/- (રૂપિયા એકવીસ લાખ)નું માતબર દાન આપી એક ઉમદા કાર્ય કર્યું છે. ડૉ. કૃષ્ણકાંત અર્થાત્ કનુભાઈ ગણાગા તરફથી કચ્છ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને છેલ્લા ગ્રાં વર્ષથી સુવર્ણ ચંદ્રક પ્રદાન કરવામાં આવી રહ્યો છે.

સામાજિક ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ સેવાનું પ્રદાન કરનારના પુષ્ય આત્માની શાંતિ માટે અનેક સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન થયું હતું.

જ્ઞાત : પ્રા. મૂર્યકાંત ભટ - ભુજ
મો. ૯૮૨૪૮ ૩૪૩૪૬

કચ્છ રામાણિયા ખાતે ગૌરક્ષક ગીતાબેન રાંભિયાના સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું

ગૌરક્ષક ગીતાબેન રાંભિયાના માદરે વતન ગામ રામાણિયા - કચ્છમાં તેમનું એક સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું અનાવરણ તા. ૨૪-૨-૨૦૨૧ના રોજ મુનિવર શ્રી વિદ્યાચંદ્ર મ.સા.ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો, સરપંચ તથા રામાણિયા ગામજનો મોટી સંઘ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



સંસ્થા દ્વારા કોરોના મહામારી દરમિયાન પણ જીવદ્યા તથા માનવસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં છેલ્લા એક વરસ દરમિયાન ૪૦૦થી વધુ પણુ-પક્ષીઓની સારવાર તથા ઉપોથી વધુ અભોલ જીવોને કતલખાનેથી અભ્યાસન અપાવવામાં આવેલ છે. તે ઉપરાંત, બહારગામથી આવતા ૪૦થી વધુ બીમાર દર્દીઓને અમદાવાદ ખાતે સારવાર અપાવવામાં આ સંસ્થા સહાયરૂપ થઈ છે, એમ તે સંસ્થાની એક પ્રેસનોટમાં જગ્યાવાયું છે.

**પામવું અને ખોવું એ જીવનની રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે.**

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોગ ટીચરનું સન્માન



'મંગલ મંદિર' સામયિકમાં ગેમ્સ ગેલેરી વિભાગના

સંકલનકર્તા સુશ્રી ભાવના એ. જવેરીનું (હાથમાં ફ્લાવર બુકે) ભુજ ખાતેના યોગ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રેષ્ઠ યોગ ટીચર તરીકે ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.

ફળશુદ્ધિ

હું જો એક હદયને તૂટું બચાવી શકું
તો મારું જીવન વર્થ નહીં જાય.

હું કોઈનું દર્દ મિટાવી શકું અથવા
ઘટાડી શકું તો મારું જીવન સાર્થક થશે.

હું કોઈ એકાકી મનુષ્યના મુરજાયેલા મનને
આનંદથી ગ્રહુલિત કરી શકું
એ જ તો છે મારા અસ્તિત્વની ફળશુદ્ધિ!

- એમિલી ડિક્નિસન

ધરતી પરનું સ્વર્ગ

મા-બાપે સંતાનોનું બુદ્ધિથી પૃથક્કરણ કર્યું નથી, પણ તેઓ માત્ર હદયથી પ્રેમ આપીને સંતાનોને મોટા કરે છે. તો સંતાનોએ પણ પોતાની નૈતિક ફરજો અદા કરતાં વડીલોને હદયથી જોવા જોઈએ, બુદ્ધિથી નહીં.

હદય

- હદય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે.
- હદય બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે.
- હદય પાસે સમાધાનની કળા છે.
(Art of Compromise)
- હદય પોતાની ફરજનો વિચાર કરે છે.
- હદય પાસે લાગણી છે.
- હદય હંમેશાં પોતાની ભૂલ જુએ છે.
- હદય માં કૃતજ્ઞતા છે. એટલે બીજાના ઉપકારોને યાદ કરી નાખ અને પરોપકાર કરવા તત્પર બને છે.
- હદય સંવેદનશીલ છે.
- હદય ભાષા છે. સારું, ગમશે, ફાવશે, ઓ.કે., તહત્તિ.
- હદય બીજાની ભૂલને માફ કરે છે.
- હદય બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર આક્ષેપ કરતું નથી. અને પોતાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિની જરૂર તપાસ કરે છે.
- હદય મનઃસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે.

બુદ્ધિ

- બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે.
- બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે.
- બુદ્ધિ ધાર્યું ન થતાં સંઘર્ષ કરે છે.
- બુદ્ધિ પોતાના અધિકારનો વિચાર કરે છે.
- બુદ્ધિ પાસે માંગણી છે.
- બુદ્ધિ હંમેશાં બીજાની ભૂલ જુએ છે.
- બુદ્ધિમાં અહંકાર છે. એટલે પોતે બીજા ઉપર કરેલા ઉપકારોને સતત યાદ કરે છે. અક્કડતા, એ શબની પહેચાન છે.
- બુદ્ધિ કઠોર છે.
- બુદ્ધિ ભાષા છે. How? Why? આ હું નહીં ચલાવી લઉં.
- બુદ્ધિ બીજાની ભૂલને સજા કરે છે.
- બુદ્ધિ બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર જલ્દી આક્ષેપ કરે છે અને પોતાની ભૂલને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે.
- બુદ્ધિ પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે.

સાભાર : "યોગાટેના આજવાળા"

સંકલન : ચંદ્રકાંત દામગુ શાહ (ક.ડી. શાહ) - અમદાવાદ

આંજો કાગર

“મંગલ મંદિર”

આંજો કાગર – પ્રતિભાવ.... ખૂબ ખૂબ આભાર

“મંગલ મંદિર” મુખ્યપત્રના દરેક ક્ષેત્રે તાજેતરમાં આમુલ પરિવર્તન થતાં અને તેમાં પ્રકાશિત થતી લેખન-સામગ્રી શ્રેષ્ઠ કક્ષાની હોવાથી વાચકવર્ગ દ્વારા તેની પ્રશંસા કરતા અનેક પ્રતિભાવો સતત મળતા રહે છે. તે દરેક પત્રોને એક સમયે “આંજો કાગર” વિભાગમાં સ્થાન આપવાનું શક્ય નથી. તે માટે ક્ષમાપ્રાથી છીએ.

સામયિકની તારીફની સાથે તેમાં વર્તાવી ઉણાપ તરફ પણ ધ્યાન દોરવામાં આવશે, તો તેવી પ્રતિક્રિયા વધારે ઉપયોગી થશે. અમે વારંવાર જગ્ઘાવ્યું છે કે પ્રશંસાની પૃષ્ઠ ભૂમિકામાં લેખન-સામગ્રીઓના સર્જકો અને વાચકવર્ગ જ કોઈપણ સામયિકની અસલ તાકાત છે. એટલે ‘મંગલ મંદિર’ની પ્રશંસાના ખરા અધિકારી તેઓ છે.

પ્રતિભાવો માટે અમે દરેકના ખૂબ ખૂબ આભારી છીએ.

- દાખી મંડળ

‘મંગલ મંદિર’ની નવી કોલમ કાયમ આપતા રહેશે

આપના સમાજના મુખ્યપત્ર ‘મંગલ મંદિર’માં “દિલની જબાન” કોલમ નિયમિત વાંચીને હર્ષ થાય છે. ચંદ્રકાંત પટેલ સાહેબ મોટા ગજાના સાહિત્યકાર છે. અમે ઘણા મેગેજિનોમાં તેમના રસમદ લેખો વાંચીએ છીએ. ‘મંગલ મંદિર’ની આ કોલમ અમારા જેવા નવા અને ઉગતા સાહિત્યકારોને ખૂબ જ માર્ગદર્શક બની રહી છે.

મેગેજિનમાં આવતી કવિતાઓમાં જે ગા-ગા-લ જેવા છંદ બંધારણના ચિહ્નો છે તે અમને સમજાતા નથી. આપ સમજાવશો તો વધારે જાણકારી મળશે.

માસ ફેબ્રુઆરી-૨૦૨૧ના અંકમાં રેશે પટેલનો પરિચય લેખ અતિ આસ્વાધ લાગ્યો છે. આ કોલમ ચાલુ થયા પછી અમને ‘મંગલ મંદિર’ વાંચવાની વધારે ઈચ્છાઓ જાગી છે. આ કોલમ કાયમ ચાલુ રાખવા નન્દ અરજ... વિનંતી....

ધ્યા દેસાઈ અને માધુરી શાણ - જૂનાગઢ

કોરોના મહામારીના સમય દરમિયાન વિવિધ સેવાની સરિતા વહેતી થઈ....

કોરોનાની મહામારીમાં ઘણી સંસ્થાઓ, ટ્રસ્ટો, મહિલા મંડળો, હોસ્પિટલો, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો, વોલન્ટિયર્સ વગેરે સમાજના ભાઈ-બહેનો માટે તન-મન અને ધનથી સેવાની સરિતા વહેવડાવી છે તેની વિગત અતે રજૂ કરેલ છે.

૧. શ્રી કચ્છી જૈન ફાઉન્ડેશન (વડા મહાજન)ના નેજા હેઠળ કચ્છના ૫૨-૫૨ ગામનાં મહાજનો દ્વારા પોતાના ગામના જરૂરતમંદો માટે સહાયની હાકલ થતાં, આરતી ઈન્ડસ્ટ્રીજ

વતી શ્રી ચંદ્રકાંત ગોગરી અને રાજેન્દ્ર ગોગરી સાથે કચ્છી જૈન ફાઉન્ડેશનના દાતાઓ, અધિકારીઓ, સ્ટાફ વગેરેએ હેત્થી અનેક પરિવારોને સહાય કરી - કરાવી છે. ટોટલ ૫૦૦૦ પરિવારોએ લાભ લીધેલ છે.

૨. હોસ્પિટલો - નવનીત હોસ્પિટલ દહીંસર, હીરા મોંઢી - મુલુંડ, કૃષ્ણા હોસ્પિટલ - બોરીવલી (ઈસ્ટ), સેવન હિલ્સ - અંધેરી, સાયન હોસ્પિટલ, એન્કરવાલા હોસ્પિટલ અને બિદા સર્વોદય હોસ્પિટલ - મસ્કા અને બિદા.
૩. ડૉક્ટર્સ : ડૉ. જીત અને ડૉ. હની (કપાયા/પરેલ), ડૉ. વિશન નાગડા (દુમરા), ડૉ. લહેરીકાંત (લાયજા), ડૉ. કૌશિક શાહ (માંડવી)
૪. સેવાભાવીઓ : વસંત ગલિયા (લુણી), ભારતીબેન સંગોઈ (લાયજા), ધીરજ છેડા (દ્રોપ), કીર્તિ નાગડા (કોટડા), ભારતીબેન વી. છાડવા (દ્રોપ), રસિલાબેન, છાયા કીર્તિ વોરા (નવી નાર), દક્ષાબહેન - બોરીવલી, નરેન્દ્ર કેન્ઝિયા - વડાલા, કવિતા નીલેશ કેન્ઝિયા, જિનમ રાંભિયા, પ્રહુત્લ ગાલા - નાલાસોપારા, કેતન કારાણી (દુમરા) તેમજ અન્યો.
૫. રાશન કીટના ગામો : દુમરા, નરેડી, પુનીદી, બિદા, કોડાય, મોટી ઊનડોઈ, મંજલ રેલાડિયા તેમજ અન્ય ઘણા સ્થળો.
૬. મહિલા મંડળો : કચ્છી મહિલા ફડરેશન દરેક ગામની બહેનોને નાની મોટી બીમારી, હોસ્પિટલ ખર્ચ, દવાઓની મેડિકલ સારવાર વગેરે દાનના સથવારે ઘણી સારી મદદ કરી પડ્યે રહ્યા છે.
૭. શ્રીમતી જયાબેન વિશનજ મારુ - બિદા પરિવાર તરફથી

- બિદા ગામલોકોની તેમજ અન્ય જરૂરતમંદોને આર્થિક અને મેડિકલ સહાય કરવામાં આવી છે.
૮. સંઘો - દેરાસરો : જિરાવલ્લા ઘાટકોપર, ડેંબીવલીના સંઘો, ટ્રસ્ટો, મહાજનો, મંડળો, બોરીવલીના સંઘો, બિદા મુંબઈ મહાજન તથા અન્યોએ જરૂરતમંદો માટે આર્થિક સહાય કરી છે.
૯. શ્રી ક.વી.ઓ. દેરાવાસી તથા સ્થાનકવાસી બંને મહાજનોએ કચ્છી ખબરપત્રિકા દ્વારા કોરોનાથી સાવધાન રહેવા સતત જાહેરાતો આપીને ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.
૧૦. રક્તદાન : ધીરજ રાંભિયા, તરુણ મિત્ર મંડળ, મલાડ કચ્છી જૈન યુવક સંઘ, શ્રી મહાવીર ક્રિલિનિક, શ્રી રાજસ્થાન જૈન સંઘ અને જૈન શૈતાંબર તેરાપંથી સમાજ - મલાડના નેજા હેઠળ રક્તદાનનું જબરદસ્ત આયોજન થયું હતું.
૧૧. ભીનમાલ સંઘ તથા રાજસ્થાનના અન્ય સંઘોએ જરૂરતમંદો અને કોરોનાગ્રસ્ત લોકો માટે સારી કામગીરી બજાવેલ છે.
૧૨. જે.વાય.એફ. જૈન યુથ ફોરમના નેજા હેઠળ કચ્છમાં રહી, ધર્મધ્યાનમાં મસ્ત રહો. મુંબઈની ઝાણવાળી જિંદગીથી છૂટીને કચ્છની સંસ્કૃતિ, ગામડાની મજા, વરસાદી માહોલની મજા માણ્ણો. બચપણની યાદો સાથે બેસીને યાદ કરો, હરો-ફરો અને પ્રદૂષણમુક્ત હવા માણવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવેલ. વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને આપોઆપ રૂ. ૧૭૦૦/- બેંકમાં જમા થઈ જાય અને કચ્છમાં જવું હોય તેને ચુપમાં ઓછા ખર્ચે લઈ જવાની સવલત કરવામાં આવી. સ્વમાનથી કોઈ ડેકાશે કામ (સર્વિસ) કરવું હોય તો તેનો લાભ લેવા, ઐતી કરવી હોય તો તે માટે સગવડ, કચ્છમાં બીમારી માટે ડોક્ટર, હોસ્પિટલ કે દવા ખર્ચ માટે ૧૫થી ૨૫%ની જે.વાય.એફ. એસ.પી.એમ. મિત્ર કાર્ડની સહાય - ક.વી.ઓ. હેલ્પ કાર્ડ દ્વારા થઈ. આવાસ યોજના ભારાપર, બગડા, રામાણિયામાં શરૂ થઈ રહી છે. જે.વાય.એફ.ના ટોટલ ૧૫ સૌઝન્ય દાતાઓનાં દાનથી ઉપર મુજબ યોજના સાકાર થઈ રહી છે.

દીરાવાત વી. જીનડોટવાલા - ચેમ્બર
મો. ૯૮૬૬૬ ૭૭૭૮૮

‘મંગલ મંદિર’ : સો કોઇનું મંગલ થાય
તેવી લેખન સામગ્રીઓવાળું સામયિક

જેવું નામ છે તેવું જ ‘મંગલ મંદિર’ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સૌ કોઈનું મંગલ થાય તેવી સામગ્રી સામયિકમાં પીરસાય છે અને મંદિરમાં થાય તેવો આનંદ પમાય છે. પ્રલુને ધરવામાં આવતા અશ્વકુટની જેમ વિવિધ

વિષયોની વિવિધ વાનગીઓનો થાળ લઇને ‘મંગલ મંદિર’ આવે છે અને વાચકને પ્રસાદ મળ્યાની પ્રસન્નતા અનુભવાય છે. કોઈ એક નહીં પણ તમામ વિભાગમાં તે વિભાગની યથાર્થતા પુરવાર કરતું સાહિત્ય વાંચવા મળે છે. કોઈ એક સમાજનું મુખપત્ર તેની સંકુચિતતા છોડી, વિશાળ ક્ષેત્રે વિસ્તરે તે ધન્યવાદને પાત્ર ઘટના છે. ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન તમામને.

નટુભાઈ વી. પંક્યા, લેખક-કવિશ્રી - ભાવનગર
(આયુર્વેદ વિશારદ)
મો. ૯૮૨૩૫ ૫૮૦૫૩

‘મંગલ મંદિર’ : સમગ્ર સામયિકના જુદા જુદા સ્તંભ
સુંદર વિચારોનું પ્રતિપાદન છે

મુખપત્ર ‘મંગલ મંદિર’નો અંક-૫૧૩ મળ્યો, જે અત્યંત રમણીય, રૂપકાળો અને વાંચનક્ષમ બન્યો છે. આપ સહુની સાહિત્યપ્રીતિની જહેમત અને સમાજસેવાની સુગંધ માણી. તે પહેલાં સામયિકના સહતંત્રી શ્રી સાથે ફોન પર રૂબરૂ વાત કરવાનું શક્ય બન્યું. આ બધું આ પળે વાગોળું છું.

ખુદ પ્રભુમય રહી સમાજ માટે કશું કરી છુટવાની આપની તપોભાવના ખરેખર દાદ દેવાને લાયક છે. આપ સૌ સુધી પહોંચાડવા બદલ સન્મિત્રો શ્રી ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ અને શ્રી ચંદ્રકાંત પટેલ ‘સરલ’નો પણ આભારી છું.

અનેક સક્ષમ લેખક મિત્રોના લેખ અને સુંદર સંપાદનના સાક્ષી બનવા મળ્યું, તે અનોખો લહાવો છે. સમગ્ર સામયિકના જુદા જુદા સ્તંભ સુંદર વિચારોનું પ્રતિપાદન છે અને તે માટેની કલ્યાણ તથા આયોજનને મિરદાવું છું.

આપ સહુની આ યજ્ઞ સમાન પ્રવૃત્તિ સમાજના એક સદા પ્રજ્વલિત દીવાદાંડી બની રહેશે તેમાં શંકા નથી. પ્રભુ આપની સાથે છે.

કીર્તિકાત પુરોહિત, લેખક-કવિશ્રી - વડોદરા
મો. ૯૮૭૬૧ ૧૪૨૮૮

જીવન

જીવનમાં ખરાબી ક્યારેય પણ આવી શકે છે, પરંતુ જીવન ખરાબ ક્યારે પણ હોતું નથી.

જીવન એક અવસર છે, શ્રેષ્ઠ બનવાનો, શ્રેષ્ઠ કરવાનો, શ્રેષ્ઠ મેળવવાનો.

જીવન એ ઝૂલ છે કે જેમાં કાંટા તો બહુ જ છે પરંતુ સૌંદર્યની પણ કોઈ કમી નથી.

અન્ય સંસ્થાઓના સમાચાર

**શ્રી કચ્છી લોહાણા સમાજ - અમદાવાદના
અગ્રગણ્ય પરિવારના આશાસ્પદ નવયુવક મુંજલનું
માર્ગ અક્ષમાતમાં કરુણ અવસાન**



મુળ કચ્છ - ભુજના
અને હાલે અમદાવાદ રિથિત
તથા શ્રી કચ્છી લોહાણા
સમાજ - અમદાવાદના
અગ્રણી શ્રીમતી
ચારુશીલાબેન તથા
હરિશભાઈ રંગવાલાના નાના
પુત્ર મુંજલનું તા. ૨૦-૦૩-

૨૦૨૧ના દિવસે ગુજરાત રાજ્યની બહાર એક માર્ગ અક્ષમાતમાં દુઃખ નિધન થયું છે. આ સમાચારથી સ્થાનિક કચ્છી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ સાથે સંલગ્ન પરિવારજનોમાં ઊંડા શોકની લાગણી વ્યક્ત થઈ હતી.

રંગવાલા પરિવારના મોભી અને હરિશભાઈના માતુશ્રી સ્વ. જવેરબેન ખૂબ સેવાભાવી, પરમાર્થી હતા. તેઓ કોઈપણ જાતના પદ કે પ્રતિષ્ઠાની આકાંક્ષા વગર સમાજસેવા માટે સદાય તત્પર રહેતા હતા. સમગ્ર રંગવાલા પરિવાર પોતાના શ્રી કચ્છી લોહાણા સમાજ - અમદાવાદ તથા અન્ય કચ્છી સંસ્થાઓની સામાજિક ક્ષેત્રની ઉત્કૃષ્ટ યોજનાઓમાં પોતાનો આર્થિક સહયોગ આપવા હુંમેશાં અગ્ર સ્થાને રહ્યા છે. પરંપરાગત પરિવાર પ્રણાલી અને સંસ્કારને, આ પરિવારના દરેક સદ્દ્યોએ હુંમેશાં જતનપૂર્વક જાળવી રહ્યા છે.

આવા સંશોધ અને સમાજ હિતેચ્છુ પરિવારના ભાઈ મુંજલ એક આશાસ્પદ નવયુવાન હતા. તેમણે અમદાવાદમાં એન્જિનિયરિંગ વિદ્યાની પદવી મેળવ્યા બાદ યુ.એસ.એ.માં ઇન્ડસ્ટ્રિયલ સ્નાતકોત્તરની પદવી હાંસલ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. એક્સેન્ટ્યુઅર ક્ષેત્રની કંપનીમાં પાંચ વર્ષ વિવિધ પ્રકારનો અનુભવ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતેની પોતાના પરિવારની વૈશ્વિક સ્તરની હુણી એન્જિનીયરિંગ કંપનીમાં કાર્યરત રહીને કંપનીની કામગીરીને ઉચ્ચ કક્ષાએ લઈ જવા પ્રયત્નશીલ રહ્યા હતા. ‘આત્મનિર્ભર ભારત’ના ‘બેનર’ હેઠળ અને લોકોના સુખાકારીભર્યા જીવન અર્થે પર્યાવરણને બચાવવાના સંકલ્પ સાથે ભાઈ મુંજલે પોતાની કાર્યક્રમાની ટેકનોલોજી વડે

ઉર્જા (Solar) એનર્જી ક્ષેત્રે સફળતાપૂર્વક ઝંપલાયું હતું. ખૂબ ટૂંકા સમયમાં તે ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કર્યા હતા.

સરળતા, માયાળું સ્વભાવ, ઉચ્ચ વિચારો અને લાગણીશીલતા જેવા ઉત્કૃષ્ટ ગુણોવાળી તેમની જીવનશૈલી હતી. જેનાં કારણે તેઓ સૌના દિલમાં માન-સંમાન પાખ્યા હતા અને પોતાના મિત્રવર્તુણમાં ખૂબ પ્રિય હતા.

તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ બદ્ધ અને તેમના પરિવારજનોને આ તીવ્ર આધાત જીર્વવાની શક્તિ અર્પે એવી લાગણી, સ્થાનિકની કચ્છી સંસ્થાઓ તથા તેમના હોદેદારો દ્વારા વ્યક્ત થઈ હતી અને સદ્ગતશીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પદર કેન્સરગ્રસ્ત બાળકોને રૂપાબેન શાહે દટક લીધા

અમદાવાદના ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા રૂપાબેન શાહને સેવાનો ગુણ વારસામાં મળ્યો છે. સાયન્સમાં ગ્રેજ્યુઅશેન કરીને તેઓ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યા બાદ બુટિકની સાથે સાથે સમાજસેવાના કામમાં પરોવાયા. જૈન સમાજની બહેનો પગભર થઈ શકે તે માટે તેઓ તેમને શરૂઆતમાં સીવાણકામ શીખવતા. ત્યારબાદ લગ્ન થયા અને ઘરમાં પોતાના સાસુને સોશિયલ વર્ક કરતા જોયા અને રૂપાબેન તેમના સાસુના સ્વરૂપા ફાઉન્ડેશનમાં જોડાયા. તેઓએ વાલ્બિકી સમાજની દીકરીઓનું ઘડતર અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગૃહઉંઘોગ તથા અન્ય કલા શીખવાની વ્યવસ્થા ઊભી કરી. તેઓએ જૈન શ્રમિક બહેનોને પગભર કરવાથી લઈને ગરીબ વિદ્યાર્થીઓને ભણવા ફી અને જરૂરી વસ્તુઓ આપવાનું શરૂ કર્યું. છેલ્લા ૧૪ વર્ષથી રૂપાબેન અનેક પ્રકારની સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયા છે. સ્વરૂપા ફાઉન્ડેશન દ્વારા આજે તેઓ આ કામગીરી સાથે સાથે કેન્સરગ્રસ્ત બાળકોને દટક લઈને તેમને રોગમુક્ત કરવાનું બીજું જરૂર્યું છે.

રૂપાબેને કહ્યું કે, સમજણી થઈ ત્યારે સૌથી પહેલાં મારા ફોઈ કેન્સર સામે લડી રહ્યા હતા અને ત્યાર પછી મારી મમ્મીને કેન્સર ડિટેક્ટ થતાં સતત તેમની સારવાર દરમિયાન તેમની સાથે રહેતી અને તેમનું દુઃખ નજરે જોતી. ઘડી સારવાર છતાં મારી સામે તેઓ મૃત્યુ પાખ્યા. બે વ્યક્તિઓના મૃત્યુને નજીકથી જોયું એટલે સિવિલના કેન્સર વિભાગમાં જઈને મદદ કરવાનું વિચાર્યુ. એક વખત એવું બન્યું કે એક કપલ હોસ્પિટલ બહાર રડતું હતું અને બાજુમાં આઈ વર્ષનું બાળક ગુમસુમ બેઢું હતું. તેમને પૂછતા ખબર પડી કે બાળકને કેન્સર છે. તેઓ મહારાષ્ટ્રથી આવ્યા છે

અને તેમની પાસે દવાના પણ પૈસા નથી. ત્યારબાદ મેં તે બાળકને બચાવવાના પ્રયત્ન શરૂ કર્યા. એ બાળક (રવિ)એ ગયા વર્ષ ૧૨માં ધોરણની પરીક્ષા આપી અને આજે તે સ્વસ્થ છે. ત્યારબાદ ૨૦૧૮-૧૯માં ‘સેવ બચપન’ના ભેનર હેઠળ દોડ કરોડ રૂપિયા ભેગા કરી ગુજરાત કેન્સર સોસાયટીને આપ્યા. આજે મેં ૫૩૨ કેન્સરગ્રસ્ત ભાગકોને દાક લીધા છે અને તેમની દરેક જવાબદારી ઉપાડી રહી છું.

ને પ્રકારની લેખન સ્પર્ધામાં ‘મંગલ મંદિર’ સામયિકના કોલમનિસ્ટ બલવીરસિંહ જાડેજા વિજેતા જહેર થયા

- ★ ચિત્રલેખાના સહયોગથી બૃદ્ધ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત નવલકથા લેખન સ્પર્ધા
- ★ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દૈનિકોના સહયોગથી મુંબઈની સંસ્થા કચ્છ શક્તિ દ્વારા આયોજિત અનોખી વાર્તા સ્પર્ધા

બંને સ્પર્ધાના પરિણામ જહેર થયા

- ★ સામયિક ચિત્રલેખાના સહયોગથી મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગત વર્ષ દરમિયાન નવલકથા લેખન - સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૨૦ નવલકથાઓ આવી હતી. જાણીતા સાહિત્યકાર પ્રા. દીપક મહેતા અને નવનીત - સમર્પણના તંત્રી દીપક દોશી આ સ્પર્ધાના નિર્ણાયકો હતા. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ઈનામો સાથે એક આશ્વાસન ઈનામ હતું.
- ★ એક અન્ય અનોખી વાર્તા સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દૈનિકોના સહયોગથી કચ્છ શક્તિ દ્વારા થયું હતું. મુંબઈ સ્થિત સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યકર હેમરાજ શાહે ૨૨ માર્ચ, ૨૦૨૧ના દિવસે આયુષ્યયાત્રાનાં ૮૦ વર્ષ પૂરા કર્યા છે. એ અવસરે ‘જીવનમાંથી જીડેલી’ આકર્ષક વાર્તા સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં કુલ ૩૦૨ વાર્તાઓ આવી હતી. જાણીતા સાહિત્યકાર પ્રા. દીપક મહેતા અને લેખિકા ડૉ. પ્રીતિ જરીવાલા આ સ્પર્ધાના નિર્ણાયકો હતા. નિર્ણાયકોની ભલામણ અનુસાર કુલ ૩૬ વિજેતાઓના નામ મુંબઈની કચ્છશક્તિ સંસ્થાના પ્રમુખ હેમરાજ શાહે તાજેતરમાં જાહેર કર્યા હતા. પ્રથમ ત્રણ ઈનામો ઉપરાંત ૩૩ આશ્વાસન ઈનામો પણ આ સ્પર્ધામાં રાખવામાં આવ્યા હતા.

યોગાનુયોગ ઉપરોક્ત બંને સ્પર્ધાઓમાં ‘મંગલ મંદિર’ સામયિકના કોલમનિસ્ટ અને અમદાવાદ સ્થિત બલવીરસિંહ જાડેજાની લેખન સામગ્રી આશ્વાસન ઈનામને પાત્ર જાહેર થઈ છે. શ્રી જાડેજાને ‘મંગલ મંદિર’ પરિવારના ખૂબ ખૂબ અભિનંદન.

કચ્છી લેવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખનું અવસાન

મોખ્ભાસાને પોતાની કર્મભૂમિ બનાવનાર કચ્છ - સૂરજપરના હરિભાઈ કેસરા હાલાઈનું ૧૧ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું છે. ૨૦૧૦થી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખપદે આરૂઢ થયેલા શ્રી હરિભાઈએ લેવા પટેલ સમાજની નૂતન વિંગ, કે.કે. પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ, સમાજ સ્થાપનાની સુવર્ણ જયંતીથી લઈ વર્તમાન વિકાસમાં ટપકેશ્વરી રોડ પરનું નૂતન શૈક્ષણિક સંકુલ, કૃપી મોલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કોશલવર્ધન કેન્દ્ર સહિત અનેક કાર્યોને મેક્કમતાથી પીઠબળ આપ્યું હતું. વર્તમાન પ્રમુખ વેલાઝાઈ પિંડોરિયા સહિત મોખ્ભાસા, નાઈરોબી, વિલ્સન, કેન્ફીડ વગેરે સ્થળોના સમાજ આગેવાનોએ સ્વર્ગસ્થશ્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કચ્છમાં નર્મદાનાં વધારાનાં પાણીની યોજનાને વહીવટી મંજૂરી કયારે મળશે?

ગુજરાત સરકારના ઉપ મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રી અને જેમની પાસે નર્મદાનો હવાલો છે એવા નીતિનભાઈ પટેલે તા. ૨૦-૩-૨૦૨૧ના રોજ એવું નિવેદન કર્યું હતું કે, સૈદ્ધાંતિક મંજૂરી માટે યોજના વિચારણા હેઠળ છે. તો છેલ્લા ૧૫ વર્ષથી આપવામાં આવેલી ખાતરીઓનું શું? આવા સવાલ કચ્છના આગેવાનોએ કર્યા હતા અને નેતાગીરીમાં જનૂન નથી તેવી વેધક ટકોર પણ કરી હતી.

વધારાના પાણી માટે આયોજનના ભાગરૂપે રૂ. ૫૬૦૭ કરોડની યોજના તૈયાર કરવામાં આવી હોવાનું શ્રી પટેલે નિવેદન કર્યું છે, જે ખરેખર ગેરમાર્ગ દોરે તેવું છે.

કચ્છ માટે વરસોથી નર્મદાનાં પાણીની લડત ચલાવતા કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલના અગ્રાણી, અમદાવાદ સ્થિત અશોકભાઈ મહેતાએ તો સરકારની નીતિ સામે શંકા દર્શાવીને કહ્યું કે, સૈદ્ધાંતિક મંજૂરીની તો વાત જ નથી. તેને હવે વહીવટી મંજૂરી આપવાની છે.

નિયમિત કે વધારાના નર્મદાના પાણી એક એકરમાં પણ નિગમે પહોંચાડ્યા નથી. જેડૂતો કેનાલમાંથી જેંચે છે એ અલગ વાત છે.

તેમણે કહ્યું કે, હવે વાતો નહીં પરિણામ લાવો. કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદ ઝનૂનપૂર્વક વાત કે રજૂઆત કરતા જ નથી તે દુઃખની વાત છે. હવે જ્યારે ભારતીય કિસાન સંઘે જલદ કાર્યક્રમો આપવાની ઘોખણા કરી છે તેને કચ્છ નર્મદા જળ અભિયાન તરફથી ટેકો આપવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

નર્મદાના અભ્યાસું અને ધારાશાસ્તી શશીકાંતભાઈ એમ. ટક્કરે નીતિનભાઈના નિવેદન મુદ્દે કહ્યું હતું કે આ વિરોધાભાસી નિવેદન છે. એક મિલિયન એકર પાણી કચ્છના ભાગે ફાળવાયા તેની સૈદ્ધાંતિક મંજૂરી તો વર્ષ ૨૦૦૮માં નરેન્દ્ર મોદીએ આપી હતી.

ભારતીય કિસાન સંઘના મોવડી શિવજીભાઈ બરાડિયાએ સ્પષ્ટ કહ્યું, હવે હદ થઈ છે. જાહેરાતો બધ કરો નહિતર ૧૬૮ એપ્રિલથી જલદ કાર્યક્રમો આપવાના છીએ.

કર્ય દર્શાન

● સંકલન : દિનેશ આર. મહેતા ●

- મૂળ અંગિયાના દીપે દીક્ષા લઇ મુનિ દર્શનવર્ધન વિનયજી મહારાજ થયા : બિહારમાં મૂળ કચ્છ અંગિયાના વતની એવા હષભેન હરિલાલ નાનયંદના પોત્ર અને લક્ષીનાબેન રૂપેશભાઈ શાહના પુત્ર થિ. દીપનો ભાગવતી દીક્ષા મહોત્સવ તા. ૭મી માર્યાના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. વેશ પરિવર્તન બાદ 'ઓઘો' સ્વીકાર કર્યા બાદ મુમુક્ષુ દીપભાઈની 'કેશલોચન'ની વિધિ બાદ તેમનું નૂતન નામ મુનિરાજ દર્શનવર્ધન વિજયજી મહારાજ આપવામાં આવ્યું હતું.
 - ભુજ જી.કે. હોસ્પિટલમાં ફિલિપિન્સના નાગરિકને કોરોના મુક્ત કરાયા : જ્યારે વિદેશી નાગરિકને કચ્છમાં કોવિડ થાય ત્યારે હોસ્પિટલની જવાબદારી અનેકગણી વધી જાય છે. કોરોનાની સારવાર સાથે તેના આહાર અને ભાષા પણ ધાણી વખત બાધારૂપ બને છે. પરંતુ ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ફિલિપિન્સના એક નાગરિકને કોરોનાની સારવાર આપી, આવા તમામ અવરોધો પાર પાડ્યા હતા અને તેમને કોરોનામાંથી મુક્તિ અપાવી હતી.
 - ભુજના શ્રમિકોનાં ઝૂંપડામાં પ્રકાશ પથરાયો! : ભુજ શહેરમાં અનેક અગવડો વચ્ચે રહેતા સ્થળાંતરિત શ્રમિકોના પરિવારોના ઝૂંપડાઓમાં પ્રકાશ પાથરવાની કામગીરી ભુજમાં ચાલતા પ્રકલ્પ 'હોમ્સ ઈન ધ સિટી' દ્વારા તાજેતરમાં કરવામાં આવી છે.
 - રૂ. ૩૪.૫૮ લાખના પોસ્ટ કૌભાંડમાં ૧.૭૫ કરોડની છેતરપિંડી તપાસમાં જણાઇ : રાજ્યભરમાં ચક્યાર મચાવનારા ભુજમાં રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં રૂ. ૩૪.૫૮, ૧૭૮ની છેતરપિંડી સબખ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ તાજેતરમાં નોંધાવાઈ હતી. જેમાં આજસુધી પોલીસ તપાસ દરમિયાન રૂ. ૧,૭૪,૬૩,૧૭૭ની છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
 - ભયાઉ પંથકમાં બેફામ ખનિજ ચોરીની બૂમ : પૂર્વ કચ્છમાં બેફામ ખનિજચોરી થઈ રહી હોવાની ફરિયાદો જૂની છે અને ઘણા કિસ્સામાં આ પ્રવૃત્તિ લોહિયાણ પણ સાબિત થઈ છે. રોયલ્ટી ભર્યા વિના ભયાઉ પંથકના હાડવારા તથા આસપાસના અન્ય વિસ્તારોમાં આદેહ થતાં ખોદકામમાં વાગડના અનેક લોકોનો હાથ હોવાનું અગાઉ પ્રકાશમાં આવ્યું છે. ખાડા ખનિજ તંત્ર એકલ-દોકલ કિસ્સામાં ફરિયાદ દર્જ
- કરાવીને પછી આ બાબતમાં આગળ વધતું નથી. ભયાઉ તાલુકાના હાડવારા તથા અન્ય ગામોની આસપાસ છેલ્લા થોડા સમયથી રેતી ઉપાડવાનું વ્યાપક કામ ચાલી રહ્યું છે.

● લાખણિયાના પોકસોના બે આરોપી ઝડપાયા : નલિયા પોલીસ મથકમાં પોકસો સહિતની વિવિધ કલમો તળે નોંધાયેલા ગુનાનો મુખ્ય આરોપી તા. ૨૧મી ફેબ્રુઆરીના ઝડપી પડાયા બાદ ગત તા. ૫મી માર્યાના આ કામમાં મદદગારી કરનારા અન્ય બે સહ આરોપીને પકીને નલિયા સર્કલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

● મુંડ્રા કસ્ટમ લાંચ પ્રકરણમાં ચાર અધિકારીઓની બદલી : બ્રદ્ધાચારના આરોપ વચ્ચે મુંડ્રા કસ્ટમના સુપ્રિન્ટેન્ટન્ટ તાજેતરમાં લાંચના એક કિસ્સામાં ઝડપાઈ ચૂક્યા હતા. ત્યારબાદ વિજિલન્સ ડી.જી.ની ટીમ અમદાવાદથી મુંડ્રા આવી હતી અને છાનબીન બાદ ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી નાખવામાં આવ્યા છે.

● ભુજના જે.સી.આઈ.માંથી બાંગલાદેશી નાસ્યો : હજુ થોડા દિવસો અગાઉ ભુજના એ-ડિવિઝન પોલીસની કસ્ટરીમાંથી ચક્યારી પોસ્ટના કૌભાંડનો આરોપી પોલીસની નજર ચૂકાવીને ફરાર થયા બાદ કલાકોમાં જ ફરી ઝડપાઈ ગયો હતો. તેવો જ સિલસિલો હજુ બરકરાર હોય તેમ ત્યારબાદ ભુજના સંયુક્ત પૂછ્યતાએ કેન્દ્રમાંથી એક બાંગલાદેશી પ્રતિબંધક નાસી છૂટાં પોલીસની દોડધામ વધી હતી. જો કે, આ ઈસમને પૂર્વ કચ્છ પોલીસે સામબિયાળી ચેકપોસ્ટ પાસેથી પકડી લેતાં હાશકારો થયો હતો.

● કચ્છના રાપર પાસે ૩.૬નો ધરતીકંપ : ભૂકુંપની બાબતમાં સૌથી વધુ જોખમી ક્ષેત્ર અર્થાત્ ઝોન-૫ માં આવતા કચ્છ જિલ્લામાં રાપરથી ૧૪ કિ.મી. પથ્થિમ - ઉત્તર દિશાએ રવેચી-સુવઈ રોડ નજીક અને જેસંગ ગામ પાસે ગત માસ દરમિયાન ૩.૮ મેનિન્ટ્યુડનો ધરતીકંપ ગુજરાતના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં આ ઉપરાંત ધોળાવીરા પાસે ૧.૮ની ત્રિપ્રતાનો, દૂધઈ વિસ્તારમાં ૨.૩ અને ૨.૦ અને રાપર પંથકમાં ૧.૦ના હળવા આંચ્યકા પણ અગાઉ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કચ્છ ફોલ્ટ લાઈનના કારણે ભૂકુંપની શક્યતાવાળો જિલ્લો છે અને ત્યાં ઝોન-૫ મુજબ ૪ (અનુસંધાન : જુઓ પાના નં. - ૫૨ ઉપર)

૭ NanoNine® શબ્દ રમત-૧૯૦											
સંકળન : રજનીકાંત પારેણ											
૧	૨		૩	૪		૫		૬	૭	૮	
૯			૧૦		૧૧			૧૨			
૧૩			૧૪		૧૫		૧૬				
		૧૭		૧૮	૧૯			૨૦			
	૨૧		૨૨			૨૩					
૨૪		૨૫		૨૬		૨૭			૨૮		
૨૬	૩૦		૩૧		૩૨			૩૩			
૩૪		૩૫		૩૬			૩૭				
	૩૮	૩૯						૪૦			
૪૧			૪૨	૪૩		૪૪		૪૫			
૪૬			૪૭	૪૮		૪૯	૪૯	૫૦			
		૫૧				૫૨		૫૩			

શબ્દ રમત ભરનારનું નામ : _____

સરનામું : _____ ફોન/મો. _____

આપશ્રીના જવાબો ના. ૩૦-૦૪-૨૦૨૧ સુધીમાં શ્રી કર્ચણી જેન ભવન - પાલડીના સરનામે મોકલ્યાવવા વિનંતી.

આડી ચાવીઓ

- | | | | |
|------------------------------------|-----|---|-----|
| ૧. એક દૂજે કે લિયે - પિકચરનો હીરો | (૬) | ૨૭. બળ, તાકાત, સામર્થ્ય | (૨) |
| ૬. તાથ, ચિંતા, ટેન્શન | (૩) | ૨૮. રોજનું | (૩) |
| ૮. ઘાંઠો, બરાડો, પોકાર | (૨) | ૩૧. પર્વ, ઉત્સવ, ફેસ્ટિવલ | (૪) |
| ૧૦. ટેવ, આદત | (૨) | ૩૩. કાળ્યો, કંકાસ | (૩) |
| ૧૧. પછી જર્મેલું, નાનો ભાઈ | (૩) | ૩૪. ગંજ, ફાગલો | (૨) |
| ૧૨. ફળની અંદરનો ગર્ભ | (૨) | ૩૬. મદ્દોન્મતા, મદ્દી જુમતું | (૪) |
| ૧૩. કોઈ વસ્તુનું અસલ રૂપ | (૨) | ૩૮. દાળીનાનો ઢોળ ચડાવનાર | (૪) |
| ૧૪. આંખની કીકી | (૩) | ૪૦. રાખ, ધૂળ, નાશ | (૨) |
| ૧૬. થર, પોપડો | (૨) | ૪૨. સૂર્ય સંબંધી | (૨) |
| ૧૭. ભારે શરીરવાળું | (૨) | ૪૪. ઈન્દ્રિય વાણી, ગાય | (૧) |
| ૧૮. સુગંધ, સુવાસ | (૩) | ૪૬. એક જાતની ઘોડાગાડી | (૨) |
| ૨૦. લીસું નહી કરકર લાગે એવું | (૩) | ૪૮. ભેંસોનું ટોળું | (૨) |
| ૨૧. ચાલીસ શેરનું તોલ | (૨) | ૪૯. ગણપતિ | (૪) |
| ૨૩. મુર રાક્ષસને મારનાર, શ્રીકૃષ્ણ | (૩) | ૫૧. નાજુકાઈ | (૪) |
| ૨૫. તફાવત, જુદાપણું | (૪) | ૫૨. રાજા | (૧) |
| | | ૫૩. (૬) નોંધ, ચિંદી, ચલણી સિક્કાને બદલે વપરાતું નાણું | (૨) |

ભાની ચાવીઓ

- શાંતિનો સંદેશ આપતું પક્ષી (૪)
- મારાપણું, હું પદ (૩)
- બાળકોને સુવાવવા માટે ગવાતું ગીત (૪)
- હંમેશાં, નિરંતર, લગતાર (૩)
- સર્વોત્તમ, જેની ઉપમા નથી એવું (૪)
- દેશનો પ્રજાજન, સિટીઝન (૪)
- પતિ, વરદાન (૨)
- ધંધામાં કમાણી, પ્રોફિટ (૨)
- અંદરની વાતનો જાણકાર (૪)
- કામદેવની પત્ની (૨)
- આકાશમાંથી પડતા બરફના ટુકડા (૨)
- સુતરફેણી માટે જાણીતું ગામ (૩)
- મોક્ષ, છુટકારો, આજાદી (૨)
- વહેલી સવાર, ગ્રાતઃકાળ (૩)
- શંકા, શક (૩)
- લજા, લાજ (૩)
- બાળગર પિકચરનો હીરો (૬)
- ટિલોજાન, દોસ્ત (૩)
- નાંનું વાદળું (૩)
- કિંમતી પથરો, રત્ન (૨)
- આશ્રયચિંતન, ડિંમુઢ (૨)
- સાખ, શાહેદી (૨)
- દૂધની એક ઘડ વાનગી (૩)
- વગર પરણે રાખેલી સ્ત્રી (૩)
- ભંડાર, નાણું રાખવાની જગ્યા (૩)
- ડાંગરની ધાણી (૨)
- વેશ ભજવનાર, દોરડા પર ચાલનાર (૨)

અવિચારી વાણી

કોઈના માટે અત્યંત વેધુક કે કટાક્ષયુક્ત ટીકા કરવાતું મન થાય ત્યારે યાદ કરો કે વધારે પડતા મરીમસાલા ખોરાકને બેસ્વાદ બનાવે છે.

અવિચારી શબ્દોએ ઘડા મૂલ્યવાન સંબંધોને ખાડિત કર્યા છે, જ્યારે સદ્વ્યવહારથી કોઈએ ક્યારેય કંઈ ગુમાવ્યું નથી. અન્યોને પોતાની રીતે વિકસવાની સ્વતંત્રતા આપો.

૭ NanoNine® શાબ્દ રમત-૧૬૮નો ઉકેલ

ન	રે	ન્દ્ર	મો	દી		કા	ક		ણ	કી	મ
વ	ન		ત	પ	ખી	ર			દ		ત
ની		ક		ડો	લ		ક				
ત	સ	વી	ર	વું		મ	થ	રા	વ	ટી	
	ર	સ		અ		વા		ના		ત	પ
આ	એ		બા	જુ			ઘ		ન	કી	
ક	દ	ર		ગ		ક	લિ	કા			
ઝ		ક્ષા		ગ	લ	ત			કું		
એ		પો	ઠી		કિ	ટ		સ	ર	સ	વ
	ન	ટ		શો		વ		સ	ફ	ર	
જં	બ	લી		અ	ર	બ	સ્તા	ન		લ	
જું		ક	મી		ચ	રી		ણ	તા	શ	

માસ ફેબ્રુઆરી-૨૦૨૧ના અંકમાં છપાયેલ નેનો શાબ્દ રમત-૧૬૮ના બધા સાચા ઉકેલ મોકલાવનારના નામ

- ૧. સરલા શાહ — અમદાવાદ
- ૨. પ્રવીષા દંડ — અમદાવાદ
- ૩. દિશા પટેલ — અમદાવાદ
- ૪. હંસાબેન ડાકોર — અમદાવાદ
- ૫. દમયંતી દંડ — અમદાવાદ
- ૬. ઈન્ફુનેન પટેલ — અમદાવાદ
- ૭. મીત મહેતા — અમદાવાદ
- ૮. જ્યોતિ શાહ — અમદાવાદ
- ૯. ચેતના વોરા — અમદાવાદ
- ૧૦. લક્ષ્મી ખની — અમદાવાદ
- ૧૧. સાવિત્રી જેસરાણી — મુખી
- ૧૨. ગુણવંદી મહેતા — ગાંધીધામ
- ૧૩. સરોજ ચંદુરા — સુરત
- ૧૪. ત્રિપા પારેબ — સિંદ્રાબાદ
- ૧૫. પ્રભા શેઠિયા — વલસાડ

ટાર મોકલાવનારમાંથી લક્કી ડ્રો અનુભાર વિશેતાના નામ નીચે પ્રમાણે છે.
હંસાબેન ડાકોર — અમદાવાદ

૧૬૮ રમત-૧૬૭ : સમય વિતી ગયા પછી ઉત્તર મોકલાવનારના નામ

- ૧. પ્રભાબેન શેઠિયા — વલસાડ

મનુષ્યના અણુએ અણુમાં દિવ્ય ચેતનાનો સંચાર થયા કરે છે. દિવ્ય ચેતના વિચારોમાં વહે છે ત્યારે બુદ્ધિપ્રતિભા આપે છે. દિવ્ય ચેતના નિશ્ચયબળમાંથી વહે છે ત્યારે સદગુણ આપે છે પણ જ્યારે તે હદ્દ્યમાંથી વહે છે ત્યારે પ્રેમ અને કરુણા આપે છે.

કચ્છ દર્શન

(અનુસંધાન : પાના નં. - ૫૦ ઉપરથી ચાલુ)

બાંધકામની ડિજાઈન કરવાની હોય છે. કચ્છી લોકોએ ભૂકંપ સાથે જીવતા શીખવું અનિવાર્ય છે.

ગુજરાતમાં જમીના ભૂતળમાં ભારતીય ભૂખંડ અને ચુરેશિયન ભૂખંડની આશરે ૩૦૦થી ૪૦૦ કિ.મી.ની છંદ આવેલી છે. જેના પગલે ગુજરાતમાં ગત ૨૦૦ વર્ષમાં ૬ મોટા વિનાશક ભૂકંપ આવી ચૂક્યા છે અને રોજ નાના-મોટા આંચકા સતત નોંધાતા રહે છે.

- આ વરસે કચ્છી કેસરનું વિપુલ ઉત્પાદન થશે : કચ્છી કેસર કેરીની માંગ સમગ્ર ભારત સહિત વિદેશમાં રહેતી હોઈ કિસાનો મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે. જોકે ગતવર્ષે વાવાજોહું, પ્રારંભિક તબક્કે જ સચરાચર વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. અધૂરામાં પૂરું લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ રહેતા સ્થાનિકે જ ઓછા ભાવે કેરીનું વેચાણ કરતા ખેડૂતોને આર્થિક નુકસાની વેદવાનો વારો આવ્યો હતો. હાલે ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવક બમણી થવાનું અનુમાન લગાવતા ખેડૂતો કહે છે કે, આ વખતે અત્યારથી આંબે પુષ્કળ પ્રમાણમાં મોર જુમી રહ્યા છે. અગર આ વર્ષે કુદરત મહેરબાન રહેશે તો કચ્છી કેસરનું વિપુલ ઉત્પાદન થવાના સંજોગો છે.

- સી.એ. ભુજ બ્રાંચને શ્રોષ શાળાનો એવોર્ડ : સી.એ. ઇન્ડિયન વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ દ્વારા વર્ષ ૨૦૨૦ માટે ભુજની શાખાને માઈકો બ્રાંચ કેટેગરીમાં શ્રોષ શાળાનો એવોર્ડ તાજેતરમાં જાહેર થયો હતો. ભુજ શાખાને તેમની કોરોના મહામારીના વર્ષ વચ્ચે આઈ.સી.એ.આઈ. અને ડાયલ્યુ.આઈ.આર.સી.નાં માર્ગદર્શનમાં ઓનલાઈન શૈક્ષણિક માર્ગદર્શન અને સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેવા બદલ સમગ્ર ભુજ ટીમની પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે ભુજને હિતિહસમાં આ પ્રકારની સિદ્ધિ પહેલાવાર મળી છે. ૨૦૧૬માં સ્થપાયેલી સી.એ.ની ભુજ બ્રાંચમાં અત્યારે ૨૫૦થી વધુ સભ્યો છે અને ૪૫૦ વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

- અંજારની શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ્સ-ડે ની નવતર ઉજવણી : અંજારની એજયુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ પ્રાથમિક વિભાગની શાળાઓ વી.જે. વાધવા સ્માર્ટ કિડ્સ (અંગ્રેજ માધ્યમ) શૈશવ (ગુજરાતી માધ્યમ)ના સંયુક્ત ઉપકમે ગ્રાન્ડ પેરેન્ટ્સ-ડે ની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૮૦ દાદા-દાદી તથા નાના-નાની ઉત્સાહભેર જોડાયા હતા.

(સમાચારપત્રો પર આધ્યારિત)



બાલુડેં જયું ગાલિંયું

સંકલન : ગુલાબયંદ ધારશી રાંભિયા

બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : પાંજે સામે જે ફિલેટમેં ગાલુકાકા રેતા અનીજો પોતરો હેઠે સરસ મજાજે દીવે કે કુલા પછાડેને તોડે વજેલા જુઘ્યો આય... સે જરા તપાસ ત કર... ચર્યો ત નાય થે વ્યો?

બચુડો : (તપાસ કરે ને ચેં) ગાલુકાજો પોતરો હીં તા ડાયો આય. પણ અનજે હથમેં જોકો જાહુઈ દીવો આવ્યો વો અનકે જમીનતે ઘસેને અનમેં જા જન બહાર આવ્યો. અતરે પોતરો ચેં 'મને સરસ ઘરવાળી આપ.' અતરે પોય જન અનજે પલંગ નીચે વેને જાહુ કઢે, ઘર બુઆરે ને એકદમ ચોખ્યો કે તેને... પોતરો મંગે વે 'સરસ ઘરવાળી' ને જન ઘર બુઆરે ને સરસ ઘર કે તેને. અતરે ખારો થે ને દીવે કે પછાડે પછાડે તોડેલા જુઘ્યો આય.

ખિલજા મ ભલા

રાહુલ : ગુજરાતમાં શાંતિ છે જ નહીં. લોકો ખોટી ઊંફાસ માર્યા કરે છે.

મોદીકાકા : તું કઈ રીતે આમ કહી શકે?

રાહુલ : જુઓને લોકો હાથમાં નાની નાની લાકડીઓ લઈ સામ સામે મારતા હોય છે.

મોદીકાકા : બકા, એને લાકડીઓ નહીં પણ દાંડિયા કહેવાય!

☺ ☺ ☺ ☺ ☺

મેજર સાહેબ : તું આમ તો આંધળો છે. પછી લશ્કરમાં રહીને તું શું કરીશ?

અંધ વ્યક્તિ : સાહેબ, હું અંધાધૂંધ ગોળીબાર કરીશ...!

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : સફળતાના રહસ્યો વિશે શું કહેવું છે?

પર્વ : સાહેબ, સફળતાના રહસ્યો આપણા ઘરમાં જ પડ્યા છે.

શિક્ષક : એ કઈ રીતે?

પર્વ : જુઓ આ છાપડું કહે છે જીવું નિશાન તાકો.

પંખો કહે છે મગજ ઠુંઠ રાખો

ઘડિયાળ કહે છે - દરેક સેકન્ડ કિમતી છે

અરીસો કહે છે - તમારી જતને ઓળખો.

બારી કહે છે - હુનિયામાં ડોકિયું કરો

કેલેન્ડર કહે છે - અપટુટે રહો.

દરવાજો કહે છે - દિલના દરવાજા ખુલ્લા રાખો.

☺ ☺ ☺ ☺ ☺

પણુ : પેટ્રોલ બચાવવા શું કરવું જોઈએ?

ગણુ : બોયફેન્ડ અને ગલફિન્ડથી દૂર રહો. તેનાથી ૮૦% પેટ્રોલ બચી શકે છે.

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : શેમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે?

કોમર્સનો વિદ્યાર્થી : સોનામાં રોકાણ કરવાથી ૨૫%

ચાંદીમાં રોકાણ કરવાથી ૭૦%

ઓઈલમાં રોકાણ કરવાથી ૪૦%

શેર માર્કેટમાં રોકાણ કરવાથી ૨૨% અને

ઝુંગામાં રોકાણ કરવાથી ૮૦૦%

☺ ☺ ☺ ☺ ☺

મનિયો : આઈ.પી.એલ.માં રોબિન ઉથપ્પાએ પોતાનો ભાવ વધારવા શું કરવું જોઈએ?

કનિયો : રોબિન ઉથપ્પા - નામમાં ફેરફાર કરીને ઓનિયન ઉથપ્પા કરી નાખવું જોઈએ!

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : એક કીડીનો શિકાર કઈ રીતે કરશો? - એ વિશે ભૂતિયા સ્ટોરી તમારા શબ્દોમાં જણાવો.

મોન્ટુ : મરચાની ભૂકી અને ખાંડ ભેગા કરી કીડીના દરની બહાર ભભરાવો. કીડીને ખાંડ બહુ ભાવે છે એટલે સાથે મરચાની ભૂકી પણ ખાઈ જશે. તેથી તેના મોઠામાં બજતરા થશે. કીડી પાણીની શોધમાં જશે. પાણીની ટાંકી પાસે પહોંચે એટલે તેને ધક્કો મારો. ભીની થયેલી કીડી શરીર સૂક્ષ્વવા આગ પાસે જશે. આ વખતે આગમાં ટેટો ફોડો. આ કારણે કીડી ધાયલ થશે અને તેને આઈ.સી.યુ.માં દાખલ કરાશે. ત્યાં જઈ તેના મોં પરથી ઓક્સિજન માસ્ક હટાવી લેવામાં આવે તો કીડી પ્રાણવાયુના અભાવે પ્રાણનો ત્યાગ કરશે. પ્રભુ એના આત્માને શાંતિ આપે!!!

૧/૨૬, ગંગામણી ફ્લેટ્સ, વસ્ત્રાંગ સોસાયટી, ગોપાલયોક,
મહિનગાર, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન : ૨૪૪૬૮૭૬૫૦

પોતાથી ન હારો તો તમારી જત નિશ્ચિત છે.

સમાજ દર્પણ

સરનામા ફેરફાર

- વિશાળ હરખયંદ કુંવરજી ગોસર**
ડી-૬૦૩/૬૦૪, રાજ્યશ રિવેન્ટા,
એ.એમ. પર્મિંગ સ્ટેશનની સામે,
જી.બી. શાહ કોલેજની પાછળ,
ન્યુ વાસણા, શાહવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
મો. ૮૨૭૪૭ ૮૨૭૪૬

શરણાઈ

- તા. ૧૮-૦૫-૨૦૨૦**
ચિ. નીલ મુકેશ મુજજુભાઈ સાવલા
(નાની તુંબડી - અમદાવાદ)
ચિ. દિક્ષીતા અતુલ સોની - ડાઓર્ડ

અવસાન નોંધ - પુષ્પાંજલિ

- તા. ૧૮-૦૩-૨૦૨૧**
શાંતિલાલ દેવરાજ દંડ (સાંધવ - અમદાવાદ)
- તા. ૨૨-૦૩-૨૦૨૧**
રમેશભાઈ શીવયંદ શાહ (ભુજ - અમદાવાદ)
સદ્ગતશ્રીઓના આત્માના શ્રેયાર્થે પ્રાર્થના.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

એકાઉન્ટ તથા જી.એસ.ટી. (Tally ERP9) સંબંધી
કલાસીસ શરૂ થઈ રહ્યા છે....

JITO સંસ્થા દ્વારા Tally ERP9 એકાઉન્ટિંગ સોફ્ટવેર
શીખવવામાં આવનાર છે. જેમાં એકાઉન્ટને લગતી તમામ
વિગતો તથા જી.એસ.ટી.ને લગતી તમામ માહિતી
શીખવાડવામાં આવશે. જેનો સમયગાળો એકથી દોઢ મહિનો
જેટલો છે. જેની સભ્ય દીઠ ફી રૂ. ૧,૦૦૦/- (રિઝિબલ) નક્કી
કરવામાં આવી છે. શીખનારની ૧૦૦ ટકા હાજરી હશે તો જ
ફી રિઝિડ મળશે, જેની ખાસ નોંધ લેવી.

આથી શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના ૧૮થી
૪૫ વર્ષની ઉમરના સભ્યોને ઉપરોક્ત કલાસીસનો લાભ લેવા
અપીલ કરવામાં આવે છે. દરરોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી
સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં અમદાવાદના મણિનગર તેમજ
વાડજ ખાતેના વિસ્તારોમાં તેના સેન્ટર નક્કી કરવામાં આવ્યા
છે. કલાસીસનો સમય ૨ કલાકનો રહેશે. રસ ધરાવનાર
સભ્યોએ JITO ની નીચે મુજબના નંબર ઉપર ફોન કરવો અને
તેજ નંબર ઉપર SKILL લખીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

★ સમાજમાં ફ દિવસ ★ પ્રતિદિન બે કલાક. ★ કુલ ૧૦૦ કલાક
નંબર : ૮૧૦૪૫ ૦૫૦૧૫

JITO દ્વારા આ ઉમદા તથા નિઃશુલ્ક આયોજનનો આપણો
સૌ લાભ લઈએ.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

લાઇબ્રેરી

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતેની લાઇબ્રેરી ખૂબ જ સારી રીતે
ચાલી રહેલ છે. કોરોના જેવી મહામારી કે લોકડાઉનના સમયમાં પણ ઘરે બેઠા ઘણા સભ્યોએ તેનો લાભ લીધેલ છે. લાઇબ્રેરીમાં
સમાજ તથા સમાજની બહારના લગભગ ૨૩૦ જેટલા સભ્યો છે. આ સમૃદ્ધ લાઇબ્રેરીમાં આશરે ૩૦૦૦ જેટલા વાંચવાલાયક
પુસ્તકો વસાવેલા છે, જેમાં અનેક નવા - જૂના વિષ્યાત લેખકોના પુસ્તકોનો સમાવેશ થાય છે.

સમાજની લાઇબ્રેરી સમિતિના સભ્યો, લાઇબ્રેરીને હજુ પણ વધુ સમૃદ્ધ બનાવવા પોતાની અમૃત્ય સેવાઓ સતત આપી
રહ્યા છે. આથી સમાજના અન્ય પરિવારોને આ લાઇબ્રેરીનો અચૂક લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

વહુ વિગત માટે સંપર્ક :

શ્રી કચ્છી જૈન ભવન - પાલડી

ફોન : (૦૭૯) ૪૮૮૦ ૬૦૦૧ થી ૬૦૦૫

સમય : સવારે ૬.૩૦થી સાંજના ૫.૦૦ સુધી

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

ઝેરમુકત અને રસાયણ મુકત અનાજ - કઠોળની ઉપલબ્ધતા

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા અમદાવાદમાં રહેતા આપણા સમાજના દરેક લોકોને ઝેરમુકત અને રસાયણમુકત અનાજ - કઠોળ વગેરે ઉપલબ્ધ થઈ શકે તે માટે એક વ્યવસ્થા ઊભી કરાઈ છે.

આ એક વેપાર નહીં પરંતુ વ્યવસ્થા છે કારણકે આપણા કચ્છી ખેડૂતો ફક્ત કચ્છમાં જ નહીં પરંતુ ગુજરાતમાં અન્ય ઠેકાડો પ્રાકૃતિક જેતી કરતા હોય અને તેમની મહેનત પ્રમાણે તેમને વળતર મળે અને આપણને પૌષ્ટિક આહાર મળી રહે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એવી મનોકામનાથી આપણે આ કામ હાથ પર લીધું છે. આ પ્રોજેક્ટમાં ફક્ત આપણા કચ્છી ખેડૂતો જ નહીં પરંતુ અન્ય ખેડૂતો કે જેઓ ઓર્ગેનિક જેતી કરે છે, તેઓ પણ લાભાન્વિત થશે.

આ પ્રોજેક્ટને વેગ મળે તે હેતુથી આપણી સાથે આર્ટ ઓફ લિવિંગના એગ્રિકલ્યુર ટ્રસ્ટના ગુજરાતના એપેક્સ મેન્ઝર ચિંતનભાઈ વ્યાસ અને તેમની ટીમ આપણી સાથે જોડાઈ છે. ચિંતનભાઈ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે આર્ટ ઓફ લિવિંગમાં ગુજરાતમાં ઓર્ગેનિક ફાર્મિંગના શિક્ષક પણ છે અને એગ્રિકલ્યુર ટ્રસ્ટનું ગુજરાતમાં સંચાલન કરી રહ્યા છે. તેમની ટીમ ખેડૂતોને ટ્રેનિંગ પણ આપે છે અને ખેડૂતો દ્વારા ઉગાડેલ અનાજ, કઠોળ વગેરે લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે.

આ કામ નહીં નફા, નહીં નુકસાનના ધોરણે કરવામાં

આવશે. જે ખેડૂતો દેશી ગાય આધારિત જેતી કરે છે તેમનો સંપર્ક કરીને, પૂરતી ચકાસણી કર્યા બાદ તેમની પાસેથી ખરીદી કરીને આપણા પાલણી - અમદાવાદ ખાતેના ભવન પર લવાશો અને આપ સુધી પહોંચાડવામાં આવશે. આમ કરવાથી ખેડૂતોને તેમની મહેનતનું વળતર મળશે અને આપણને ઝેરમુકત ખોરાક મળશે.

આયુર્વેદ પ્રમાણે કહીએ તો આપણા શરીરમાં હ પ્રકારના રસ ભોજન દ્વારા પહોંચવા જોઈએ. તેમાં ખાટો, ખારો, કડવો, તીખો, ગળ્યો અને તુરો - એમ હ સ્વાદને પડ્દરસ કહેવાય. પણ જ્યારે કેમિકલ અને ઝેરવાળા સસ્તા અનાજ - કઠોળ વગેરે લેવાથી સ્વાસ્થ્ય પણ બગડે છે અને જીવલેણ રોગ થવાની સંભાવના વધી જાય છે.

આ કામમાં આપણા સમાજના દરેક વર્ગના લોકોના સાથ અને સહકારની જરૂર છે. કોરોનાની મહામારી તેમજ અન્ય જીવલેણ બીમારીઓ દિવસે દિવસે વધતી જાય છે. તેમજ કેમિકલ અને પેસ્ટિસાઇડવાળા અનાજ અને કઠોળને ભોજન તરીકે લેવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે. શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પાઈલોટ પ્રોજેક્ટને આપણા બીજા અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

મરેજ બ્યુરો સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત મરેજ બ્યુરો સમિતિ દ્વારા કચ્છી જૈન તથા અન્ય જૈન લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે મરેજ બ્યુરો ચલાવવામાં આવે છે. જેની વિગત "KJSS Jain Whatsapp Group" પર છેલ્લા હ મહિનાથી નિયમિત રૂપે પ્રસારિત કરવામાં આવે છે. જેમાં હાલમાં રજિસ્ટર્ડ થયેલ યુવકોની સંખ્યા ઉરપ અને યુવતીઓની સંખ્યા રૂપની રહેવા પામેલ છે. જેમાં કચ્છી જૈન અને અન્ય જૈન યુવક-યુવતીઓ સામેલ છે. તાજેતરમાં ચાલુ માસ દરમિયાન બે લગ્નોત્સુક યુગલો તથા ચુપમાં રજિસ્ટર્ડ થયેલા અન્ય બે લગ્નોત્સુક યુગલોના સગપણ નક્કી થઈ ગયા છે. તથા છેલ્લા ચાર માસ દરમિયાન આ ચુપ દ્વારા ૮થી ૧૦ યુગલોના સગપણ

નક્કી થઈ ગયા છે.

સમિતિ દ્વારા Whatsapp Group ખૂબ હ વ્યવસ્થિત રીતે ચાલી રહેલ છે. શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના સભ્યો તથા અમદાવાદ બહારના કોઈપણ જૈન અને કચ્છી જૈન પરિવારોના લગ્નોત્સુક યુવક-યુવતીઓ ઉપરોક્ત ચુપમાં પોતાનું નામ રજિસ્ટર કરાવી શકે છે.

વધુ વિગત માટે સંપર્ક:

અમીબેન શાહ : ૮૮૭૯૮૯ ૫૧૮૮૮

જિરીશભાઈ દેઢિયા : ૮૩૨૦૩ ૧૬૮૬૮

વીજાબેન સંઘવી : ૮૦૦૦૭ ૩૮૬૬૮

કંપીનાર, મરેજ બ્યુરો સમિતિ


મુશ્કેલ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે

અને કમજોર વ્યક્તિ બહાના.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની કો.ઓ. કેડિટ સોસાયટીની સામાન્ય સભાનો અહેવાત

વર્ષ ૨૦૧૬-૨૦૨૦ માટે ૧૫ ટકા ડિવિડન્ડ સાથે એક આકર્ષક બેટ આપવાની જહેરાત થઈ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની કો.ઓ. કેડિટ સોસાયટીની સામાન્ય સભાનું આયોજન શ્રી કચ્છી જૈન ભવન - પાલડી ખાતે તા. ૧૪-૦૩-૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. સભામાં સોસાયટીના મંત્રી રજનીકાંત પારેખે જણાવ્યું હતું કે, ગત વર્ષ દરમિયાન કોરોના વાઈરસના કારણે સોસાયટીના અનેક સભ્યોના કામધંધાને માઠી અસર થઈ હતી. આવી વિકટ પરિસ્થિતિ અંતર્ગત સોસાયટી દ્વારા નીચે મુજબ કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.



- ★ જરૂરતમંદ સભ્યોને અપાયેલ લોન પેટે ઉ માસનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું.
- ★ લોન પર વ્યાજના દર ૧૧ ટકાના સ્થાને ૧૦ ટકા લેવાનું નક્કી થયું હતું.
- ★ વર્ષ ૨૦૧૬-૨૦૨૦ના વાર્ષિક હિસાબની રજૂઆત કરીને તેની મંજૂરી લેવામાં આવી હતી.
- ★ વર્ષ ૨૦૧૬-૨૦૨૦ માટે ૧૫ ટકા ડિવિડન્ડ જહેર કરવામાં આવ્યું છે.
- ★ સોસાયટીના સભ્યોને ટૂંક સમયમાં એક આકર્ષક બેટ આપવાની જહેરાત થઈ હતી.
- ★ સોસાયટીની કારોબારી સમિતિમાં નિવૃત્ત થતા સભ્યોના સ્થાને સર્વશ્રી રજનીકાંત પારેખ, મહેનદ્ર ખોના, મનુભાઈ શાહ અને રોહિત સંઘવીની વરણી થઈ હતી.
- ★ આગામી વર્ષ માટે નીચે મુજબ હોદેદારોની નિમણુંક સોસાયટી માટે થઈ હતી : ચેરમેન - પ્રતાપભાઈ દંડ, ઉપપ્રમુખ - કે.ડી. શાહ, મંત્રીશ્રી (મેનેજિંગ ડાયરેક્ટર) - રજનીકાંત પારેખ, ખજાનચી - નવીનભાઈ મોમાયા.
- ★ સોસાયટીની કારોબારી સમિતિના સભ્ય કાંતિલાલ આર. શાહ નાદુરસ્ત તબિયતના કારણે પોતાનું રાજીનામું મોકલાવેલ હતું જેને મંજૂર કરવામાં આવ્યું હતું અને તેમની બાકી રહેતી મુદ્દત માટે કારોબારી સમિતિના સભ્ય તરીકે ડૉ. કેતન શાહની નિમણુંક કરવામાં આવી હતી.

ઉપરિયત સભ્યોનો આભાર માનીને સભાને બરખાસ્ત થયેલ જહેર કરવામાં આવી હતી.

મંત્રીશ્રી : રજનીકાંત પારેખ

તબીબી સાધનો વપરાશ માટે આપવાની યોજના

શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર નીચે મુજબના તબીબી સાધનો દૈનિક ભાડાના ધોરણે મળી શકશે. જેઓને આ સાધનોની જરૂરિયાત હોય તેઓ શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર ફોન : ૨૬૫૭૮૮૮૨ / ૨૬૫૮૧૫૦૧ પર સંપર્ક સાધી શકશે.

૧. એર બેડ	રૂ. ૧૦/-	૫. વોકર	રૂ. ૨/-	૬. બેડ પાન	રૂ. ૨/-
૨. ઝીલ ચેર	રૂ. ૩/-	૬. વોકિંગ સ્ટીક	રૂ. ૧/-	૭૦. ફાઉલર બેડ	રૂ. ૧૦/-
૩. ઓક્સિજન સિલિન્ડર (નાનો)	રૂ. ૫/-	૭. ક્રોડ ચેર	રૂ. ૩/-	૭૧. ટેબલ ટોપ (ફાઉલર બેડ માટે)	રૂ. ૨/-
૪. નેટ્વુલાઈઝર	રૂ. ૫/-	૮. સેલાઈન સ્ટેન્ડ	રૂ. ૨/-	૭૨. ઈલેક્ટ્રિક ઓક્સિજન મશીન	રૂ. ૫૦/-

નોંધ : (૧) સ્ટોકમાં હશે ત્યાં સુધી આ સાધનો ડીપોઝિટ આપીને ભાડેથી મેળવી શકશે. (૨) સાધનો પાલડી ભવન પરથી લઈને ત્યાં જ પરત કરવાના રહેશે.

પ્રદીપ સુરજલાલ મહેતા - માન્ડ મંત્રી, શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કષ્ણી જૈન સેવા સમાજ - અમદાવાદના સભ્યો તથા નિયાણી બહેનો માટે ખાસ સૂચના

સભ્યશ્રીઓએ પોતાના મેડિકલ કાર્ડ પ્રાપ્ત કરી લેવા અંગે....

આ સાથેની યાદી મુજબ, સમાજના સભ્યો તથા નિયાણી બહેનોના મેડિકલ કાર્ડ ઘણા સમયથી તૈયાર કરીને શ્રી કષ્ણી જૈન ભવન - પાલડી ખાતે રાખવામાં આવ્યા છે. અતેથી વારંવાર જાણ કરવા છતાં, તેઓ પોતાનું મેડિકલ કાર્ડ પ્રાપ્ત કરવા આવ્યા નથી. આથી આવા સભ્યશ્રીઓને ખાસ જણાવવામાં આવે છે કે તેઓએ પોતાના મેડિકલ કાર્ડ તા. ૩૦-૦૪-૨૦૨૧ સુધીમાં પ્રાપ્ત કરી લેવા. ત્યારબાદ તેઓના કાર્ડ રદ ગણવામાં આવશે. અતે જણાવાયેલ સમય મર્યાદા બાદ તેવા સભ્યશ્રીઓ કાર્ડ માટે આવશે તો નવેસરથી રૂ. ૫૦/- ભરીને મેડિકલ કાર્ડનું ફોર્મ ભરવું પડશે, જેની નોંધ લેવા અનુરોધ છે.

કન્વીનર - મેડિકલ કાર્ડ સમિતિ

મેડિકલ કાર્ડ પ્રાપ્ત કર્યા નથી તેવા સભ્યશ્રીઓની યાદી...

૧. વિશાળ શૈલેષ રાંભિયા	૨૭. દીપક કાંતિલાલ મહેતા	૪૨. આશિષ વાડીલાલ શેઠ
૨. અરુણ સુરેન્દ્ર જૈની	૨૮. ધર્મેશ રમણીકલાલ મહેતા	૪૩. જુલીબેન મનિષકુમાર શાહ (નિયાણી)
૩. પ્રદીપ શાંતિલાલ શાહ	૨૯. વિમલ મનસુખલાલ મહેતા	૪૪. મિતેશ હસમુખલાલ મહેતા
૪. દિક્ષીતા નિકુલ ઠક્કર (નિયાણી)	૩૦. ફાલ્ગુની કમલેશ શાહ	૪૫. અમીત મહેન્દ્રભાઈ દોશી
૫. નીપેશ જ્યદુકુમાર શાહ	૩૧. વિમલ મનસુખલાલ મહેતા	૪૬. નયનાબેન કમલભાઈ શાહ
૬. મૂકેશ હીરજી કારાણી	૩૨. ડૉ. સુશીલ ચુનીલાલ શાહ	૪૭. કેવાસ દલીયંદ મહેતા
૭. વૈશાલી અજ્ય ગાંધી (નિયાણી)	૩૩. પરેશ શાંતિલાલ મહેતા	૪૮. ચંદ્રકાંતભાઈ મગનલાલ ઢીલા
૮. ઈલેશ નગીન શાહ	૩૪. યોગેશ કિશોરભાઈ અદેલા	૪૯. પિયૂષ ભોગીલાલ શાહ
૯. હરભયંદ નાનજી શાહ	૩૫. હેમલ પ્રવીણભાઈ દોશી	૫૦. ભારતીબેન દૂધતભાઈ અદાણી
૧૦. પ્રભુલાલ કેશવલાલ શાહ	૩૬. પ્રતીક ભોગીલાલ સાવલા	૫૧. જ્યંતીલાલ ભવાનજી સંગોઈ
૧૧. દર્શન રાજેન્દ્ર શાહ	૩૭. વાડીલાલ છગનલાલ શાહ	૫૨. કેવલભાઈ કાંતિલાલ શાહ
૧૨. દીપેશ જ્યયયંદ શિયાડ	૩૮. વાસંતીબેન ગૌતમભાઈ શાહ (નિયાણી)	૫૩. દીપક કાંતિલાલ શાહ
૧૩. સંજ્યભાઈ લક્ષ્મીયંદ કારાણી	૩૯. માનુસીબેન સમીરભાઈ શાહ (નિયાણી)	૫૪. રાહુલ નટવરલાલ શાહ
૧૪. પ્રતિબેન રમેશભાઈ અદાણી (નિયાણી)	૪૦. રાકેશ ધીરજલાલ સંઘવી	૫૫. કવિતાબેન રાયયંદ જૈન
૧૫. હરેશ ધીરજલાલ ઝોટા	૪૧. પ્રવીણ કાંતિલાલ શાહ	૫૬. પુષ્પાબેન મંગલદાસ શાહ
૧૬. સૂર્યકાંત ધરમશી શાહ	૪૨. વિરલ મહેન્દ્ર મહેતા	૫૭. મીતાબેન મિલનભાઈ શાહ (નિયાણી)
૧૭. મીનલબેન પ્રતીક સંઘવી (નિયાણી)	૪૩. જાગૃતિબેન ચંદ્રશીલ મહેતા (નિયાણી)	૫૮. પૂજાબેન રાહુલભાઈ શાહ (નિયાણી)
૧૮. હસમુખભાઈ ખીમજી મહેતા	૪૪. દિલીપકુમાર જ્યંતીલાલ પટવા	૫૯. આસુતોષ ધરમશી સંઘવી
૧૯. સુરેશ લહેરયંદ કોઠારી	૪૫. પંકજબેન કનેયાલાલ મહેતા	૬૦. અશોક ભોગીલાલ શાહ
૨૦. સુરેશ ચીમનલાલ સંઘવી	૪૬. રાગ્નાણીબેન અમીતભાઈ શાહ (નિયાણી)	૬૧. જિતેશ વિજયભાઈ મોતા
૨૧. દિમીબેન માનવ શાહ (નિયાણી)	૪૭. કાંતિલાલ નથુભાઈ સંઘવી	૬૨. મણિકાંત વેરશી શાહ
૨૨. હરીશ પ્રેમજી સાવલા	૪૮. પ્રભુલાલ રાધવજી વોરા	૬૩. નિખિલ બિપીનભાઈ પટવા
૨૩. લલીત જ્યંતીલાલ રાંભિયા	૪૯. રાજેન નરેન્દ્ર શાહ	૬૪. પ્રતીક મનસુખભાઈ ગાંધી
૨૪. મૂકેશભાઈ મુળજીભાઈ સાવલા	૫૦. ચંદ્રેશ પ્રભુલાલ શાહ	૬૫. મોહિત અરુણકુમાર શાહ
૨૫. હિતેશ પ્રભુદાસ મહેતા	૫૧. ભરત ઉગરયંદ ગઢેયા	
૨૬. ભાવિક ભરત મહેતા		

વર્ષ ૧૯૮૮થી આજા ભારતાં લોશટીક સોલ્યુશન આપતી કંપની



આમારી વિશેષતાઓ - સિંગાળ વિનડો લોટફોર્મ

- VT/VX ની ૮૫૦+ શાખાઓ
- ISO 9001:2015 પ્રમાણિત કંપની
- Robust Systems & Processes પર કાર્યરત
- Trace & Track Facility સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ નેટવર્ક
- લુકીંગ થી ડિલીવરી સુધી સામાને Complete Insurance Cover
- ૧૦ કિલોથી કુલ ટ્રક લોડ સુધીના પાર્સલ ટ્વીકારીએ છીએ
- ૧૦૦૦૦૦+ સંતુષ્ટ ગ્રાહકો
- Hard Freight Surface Transportation માં ફ દાયકાનો અનુભવ
- રોડ, એર અને રૈલસ દ્વારા Door to Door Express Cargo
- વિસ્તૃત થઈ શકતી Supply Chain & Inventory Management



[Our other Divisions](#)



આ પુસ્તકોનાં
પ્રાપ્તિસ્થાન

ગુજરાતી ગુજરાતી કાર્યાલય



ગુજરાતી સાહિત્યભવન

રાનાધેણાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ - 380 001
ફોન : 079-22144663.
e-mail : goorjar@yahoo.com

ગુજરાતી

સાહિત્ય પ્રકાશન

102, બેન્ડમાર્ક વિલ્ડિંગ,
ઘર્ટટેરિયમ રિટીર્નેન્ટ પારે,
ચીમા હોલની સામે, અમદાવાદ-15
ફોન : 26934340, મો. 9825268759
ઈમેલ : gurjarprakashan@gmail.com

If undelivered please return to :

શ્રી કચ્છી કેન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કચ્છી કેન ભવન,

૪૩-૪૪, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,
નવચેતન હાઈસ્કૂલની સામે, પાલડી - એલિસબ્રિજ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.
ફોન : (૦૭૯) ૨૬૪૭ ૮૮૯૨, ૨૬૪૮ ૧૫૦૧

To,

મોહમ્મદ માંકડ	
જીવનના કોઈપણ ક્ષેત્રમાં તમે ‘સફળતા’ પ્રાપ્ત કરી શકો છો	280

રોહિત શાહ



શ્રી લલિતપ્રભ

જીવન જીવનની કણી	235
74 પ્રેરણાત્મક વાર્તાઓ	100
જીવન-ઘડતર શ્રેષ્ઠી પુ. ૬	182
વેરભાવ છોડો, ક્ષમાભાવ કેળવો	25
તશાવમુક્ત આનંદી જીવન જીવો	45
હુમેશાં પ્રસન્ન રહો	35
કોધથી મુક્તિ મેળવો	45
અહેંકાર છોડો, નમૃતા અપનાવો	35
ચિંતા છોડો, આનંદથી જીવો	50
સફળ જીવનનાં સોનેરી સૂત્રો	120

Life Moulding Series

(Books-6)	182
Spread Happiness	30
Say Goodbye to Conceit	30
Say Goodbye to Stress	30
Say Goodbye to Anger	30
Say Goodbye to Worry	40
Say Goodbye to Enimity	22

શ્રી ચંદ્રપ્રભ

સફળતાની સોનેરી ચાવી	140
મનનાં પાપ ધોવા શું કરશો ?	100
સફળતાનો શ્રોંકટ	240
જીવન સફળ બનાવવા ધ્યાનથી જીવો	125
જીવનમાં સફળતા મેળવો 100 %	210

જીવનમાં અને વ્યવસાયમાં સફળતા માટેનું માર્ગદર્શન આપતાં પુસ્તકો

ડૉ. હર્ષદ વી. કામદાર

સુખી થવાનું તમારા હાથમાં જ છે	50
સદાય સુખમાં રહો	60
ચાલો, સુખ નામના પ્રદેશમાં	60
શેરબજારમાં સફળ થવાના 25 મહામંત્રો	125
શેરબજારનું ટેકનિકલ	

એનાલિસિસ સમજ જત મેળવો

શેરબજારના ફન્ડામેન્ટલ

સિદ્ધાંતો જાડો સફળ બનો

જ્ય ઓગ્રા



મનહર ઓગ્રા

ધર્મનો મર્મ	50
જીવી જાણો	50
સમજજા	50
પરિવર્તન	50
પ્રસન્નતા	50
જત નક્કી	50
ગેરસમજ	50



હસમુખ પટેલ

પોતાનું એવરેઝ	90
સિદ્ધાંતોની પ્રયોગશાળા	90
યૌવનની અનંત્યાત્રા	90
વ્યક્તિત્વનો વ્યોમવિહાર	120
નિલેશ મહેતા	

વિજ્યાનું વરદાન મોટિવેશનના માર્ગ

તમારી કારકિર્દિને પાંખો આપો

175

180